

કુદરતી ઉપરાંતી કમાલ



શ્રી ગોમ. પી. પટેલ કૃતિકેશાળ પ્રદાનિાળ

કુદરતી ઉપયાર એટલે શું?

ખાંધેલો આહાર પાચનતંત્રમાં પણ્યા બાદ શરીરમાં અંગોના કોષેમાં આત્મસાતું થાય છે, કોષેની જીવનક્રિયાથી તે બળે છે, તૂટે ફૂટે છે અને તેથી વિષદ્રવ્ય તૈયાર થાય છે. લાખો કોષેના ભરવાથી, આહાર-સંયોજન નિયમો તથા સ્વારથ્ય સંબંધી નિયમોનો લંગ કરવાથી, તમાડું અને ઝેરી દ્વારાના સેવનથી તથા ધર્ષા, દ્રોપ, ભય, ચિંતા, કોધ વગેરે દૂષિત માનસિક વૃત્તિઓથી શરીરમાં વિષદ્રવ્ય તૈયાર થાય છે. મૂત્રપિંડ, ફેફસાં, યકૃત તથા પરસેવાની અંધિઓ આ વિષદ્રવ્યને શરીરથી બહાર ફેંકતાં રહેતા હોય છે. આ મળોત્સર્ગ કરનારાં અંગો ચેતાશક્તિ (Nerve energy) વડે કામ કરે છે. જો આપણી ચેતાશક્તિ ઓછી થઈ જય તો આ અંગો પોતાનું કામ સારી રીતે બળવી શકે નહિ. ઉપરનાં કારણોથી વિષદ્રવ્ય બહુ વધારે પ્રમાણમાં તૈયાર થાય છે અને ચેતાશક્તિનો પણ અપવ્યય થાય છે. આવી સ્થિતિમાં આપણું મળવિસળજું અંગો વિષદ્રવ્યને પૂરેપૂરો બહાર ફેંકવામાં અસમર્થ બની જય છે, એટલે વિષદ્રવ્ય શરીરમાં એકત્ર થવા લાગે છે. કુદરતી ઉપયારકેના મત પ્રમાણે શરીરમાં વિષદ્રવ્ય એકત્ર થવાની બાધ્યતને જ રોગ કહેવામાં આવે છે. શરીર અમુક હુદ્દ સુધી જ વિષદ્રવ્યનું પ્રમાણું સહન કરી શકે છે. શરીરમાં જો વિષદ્રવ્યનું પ્રમાણ આ હુદ્દ કરતાં વધી જય તો શરીર જાડા, શરહી, સલેખમ, તાવ વગેરે દ્વારા આ વિષદ્રવ્યને બહાર ફેંકવાનું જડપથી શરૂ કરી હે છે. આવી શુદ્ધિકરણની પ્રક્રિયા(તીવ્રરોગ-Acute disease)ને ઝેરી દ્વારા લઈ વારંવાર રોકવામાં આવે તો શરીર થાકી જય છે. અને દરરોજ

(અનુસંધાન ટાઇટલ ૩ ઉપર)

શ્રી એમ. પી. પટેલ ફ્લાઉન્ડેશન
‘જીવનધર્મતર પ્રકાશન આણ્ણી’ની નવમી લેટ

કુદરતી ઉપયારની સરળતા તથા સાર્થકતા પુરવાર
કરતાં જીવંત ઉદ્ઘારણાથી પરિપૂર્ણ પુસ્તક


કુદરતી ઉપયારની કમાલ

સંપાદક : શ્રી. વી. પી. ગિદ્વાણી

રનેહો શ્રી.....

કુદરતી ઉપયાર દારા રોગ નિવારણ માટે ગ્રેરણાદાયી
માર્ગદર્શન પૂરું પાડતું આ અમૃત્ય પુસ્તક આપના પરિવારને
ઉપયોગી બની રહેણી એવી શુભ કામનાઓ સહ.....

સંપ્રેષણ
મંગળભાઈ પી. પટેલ
મુકેશ એમ. પટેલ



શ્રી એમ. પી. પટેલ ફ્લાઉન્ડેશન પ્રકાશન
‘મીના’, ૬, સરદાર પટેલ ફોલોની, નવજીવન,
અમદાવાદ-૩૮૦ ૦૧૪ ફોન : ૪૪૦૮૧૦; ૪૪૮૫૬૪

- श्री अम. पी. पटेल फॉन्डेशन
ज्ञवनधडतर प्रकाशन श्रेष्ठीतुं नवमुं प्रकाशन
- कुक्करती उपचारनी कमाल
- संपादक : श्री वी. पी. गिरवाणी
- ⑤ प्रा-योग ट्रस्ट
२, नालंदा सोसायटी, रेखवे कोसिंग पासे,
अमहावाढ-३८० ०१३
- प्रकाशन वर्ष : अगस्ट, १९८७
- मूल्य : सहभाव-सुवाचन-सहउपयोग
- प्रकाशक :
श्री अम. पी. पटेल फॉन्डेशन वती भूक्तेश अम. पटेल
'मीना', ६, सरहार पटेल कोलानी, नवगुवन,
अमहावाढ-३८० ०१४.
- प्रकाशन आमोजन : कुसुम पण्डिकेशन्स, अमहावाढ-३८० ००७
फ़ैन : ४९०६५६
- आवरण : भयूर जानी
- मुद्रक :
हिंद्योम् प्रिन्टरी,
दूधेश्वर रोड, अमहावाढ-३८० ००९

પ્રકાશકનું નિવેદન

પ્રત્યેક માનવી ધર્મથો હોય છે કે પોતે નીરોગી રહે; પરંતુ કુદરતના નિયમોનું ઉલ્લંઘન કરવાથી, આહારવિદ્ધારમાં અનિયમિત અનવાથી તે અનેક રોગોનો જોગ થઈ પડે છે અને તેમાંથી મુક્ત થવા તે દવા અને દાક્તરને શરણ જય છે. દવાથી પ્રારંભમાં રોગ દ્વારા જય છે પણ તે દૂર થતો નથી. રોગને જરૂરીની દૂર કરવાનો જો કોઈ બ્રેઝ ઉપયોગ હોય તો તે છે કુદરતી ઉપયાર. કાંઈજિયાતથી માંડીને ડેન્સર સુધીનાં દર્દો કુદરતી ઉપયારથી કેવી રીતે મટાડી શકાયાં તેનું સુંદર આલોઘન કુદરતી ઉપયારક શ્રી વી. પી. ગિદ્વાણી સંપાદિત આ પુસ્તકમાં થયું છે.

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન તરફથી ૧૯૮૩ થી શરૂ કરેલી જીવનલક્ષી શ્રેણીને મળેલા ઉભાલર્યા આવકારથી પ્રેરાઈને આ જ શ્રેણીમાં ‘કુદરતી ઉપયારની કમાલ’ નામનું આ પુસ્તક પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

આ પુસ્તક પ્રગટ કરવાની અનુમતિ આપવા અહલ શ્રી વી. પી. ગિદ્વાણીના અમે અત્યંત આભારી છીએ.

આ પુસ્તકના પ્રકાશન-આયોજન પાછળ લીધેલ પરિશ્રમ અહલ અમારા સ્નેહી મિત્ર શ્રી મુકુંદ પી. શાહનો આભાર માનીએ છીએ.

આ પુસ્તક સંખ્યાઓનાં રચનાત્મક સૂચનો આવકારીશું.

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન
‘મીના’, ૬, સરદાર પટેલ કોલેની,
નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪

મંગળભાઈ પી. પટેલ
ભૂકેશ એમ. પટેલ
૧૩ મી ઓગસ્ટ, ૧૯૮૭

અનુકૂળ

૧. હાઇપર એસિડિટી, સંધિવા, અનિદ્રા, દાઢર, બહેરાશ	
૨. વાતરોગ	૧
૩. પાચનતંત્રના રોગ	૨
૪. અલ્સર	૨
૫. ચક્કર આવવાં	૩
૬. ટાઈફ્લાઇટ	૩
૭. મધુમેહ (ડાયાબિટીસ)	૪
૮. મેલેરિયા	૪૬
૯. કમળો (પાંડુરોગ)	૫૧
૧૦. આંખનો રોગ	૫૩
૧૧. કથજિયાત	૧૭૦
૧૨. કેન્સર	૮૧
૧૩. બહેરાશ, લોહીનું નીચું દાખાણું, જામર, મેલેરિયા, દાંતના રોગ, સરૈદ કોઠ	૮૧
૧૪. પાચનતંત્રના રોગ (ડી. બી.)	૮૪
૧૫. રંઝણ	૧૦૧
૧૬. દર્ઘિની કમળેરી અને ચામડીના ડાખ	૧૨૬
૧૭. વજન ધટાડવું અને ડાયાબિટીસ	૧૨૮

આ પુસ્તકમાં વણુંવેલ કુદરતી ઉપયારના પ્રયોગો કરતી વખતે દર્ઘીઓએ કુદરતી ઉપયારના નિષ્ણાતની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

[૧]

હાઇપર એસિડીટી, સંધિવા, અનિદ્રા, દાદર, બહેરાશ

● નવીનસાઈ શાહ

‘પહેલું સુખ તે જાતે નર્યો’ આ એક જાણીતી કહેવત છે. સાચું સુખ નીરોગી શરીરમાં સમાચેલું છે. શરીર નીરોગી ન હોય તો જીવન લારડ્ય અને નિરસ લાગે છે. હાલ મારી ઉંમર પર વર્ષની છે. યુવાવસ્થા સુધી મારું શરીર નીરોગી હતું. માધ્યમિક અભ્યાસકાળની વયમાં એટલે કે લગભગ ૧૫ વર્ષની ઉંમરથી કણજિયાત, ગેસ તેમજ કોઈ વખત છાતીની બળતરાની તકલીફ હતી. શેકેલા ચણું અને કઠોળ ખાવાનો ખૂબ શોઅ હતો. ડિંગાણ્ટક ચૂણું ઝાકીએ એટલે ગેસ તેમજ છાતીની બળતરામાં રાહત થઈ જતી હતી. આથી ધરમાં કાયમ ડિંગાણ્ટક ચૂણું રહેતું હતું. યુવાનીના જેશમાં વર્ષો સુધી આ બાખે હુર્દક્ષ સેંધું. છેવટે ૪૫ વર્ષની ઉંમરે આ તકલીફ તીવ્ર રાહુમાં પરિણમી, જેને હાઇપર એસિડીટી કહેવામાં આવે છે. ગેસની તકલીફ પણ ચાલુ જ હતી. દ્વિસ અથવા રાત્રિમાં ગમે ત્યારે ગમે તે સમયે છાતીમાં

દાહ જિપડે. દાહની પીડા એટલો બધી તીવ અને અસહ્ય હતી કે આંખમાંથી આંસુ આવી જય. હું સાખરમતીમાં કાપડ વેગવાનો વ્યવસાય કરું છું. હુકાને હોલ્ડ અને છાતીમાં દાહ જિપડે ત્યારે પાંસળી નીચે હાથથી દખાવી પડજે પંદર-વાસ મિનિટ પડયો રહું ત્યારે કાંઈક શાંતિ વળે. મધ્યરાત્રિમાં રાત્રે બાર વાગે દાહ જિપડે ત્યારે સૂતેલા જળી જવું પડે અને પથારીમાંથી જિલા થઈ જવું પડે. દ્વાધ હોય તો ટીક, નહિ તો એત્રણું જ્યાલા પાણું પીને બંગલાની લોણીમાં અધી કલાક ચાલતો, ત્યાર બાદ દાહ શાંત થાય ત્યારે જ સૂર્ય શકતો હતો. એલોપથીની લાંબા સમય સુધી દવા કરી. ડોકટરોએ વ્યાયામ કરવાની મનાઈ કરી એટલે વ્યાયામ બંધ કર્યો. મેળેશિયમની ટીકડીએ. અને ડાઈલન લિકવીડ વગેરે દવાએ. ત્રણ-ચાર વર્ષ સુધી કરી. ત્યાર બાદ હોઠ વર્ષ સુધી સવાર-સાંજ ત્રિકળા ચૂણું પણ લીધું, પરંતુ આસ કંઈ આરામ થયો નહિ.

એસિડીટીની સાથે સાથે સંધિવા પણ ધીરે ધીરે શરૂ થયો. લગભગ પાંચેક વર્ષ પહેલાં ખસાના સાંધામાં હુઃખાવો શરૂ થયો, ત્યાર બાદ પગની એડીમાં હુઃખાવો થયો. સવારે જડીએ તો જમીન પર પગની એડી મંડાય નહિ. ત્યાર બાદ દ્વુંટણુના સાંધામાં તીવ હુઃખાવો શરૂ થયો. ચાલવામાં તેમજ સાઈકલ ચલાવવામાં તકલીફ પડે. એક રોગ બીજ રોગને નિમંત્રે છે. એ પ્રમાણે ચર્મરોગનો પણ ઉમેરો થયો. બંધ વચ્ચે અંડકોશની પાસે

જ્ઞાઈપર એસિડીટી, સંધિવા, અનિદ્રા, દાદર, બહેરાશ ઊ

દાદર પ્રકારની ખુજલી વર્ષમાં ખેત્રણું વખત થાય. સખત ખંજવાળ આવે અને પાણી પણ જમે. ખણુવાથી ચાંદી પણ પડી જાય. શરમ આવે તેવી રીતે પહોળા પગ કરીને ચાલવું પડે. ગમે તેવી વ્યક્તિની હાજરીમાં પણ ઐશરમ બની ખંજવાળવું પડે પાંચ-સાત વર્ષથી આ રોગ પણ લાગુ થઈ ગયેલો. વિવિધ પ્રકારની રૂચિઓ અને એન્ટી-આયોટિક્સ પાઉડરો લગાવ્યા. કામચલાઉ રાહત થાય પણ સંપૂર્ણપણે મટે નહિ.

કટોકટી આવી. કટોકટીના માનસિક ત્રાસે અનિદ્રાની લેટ આપી. ત્યારથી અનિદ્રાની તકલીફનો પણ ઉમેરો થયો. રાત્રે ગાઠ નિદ્રા આવે નહિ અને ઘડિયાળના ટકેરા ગણુવા પડે.

બાળપણુથી જ એટલે કે આઠ-દશ વર્ષની ઉંમરથી જ ખંને કાનમાં પડુ આવે અને ડાખા કાનમાં બાળપણુથી જ બહેરાશ. બીજ જમણ્ણા કાનમાં વીસેક વર્ષ પહેલાં ઓચિંતો પડ્યો ફાટી ગયો. ચાર દિવસ સ્થાનિક ડોક્ટરની દ્વારા કરી પછી અમદાવાદમાં કાનના સર્જનને અત્યારું. તેમણે નિદાન કર્યું કે પડ્યામાં કાળું પડ્યું છે. કાનમાં સતત પડુ આય્યા કરે. અમદાવાદમાં કેટલાયે સર્જનોને અત્યારું. અનેક દ્વારાઓ કરી પરંતુ કોઈ જ ફરજ ન પડ્યો. ત્યારણાં આજથી લગલગ પંદર વર્ષ પહેલાં ડાખા કાને ડોક્ટર એ. બી. આર. હેસાઈના હાથે સુંબદ્ધમાં પડ્યો નવો એસાડવાનું ઓપરેશન કરાયું. લગલગ ૬૦૦ રૂપિયા ખર્ચ થયું પરંતુ ઓપરેશન અસરી રહ્યું. કાનમાં સતત પડુ

આવ્યા કરે, કાનમાંથી પડુ વહીને બહાર નીકળો, દ્વિસમાં ચારપાંચ વખત કાન સાઝે કરવો પડે. કાનમાં પડુ બંધ થાય તે માટે અનેક સર્જનોની દવા કરી, તાત્કાલિક રાહત થાય પણ પાછું યથાવત्. દસેક વર્ષ પહેલાં ઇરી મુંબઈ મારા સંબંધી સર્જન છે, તેમને બતાવ્યું. તેમણે વીસેક દ્વિસનો કોર્સ લખી આપ્યો. કોર્સ ચાલુ હતો ત્યાં સુધી થોડા પ્રમાણમાં રાહત થઈ. લગભગ બસો ઇપિયાની દવા કરી, પરંતુ કોર્સ પૂરો થયા પછી પહેલાં હતું તેના કરતાં અમણું પડુ આવવા માંડ્યું. એટલે તે દવા બંધ કરી. પાકીટમાં રૂ તેમજ સળી કાયમ રાખવાં પડે. દ્વિસમાં ઓછામાં ઓછું ઐત્રણ વખત કાન સાઝે કરવો પડે. રસ્તામાં પણ પડુનો ખાવ વધારે થાય અને કાન ભરાઈ જય તો રસ્તામાં ઊભા રહીને પણ કાન સાઝે કરવો પડે. કાનમાં સતત પડુ આવતું હોય અને સંલગ્નાય નહિ ત્યારે વાતચીતમાં ઘણું વખત રમૂજ ગેરસમનો ઉત્પન્ન થાય. હાસ્યની છીણો. ઉડે અને હાસ્યનું પાત્ર બનીએ. કોઈક વખત સંલગ્નાય, કોઈ વખત ન સંલગ્નાય એટલે દરેક વ્યક્તિ મારી કાનની ન સંલગ્નાવાની તકલીફને જુદી જુદી રીતે માન્ય-અમાન્ય કરે. કાને સંલગ્નવા માટે 'હીયરિંગ એર્ડ' પણ લાવ્યો. હતો, પરંતુ તે પણ અનુકૂળ ન આવી.

કાનની તકલીફ, અનિદ્રાની તકલીફ, સંધિવાની તકલીફ, દાદરની તકલીફ, તેમજ હાઈપર એસિડીટીની તકલીફ એ બધાંને કારણે કંઈક અંશો જીવન ઉપર નિરાશા

હાઈપર એસિડીટી, સંધિવા, અનિક્રા, દાદર, બહેરાશ પ

આવી. સંધિવાના કારણે ચાલી ન શકાય તો કાર્ય કેવી રીતે થઈ શકશે? નિષ્ક્રિય થઈને એસી રહેવું પડે તે તો એક પ્રકારની સજ જેવું થાય. સામાજિક કાર્યકર હોવાને કારણે મારા માટે આ એક મોટી ચિંતા હતી. તેથી ત્રણેક વર્ષ પહેલાં મારા છીંબીસ વર્ષ જુના સંખાંધી એવા શ્રી ગિફવાણીજી સાથે મિત્રભાવે મારી બધી જ તકલીફ વિષે વાતચીત કરી. શ્રી ગિફવાણીજીને કુદરતી ઉપચારનું જ્ઞાન લાધ્યું હતું. પહેલાં વારંવાર મળતા હતા. તેએ કુદરતી ઉપચારને અનુસરવાની સલાહ આપતા હતા. પરંતુ હું તેમની વાતને હસી કાઢતો હતો. તેમની કુદરતી ઉપચારની વાતો એક કાને સાંલળી બીજ કાનેથી કાઢી નાંખતો. તેમ છતાં શ્રી ગિફવાણીજીએ બહુ જ પ્રેમથી વૈજ્ઞાનિક આધારે આપી જોંડાણુથી કુદરતી ઉપચાર વિષે સમજળયું. હું પણ મારી તકલીફીથી થાકચો હતો. તેમણે કુદરતી ઉપચારની સલાહ આપી, અને આનપાન તેમજ રહેણીકરણીમાં ફેરફાર કરવાનું કહ્યું. મેં તેમની વાત સ્વીકારી. ત્રણ વર્ષ પહેલાં પત્ની બાળકો સાથે ઉનાળાની રણઓમાં પિયર ગઈ ત્યારે છાનામાના દોઢ માસ સુધી કુદરતી ઉપચાર અનુસાર આહારનું સંપૂર્ણપણે પાલન કર્યું, અને દોઢ માસના અંતે મહિને અંશે એસિડીટીમાં ફ્રાયદો થયો, સંધિવામાં પણ પચાસ ટકા ફ્રાયદો થયો.

સવારે આઠ-નવ વાગે પચાસ પૈસા અથવા સાઠ ચૈસાનાં ત્રણુ-ચાર કેળાં ખાઈને સવારનો નાસ્તો કરતો.

અપોએ બાર વાગે જમતી વખતે લોજનમાં સો થામ પાલખ અથવા મેથીની લાળ અથવા મૂળાનાં પાંદડાં ખાતો. આ સાથે ત્રણુસો થામ કાકડી, ગાજર અથવા કોણીજ કાચી જ રોટલી સાથે ખાતો. ખાઈને અધો કલાક આરામ કરતો હતો. સાંજે પાંચ વાગે કકડીને ભૂખ લાગે ત્યારે ઝીરી સાડે પૈસાનાં ત્રણુ કેળાનો નાસ્તો કરતો. રાત્રે આઠ વાગે લોજનમાં ૧૦૦ થી ૨૦૦ થામ મેથી, પાલખ અથવા મૂળાની લાળ, ત્રણુસો થામ ગાજર, કાકડી અથવા કોણીજનું કાચું શાક ખાતો. સાથે કોરી રોટલી પણ ખાતો. રોટલી એકરસ થઈ જય તેવી રીતે ખૂબ જ ચાવીને ખાતો હતો. ખોરાકમાં કોઈ જ પ્રકારની ખટાશ નાખતો ન હતો. રાત્રે દસ વાગે શાંતિથી સૂઈ જતો. દોઢ માસ સુધી ઉપર પ્રમાણું ખોરાકમાં ફેરફાર કર્યો અને આશ્ર્યકારક પરિણામ મળ્યું. એક સવા મહિનામાં એસિડીટી સંપૂર્ણ મરી ગઈ. સંધિવા અને અનિદ્રામાં લગભગ પચાસ ટકા ફાયદો થયો. આથી કુદરતી ઉપયાર ચાલુ રાખવાનો નિશ્ચય કર્યો. પતનીના આંધ્રા પછી તેને મારા નિર્ણયની જાણ કરી, પરંતુ લોકો જુની રૂઢ માન્યતાએ અને આધુનિક ખાનપાનની પદ્ધતિથી ટેવાયેલા હોવાને કારણે મારી આ કુદરતી ઉપયારની વાત કોણુ માને? દ્રોધ, ધી વગર શક્તિ કેવી રીતે આવશે? લુખ્ખું લુખ્ખું ગળે કેવી રીતે જિતરે? લાળ કાચી કેવી રીતે લાવે? ફળ અને શાક ઘડુ મેંધાં પડે. તમારા માટે જુહું આવા બનાવવા માટે સમય વધારે બગડે-આવી વિવિધ પ્રકારની ફ્લીલોનો સતત મારો ચાલ્યા કરે. આં

વાતાવરણમાં પણ સંધર્ષ સહિત મનોબળ મક્કેમ રાખી કુદરતી ઉપયાર અનુસાર ઓરાક ચાલુ રાખ્યો. શોકેલા ચણુા, કઠોળ, ફરસાણ અને ફ્રાંધ, ધી આ બધું જ પ્રિય હતું. પરંતુ તે બધું જ છોડયું. ચા, કોઝી જીવનભર નહિ પીવાનો સંકદ્વય કર્યો. એક વર્ષ સુધી સંપૂર્ણપણે કુદરતી ઉપયાર અનુસાર ઓરાક ચાલુ રાખ્યો. હાલ પણ મહાદ અંશે કુદરતી ઉપયાર અનુસાર ઓરાક ચાલુ છે. હવે તો એસિ-ડીટી કેવી હતી એ જાણે ખબર જ નથી. સંધિવા સંપૂર્ણ-પણે ચાલ્યો ગયો. ચર્મરોગ પણ સંપૂર્ણ મટી ગયો. અનિદ્રાની ઇચ્છિયાદ પણ સંપૂર્ણપણે ફર થઈ. કાનમાં સતત પડુ આવતું હતું તેમાં પણ ઉપ ટકા કાયદો થયો. હવે એત્રણ દ્વિવસે એકાદ વખત સહેજ કાન સાફ કરવો પડે છે, પરંતુ પડુ નહિવત.

કુદરતી આહારના સ્વાહમાં અનેરો આનંદ આવે છે. કુદરતે જુદાં જુદાં ફોલોમાં જુદા જુદા પ્રકારના એવા રસ-સ્વાદ મૂકેલા છે, કે મન અને મગજ પ્રકુલ્પિત થઈ જાય. જુદા જુદા પ્રકારનાં કાચાં શાકમાં પણ કુદરતી સરસ સ્વાદો રહેલા છે. આ કુદરતી આહારમાં સ્વાદો માણવાની અનેરી મજા આવે છે. કુદરતે મૂકેલા રસના ઝૂંઝૂંડાનો સ્વાદ માણવાને બહલે આપણે અકુદરતી લેળસેળવાળા અને વિકૃત સ્વાદો તરફ આકર્ષિત એ તે નરી મૂર્ખતા જ છે. હાથછડના ચાખા ખૂબ જ મીઠી લાગે છે. રોટલી ચાવીને ખાવાથી બહુ જ મીઠી લાગે છે. આમ કુદરતી ઓરાક મને સંપૂર્ણ

રીતે અતુકૂળ આવી ગયો છે. કે હજરો ઇપિયાની દવા ખાવાથી ન બને તે ઇકત અકુદરતી રસાસવાદનો મોહ છોડવાથી તથા આનયાનની પદ્ધતિ બદલવાથી બન્યું. કુદરતી ખોરાકના સાત્ત્વિક આહારથી યાદશક્તિ સતેજ બને છે અને જુદ્ધ પણ તીક્ષ્ણ બને છે. જાણે કે શરીરનો કાયાકલ્પ થઈ ગયો. હવે ઘરની બધી વ્યક્તિ તરફથી પણ સહકાર મળે છે. કેટલાક લોકો દ્વારા કરે છે કે ઇન અને શાકભાજી માંથાં પડે છે. પરંતુ આ લૂલી અને પાંગળી દ્વારા એક ઇપિયાની એક કપ ચા, હોઠ ઇપિયાનો સો થામ નાસ્તો, ચાર-પાંચ ઇપિયે લિટરનું હુંધ, પિસ્તાલીસ ઇપિયાનું ૧ કિલોના ભાવનું ધી, વીસ ઇપિયે ૧ કિલોનું તેલ, છ ઇપિયે કિલોનું કઠોળ, રોજના બેત્રણ ઇપિયાનાં બીડી-ભાક્સ અથવા તંબાકુના મસાલા અથવા પાન—આ બધું શું સસ્તું છે? સરવાળો કરીને હિસાબ તો લગાવી જુઓ. કરું પ્રમાણેનાં શાક અને ઇન શુણુમાં પણ શ્રેષ્ઠ હોય છે, અને ટગલાબંધ સસ્તાં પ્રાથ્ય પણ હોય છે. સવાર-સાંજ થઈને એ વખતના કેળાંના નાસ્તાનો ખર્ચ હોઠ ઇપિયો થાય અને તે પણ પેટ ભરીને, એક ઇપિયાથી એ ઇપિયા કિલોના ભાવની કાકડી, સવાર-સાંજ થઈને ૬૦૦ થામ ખાઈએ તો સવા ઇપિયાની કાકડી થાય. અન્ય કાચાં શાકભાજી જેવાં કે કેળીજ, મૂળા, ગાજર પણ કરું વખતે ૫૦ પૈસે કિલોથી માંડી એ ઇપિયા સુધીમાં સારાં અને શુણુવત્તાવાળાં મળી રહે છે. સવાર-સાંજ થઈને ત્રણુસેચારસો થામ ભાજી એક ઇપિયા સુધીમાં મળી રહે. સર-

હાઈપર એસિડીટી, સંધિવા, અનિદ્રા, દાદર, બહેરાશ ૯

વાળો કરીએ તો વધુમાં વધુ લગભગ ચાર ડ્રિફ્ટિયામાં બધું આવી રહે. ઘડ અને હાથછડના ચોખા વધારાના. સામાન્ય રીતે ભાણેલી અને સમજુ વ્યક્તિ પણ સમજી શકે તેવો હિસાબ છે કે કુદરતી ઉપચારનો આહાર કોઈપણ પ્રકારે મૌંદો નથી. અરે! શિયાળાની ઝતુમાં તો કેટલાંક શાક અવારનવાર પચાસ-પંચાતેર પૈસે કિલોના લાવે છૂટથી વેચાય છે. મારો સ્વઅનુભવ છે કે કુદરતી ઉપચારનો ઓચાક અનેકગણો સરસો પડે છે. જે વ્યક્તિ સંયમ કેળવવા તૈયાર નથી અને ચા, નાસ્તો અને આધુનિક સ્વાદોથી ટેવાયેલ છે તેમજ તમાકુ-મસાલાની નશાવાળી ટેવો છોડવાની મનની દફતા નથી તે જ પોતાની નભળાઈએ. ટાંકવા ખાતર જ કુદરતી ઉપચારમાં ઇળ, શાકભાજી મૌંદાં પડે છે તેવી પાંગળી ફલીલ કરતી હોય છે. આ આહારથી પ્રોટિનની જીણુપ અથવા અશક્તિ જેવું કાંઈ જ લાગતું નથી. ખરેખર તો શક્તિ અને સ્કૂર્ટિં વધે છે.

છેલ્લાં ત્રણ વર્ષથી કુદરતી ઉપચાર અનુસાર મારો ઓચાક ચાલુ છે. તે દરમિયાન મેં કંદી કોઈ પણ જલતના જલોપચાર (એનીમા, માટીનો પણો, વરાળસનાન, કટિસનાન વગેરે) કર્યા નથી. મારું વજન પાંચેક કિલો ઘટયું છે, પરંતુ હવે તે સ્થિર છે. ચેટનો મેહ ઘટચો છે. ચેટનો પરિધ ર૩" હતો, અત્યારે પરિધ ર૨૮" છે. એટલે શરીર થોડું પાતળું જડર થયું છે, પરંતુ કામ કરવાની શક્તિ વધી છે. દરરોજ લગભગ ૧૦ કિલોમીટર સાઈકલ ચલાવું

છું અને બુધવારે ઉપ કિલોમીટર સાઈકલ ચલાવું છું. સવારે દરરોજ ૧૫ મિનિટ વ્યાયામ કરું છું. હૃદ, માખણ, ઘી વગેરે કાંઈજ કેતો નથી. જેચાર મિત્રોએ કહ્યું પણ ખરું કે પ્રાણિજ પ્રેટિન વગર નહિ ચાલે, અને અશક્તિ આવી જશે, પરંતુ મારે તો એવું પ્રોટિન ન લેવા છતાં શક્તિમાં, સ્કૂર્ટિમાં વધારો થયો છે. અત્યારે સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સતત કાર્ય કરું છું. પરંતુ કોઈપણ પ્રકારનો થાક લાગતો નથી.

કુદરતી ઉપયારનો આધાર વિજ્ઞાન છે, એટલે કુદરતી ઉપયાર ઉપર આસ્થા વધી છે. મહિદૂ અંશે કુદરતી ઉપયાર અનુસાર ખાનપાન ચાલુ રાખવાનો દઠ વિચાર છે. લેશમાત્ર અતિશયેાક્ષિત વગરનો મારો સ્વ-અનુભવ મેં અહીં વર્ણૂયો છે.

(વૈજ્ઞાનિક સોસાયટી, સાખરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫.)

નેટલું આપણે સ્વાદને અથેર્ ઝાઈએ છીએ, તેટલું આપણા શરીરમાં દશ્ય કે અદશ્ય રીતે કૂટી નીકળે છે; તેટલે દરજને આપણે આપણું આરોગ્ય ગુમાવીએ છીએ અને તેટલે દરજને આપણે દુઃખી થઈએ છીએ.

—ગાંધીજી



[૨]

વातरोग

● રાજકરણસિંહ હાડુરે

તુરત માનવામાં ન આવે એવી આ વાત છે. પરંતુ સો ટકા સત્ય હુકીકત છે. કુદરતી ઉપયાર કેવી કમાલ સળું શકે છે તેનો તાદ્શા પુરાવો છે. તો સાંભળો, મારા ભયંકર દર્દની અને એની નાગચૂડમાંથી મને મળેલી ચમતકારિક મુક્તિની વાત.

અત્યારે મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારું નામ રાજકરણ. હું એમ. કોમ. માં અલ્યાસ કરું છું. મારો જન્મ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના પૂરેનારાયણદાસ નામના ગામમાં થયો હતો. અમારું કુદુરુંબ ઉચ્ચ મધ્યમ વર્ગનું ગણણાય. પિતાજી લગભગ ૨૫ વર્ષથી અમદાવાદમાં રેલવે ખાતામાં નોકરી કરે છે. ઘરમાં પહેલું જ ખાળક હોવાથી દાદાજી ખૂબ લાડ કરતા, ધી-દ્રોધ ખવડાવતા. મને પણ દ્રોધ બહુ લાવતું.

પ્રાથમિક શાળામાં પાંચમા ધીરણુમાં લણુંતો હતો ત્યારની વાત યાદ આવે છે. શાળા ઘરથી એક કિલોમીટર

ફર હતી. સવારે આડ વાગ્યે શાળાએ જવા નીકળતો અને સાંજે છ વાગ્યે પાછો આવતો. ૧૯૭૧ના વર્ષના ચોમાસામાં એક દિવસ સાંજે મને તાવ ચડ્યો. ઘરગઢ્યુ ઈલાજ કર્યો. તાવની સાથે બંને પગનાં ગોઠણોમાં ફુઃખાવો શરૂ થયો. દાદાજીએ હાડવૈદ પાસે ઈલાજ કરાયો. પણ કંઈ ક્ષાયહો થયો નહિ. સરસવના તેલની અને અળસીના તેલની માલિશ કરાવી પણ ફેર પડ્યો નહિ. ચોમાસું ચાલુ રહ્યું ત્યાં સુધી ફર્દી પણ ચાલુ રહ્યું. ચોમાસું પૂરું થયું ત્યારે ફર્દી પણ મટી ગયું.

૧૯૭૨માં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી માધ્યમિક શાળામાં દાખલ થયો. ફરી ચોમાસું આંયું અને પેણું ફર્દી પણ શરૂ થયું. તાવ આંયો અને ત્રણ દિવસ પછી ગોઠણોમાં ફર્દી શરૂ થઈ ગયું. દારૂ, પીસેલું કાચું લસણ વગેરેની માલિશ કરવામાં આવી. પણ કશો ક્ષાયહો ન થયો. ગામના નાનામોટા ડોક્ટરો કહેવા લાગ્યા કે આ તો ઘરડાઓને થાય એવો વાતરોગ છે. એ રોગનો ઉપયાર કરવામાં આંયો, પણ કંઈ ફેર પડ્યો નહિ. ચોમાસું પૂરું થયું એટલે ફુઃખાવો પણ બંધ થયો.

૧૯૭૩ની સાલ. ફરી ચોમાસું એહું અને ફર્દી ચાલુ. ગત વર્ષ કરતાં વધુ ઉથ. ચારેક કિલોમીટર ફર સાંગીપુરના સરકારી દ્વારાનામાં ફર ત્રીજે દિવસે ઈલાજ કરાવવા જતો. આસપાસનાં બીજાં શહેરોમાં પણ ઈલાજ કરાયો, પણ કંઈજ ક્ષાયહો થતો. ન હતો. કુટુંખનાં સૌ ચિંતામાં પડી

ગયાં. દોડવા-કુદવાનું બંધ થયું. કોઈ કામમાં ચિત્ત ચોટે નહિ, અસ્થાસ પણ બરાબર થઈ શકતો ન હતો.

૧૯૭૪માં આડમા ધોરણુમાં આંધો. ગોઠણુમાં દર્દ વધવા લાગ્યું. હુઃખાવો એવો થતો કે ખૂમ પડાઈ જતી. હુરવા-કુરવાનું સુશકેલ અન્યું. જાડા-પેશાખ માટે પણ દાઢાળુ ઉડાડીને લઈ જતા. ઘરથી આઠેક કિલોમીટર ફૂર સુલતાનપુર જિલ્લાના ગૌરીગંજ શહેરમાં ઉપચાર શરૂ કરાયા. ત્રણુ મહિના સુધી વિવિધ દવાઓ લીધી પણ પરિણામ એ આંધું કે પહેલાં ચ્યામાસું પૂરું થયે દર્દ શરીર જતું, તેને પડાવ હવે જન્યુઆરી-કેષ્યુઆરી સુધી ચાલુ રહ્યો. એ વર્ષે લાણુવાનું સાવ બગડ્યું. ગૌરીગંજમાં કંઈ ઝાયહો ન થયો. એટલે પ્રતાપગઢમાં ઉપચાર કરાયો. કોઈ ઝાયહો ન થયો. લખનૌમાં ઉપચાર કરાયો. થ્રોડે ફેર પડયો.

પિતાળુને થયું કે અમદાવાદના કોઈ ડોક્ટર પાસે ઈલાજ કરાવીએ. ૧૯૭૫માં મને અમદાવાદ લાવવામાં આંધો. એ વર્ષના જુલાઈમાં અમદાવાદમાં હિંદી માધ્યમવાળી સ્કૂલમાં નવમા ધોરણુમાં દાખલ કર્યો. થ્રોડ હિવસ પછી હુઃખાવો શરૂ થયો. સાખરમતીના સારા સારા ડોક્ટરો પાસે ઈલાજ કરાયો. એક અડવાડિયામાં ચૌદ ઈજેક્શન લીધાં; દવાઓ તો ખરી જ. કંઈ ઝાયહો ન થયો. માતાળુ વગેરે કોઈ અહીં ન હતાં. નોકરી કરવી, રસોઈ અનાવવી, મને ડોક્ટર પાસે લઈ જવો એ બધું પિતાળુને કરવું પડતું.

મારા માટે હરવા-ક્રવાનું સુશકેલ હતું. પેશાખ-પાણી કરવા જવું હોય તો પણ સુશકેલી પડતી.

કોઈએ સલાહ આપી એટલે પાલડીમાં સંધિવાના નિષ્ણાત એક વૈહને બતાવ્યું. વૈહરાજે ભાત્ર મગની દાળ ખાવા કર્યું. દસ દિવસ પ્રચોગ કર્યો પણ હુઃખાવો વ્યાપક અની ગયો. બધા સાંધા હુઃખવા માંડયા. મારી હાલત જોઈ પાડોશીઓને દ્વાયા આવતી. એક પાડોશી શ્રી ગિદવાણી હતા. તેઓ કોઈ વાર મારી તબિયતની ખખર પૂછતા. એ વર્ષના ડિસેમ્બરમાં તેમણે સલાહ આપી કે ‘નિસર્જોપચાર અજમાવી જુએ. દવાઓની નિષ્ટળતા નજર સામે હતી. મેં અને પિતાજીએ કુદરતી ઉપયાર અજમાવી જોવાનું નક્કી કર્યું. એમની પાસે આવતા દર્દીએ કુદરતી ઉપયારની વાત કરતા. પણ એ ઉપયાર સારી પેઠે કઠણું તો હતો જ, પણ મારા દર્દી એટલી પરેશાની ભલી કરેલી કે ‘નિસર્જોપચાર’ અજમાવી જોવાનું નક્કી કર્યું. શ્રી ગિદવાણીએ ખાનપાન અને રહેણીકરણીમાં થોડા ફેરફાર સૂચન્યા. ડિસેમ્બરની ૮મી તારીખની એ સાંજ હતી. ત્યાર બાદ તેઓ પંદર દિવસ માટે દિલ્હી ગયા. તેમણે સૂચવેલ બાખતોનું પાલન મેં શરૂ કરી હીધું. એ સૂચનો આ પ્રમાણે હતાં.

(૧) સવારે ભીડી હાતણું-પાણી-શૌચ વગેરે પતાવી કરવા જવાનું શરૂ કર્યું. ચાર-પાંચ દિવસ તો ખાટલામાંથી જોડવાનું સુશકેલ લાગતું. પણ ધીમે ધીમે હાથપગ મોકળા થવા લાગ્યા અને ક્રવાનો સમય વધારવા લાગ્યો.

(૨) ઇરી આંથ્યા બાદ, પાંચસાત મોસંખી ચૂસી જતો. ભાર આના રૂપિયાનો ખર્ચ. કારણું કે મોસંખી એ વખતે હોઠ-એ રૂપિયે ઉત્તના લાવે મળતી. મોસંખી ચૂસ્યા પછી અર્ધી કલાક આરામ કરતો.

(૩) લગભગ ૧૧॥ વાગે પાણીથી ‘ધર્ષણુ સ્નાન’ કરતો. એક ખરખચો ટુવાલ પાણીમાં લીંજવી આખા શરીરે ખૂબ ઘસ્તો. સાખુનો ઉપયોગ બંધ. આ પ્રકારના સ્નાનથી શરીર હળવુંકૂલ જેવું બની જતું, ખૂબ સ્કૂર્ટિં વરતાતી.

(૪) સ્નાન કર્યા પછી બ્રોન્ચનમાં કૂલાવરના પાનનો રસ પીતો. પાન થોડાં થોડાં કૂટીને રસ કાઢીને પી જતો. આસ ધ્યાન એ રાખતો કે પાન કૂટવામાં સમય વધુના લાગે કે રસ વધુ સમય હવામાં ખુલ્લો ન રહે, નહીં તો તેના ક્ષાર નકામા થઈ જય. કૂલાવરનાં પાન પર જંતુનાશક દવા છાંટેલી હોય છે. એટલે એને ખૂબ ધોઈને વાપરવાં પડે. હું એ પાન કાચાં પણ ચાવી જતો. મૂળા, મેથી, પાલખ, તાંદળને, સૂવા વગેરે ભાળુઓનાં પાન પણ ખાતો. ગિદ્વાળીલુચે કણું હતું હતું કે ક્ષારની ઊણુપને કારણે શરીરમાં રોગ થતો હોય છે. એટલે કાચી ભાળુનો ઉપયોગ રોગી તથા નીરોગી બંને પ્રકારના લોકો માટે હિતકર છે. એક ટકે ૧૦૦ થામ ભાળ પૂરતી છે. એથી વધુ નહિ ખાવી.

(૫) ભાળનાં પાન સાથે કાચાં ગાજર, મૂળા, કોણીજ, હ્રધી, ટીંડોળાં, પરવળ, તુનિયાં વગેરે પણ ધંચાનુસાર અવશ્ય ખાતો હતો.

(૬) કાચાં શાકભાજુ ખાધા પણી ચોપડચા વગરની રોટલી ઝૂખ જ ચાવીને ખાતો હતો. એક નાની રોટલી ખાતાં પાંચથી સાત મિનિટ લાગતો. ઓરાંક બરાબર ચાવીને ખાવાની વાત શાળામાં શીખવાય તો છે, પણ એ જાન પરીક્ષામાં જવાણ લખવા પૂરતું જ હોય છે. હવે મને એ સત્ય સમજાઈ ગયું છે કે રોટલી ચાંચા વગર હોજરીમાં જય તો સ્ટાર્ચનું પાચન થાય નહીં અને હોજરીમાં એ સડવા લાગે અને લયંકર રોગ પેઢા કરે. રોટલી કેટલી ખાવી એ નક્કી કર્યું ન હતું. ગિફવાણીલું કહેતા કે એક બ્યક્ઝિને એક દિવસ એક રોટલી પૂરતી થઈ જય, જ્યારે બીજે દિવસે ત્રણ પણ ઓછી પડે. રોટલી ગણ્ણીને ખાવામાં આવે એ તો મોટી ભૂલ કહેવાય. ભૂખ હોય તેથી એક રોટલી ઓછી ખાવી. એ સોનેરી નિયમ ધ્યાનમાં રાખવો. હાથછડના ચોખા ખાવાની છૂટ હતી.

(૭) રોટલી સાથે પકાવેલું શાક પણ ખાતો. બધાં શાકની છૂટ હતી. મના હતી અજમો, લાલલીલાં મરચાં, લસણ, લવિંગ, મરી ને આદુ વગેરે તીખા મસાલાની હુણણ, ધાણા, લુણ, મેથી, કોથમીર, મીઠો લીમડો વાપરવાની છૂટ હતી. “મીહું નહિ ખાવું જોઈએ અને ખાવું હોય તો ઓછામાં ઓછું ખાવું.” ગિફવાણીલુંના એ શાફ્ટો બરાબર યાદ છે. મેં તો બરાબર ૧૨ મહિના સુધી નીમકને હાથ જ ન લગાડ્યો. શાક રસાવાળું ન ખાતો.

(૮) કોઈ પણ દાળ કે કઠોળ ખાવાની સર્જત મના હતી.

(૯) રોટલી ખાધા પહેલાં પા કલાક અગાઉ પાણી પીવાની છૂટ હતી. રોટલી ખાતી વેળા કે ખાધાને બે કલાક વીત્યા પહેલાં પાણી પીવાની મના હતી. મીઠું કે તીખા મસાલા ખાતો ન હતો એટલે મને તરસ જ ન લાગતી. શાકલાળ અને ફળમાંથી પૂરતું પાણી મળી રહેતું. તરસ ન લાગે તો પાણી ન પીવું એ પણ એક અગત્યની વાત છે.

(૧૦) લોજન કર્યા બાદ એક-દોઢ કલાક પૂરો આરામ કરતો. જીંઘવું જરૂરી ન હતું પણ શરીર અને મનને પૂરેપૂરો આરામ મળે તેનું ધ્યાન રાખતો.

(૧૧) અપોરે જમ્યા પછી પાંચેક કલાક બાદ ભૂખ લાગે તો કોઈ સસ્તું ફળ ખાઈ લેતો. ભૂખ ન હોય તો તે પણ ન ખાતો.

(૧૨) રાતનું લોજન પણ અપોરના લોજન જેવું જ રહેતું.

આ આહારનો ચમત્કાર ચાર-પાંચ દિવસમાં જ હેખાવા લાગ્યો. દસ દિવસ વીત્યા ત્યાં તો દર્દ સાવ મટી ગયું. પંદર દિવસે ગિદવાણીલ હિલહીથી આવ્યા કે તરત જ પિતાલુએ વધામણી આપી કે સાહેબ, ચાર-પાંચ દિવસથી રાજકરણને હુઃખ્યો બિલકુલ નથી. તેને સાવ સારું છે. ગિદવાણીલાએ આપેલો જવાબ હજુ પણ યાદ છે. તેમણે કલ્યું હતું કે કારણ હૂર થઈ ગયું તો કાર્ય - તેની અસર પણ ચાલી ગઈ. કારણ ક્રી જિલ્લાં થશે તો કાર્ય પણ ઉત્પન્ન થવાનું. દૂંકમાં ઝોટા પ્રકારનાં ખાનપાન બંધ કરવાથી તકલીફ હૂર થઈ છે. ક્રી

એવાં ખાનપાન શરૂ કરાશે તો તકલીફ પાછી આવવાની. મેં તેમને કહ્યું કે પાંચ-સાત વર્ષ સુધી હું આ રોગડ્રોપી અજિનમાં શેડાયો છું. થાડીક ક્ષણેનો સ્વાદ માણવા માટે આ દર્દને ભૂલી થાડું શકાય? આત્મરિલાઘા નથી કરતો પણ સત્યની વાત કરું છું. મારાં માતુશ્રી હોળી પહેલાં અમહાવાઢ આવેલાં. હોળીના તહેવારામાં તેમણે હૃધસ્ક, શીરો-પૂરી બનાયાં હતાં. લાડથી મને કહે એટા, ખાઈ લે. મેં ચોણણી ના પાડી. તો કહે એટા, થાડું તો ખા. ગિદ્વાણી સાહેણ અહીં કચાં જેવા આવવાના છે? મેં કહ્યું, ‘મા, કેટકેટલા વૈદ-ડોક્ટરો પાસે ઈલાજ કરાયા એ તને ખરખર છે. એમાંનો કોઈ મને આ દર્દમાંથી સુકૃત કરાવી શકયો નહિં. હવે કારણું પડાયું અને તે હુર થતાં દર્દ પણ ગયું છે. હવે કુરી કારણું ડિલું કરી મારે દર્દને નોતરખું નથી.’ ગિદ્વાણીજી કહેતા હતા કે વધુ પ્રોટિનવાળો ઓરાક રોગ નોતરતો હોય છે કેમકે એવો ઓરાક વધુ ધૂરિક એસિડ પેહા કરે છે, અને એ એસિડ રોગનું કારણ છે. મને બરાબર યાદ છે કે પાલડીવાળા વૈદ મને ડેવળ મગની હાળ પર રાખેલો. પરિણામ એ આવેલું કે જે હુઃખાવો ગોઠણુમાં થતો હતો તે આખા શરીરમાં ફેલાયો હતો. ગૌરીગંજમાં મને હૃધ પર રાખવામાં આવેલો, રોજનું એ-ત્રણ લિટર હૃધ પીતો, પણ તેથી શરીરમાં પ્રોટિન વધુ પડતું જવા માંડયું અને જે હુઃખાવો ચોમાસું પૂરું થયે શરીરી જતો તેને બહલે તે જન્યુઆરી-ફેબ્રુઆરી સુધી લંબાયો હતો. હવે તો હૃધ અને હૃધની બનાવટો બિલકુલ ખંધ છે.

જન્યુઆરીથી મેં સ્કૂલે જવાનું શરૂ કર્યું. ઇન્દ્રાચારીમાં શાળાની રમતગમત હરીકાઈમાં મેં લાગ લીધો. ૧૦૦ મીટરની હોડમાં આપી શાળામાં પહેલો આવ્યો. લાંબી ઝૂદમાં અને આવ્યો અને કબહૂદીમાં મારી ટીમ જીતી. એટલે ટીમના સભ્ય તરીકે પ્રમાણપત્ર મળ્યું. લોકો કહેતા આ તો ચમતકાર થયો. હું કહેતો કારણ પલાયન, રોગ પલાયન.

૧૯૭૫થી તે આજ ડિસેમ્બર ૧૯૮૮ સુધી કરી એ ઢર્દે હેખાયું નથી. હા, ખાનપાનનો એ કમ ચાલુ છે. મને કશી જ નથળાઈ વરતાતી નથી. દિવસમાં ચૌહ-પંદર કલાક કામ કરું છું છતાં થાક લાગતો નથી. કુદરતી રીતે જીવન જીવાનું શરૂ કર્યું તેનું આ શુદ્ધ પરિણામ છે એમાં કોઈ સંદેહ નથી.



[૩]

પાયનતંત્રના રોગ

● ભાનુઅહેન મ. ઠક્કર

અત્યારે મારી ઉંમર ૪૫ વર્ષની છે. મારે ત્રણું પુત્રા છે. મારું જન્મસ્થળ જસ્તાણું છે. મારા પિતાજીની ઝરસાણુંની હુકાન સારી ચાલતી હતી તેથી ખાવા માટે ઝરસાણુંનો રોજ છૂટથી ઉપયોગ થતો હતો. ૧૮ વર્ષે મારાં લગ્ન થયાં. સંલેંગો એવા થયા કે સાસરે પણ ઝરસાણુંની હુકાન અને હોટલનો ધંધો હતો. એટલે ત્યાં પણ ઝરસાણુંનો પુષ્કળ ઉપયોગ થતો હતો. લગ્ન થયા પછી એ વર્ષે મને પાયનની સાધારણ તકલીફની શરૂઆત થઈ. સામાન્ય દવાઓના પ્રયોગથી તકલીફ દખાઈ જતી હતી. હુકાનમાં કામ ધણું રહેતું અને તે મારે જ કરવું પડતું હતું. પરિણામે કયારેક અશક્તિ લાગતી ત્યારે ધરવાળાના આશ્રહથી શક્તિની દવાઓનું વારંવાર સેવન કરતી. આ કમ ૧૬૬૭ સુધી ચાલ્યો. ૧૬૬૭માં પાયનતંત્રમાં વધારે તકલીફ રહેવા લાગી, ભૂખ લાગવી બંધ થઈ. આએ દિવસ ચઙ્ગર આવે તથા એચેની રહે. હરફેતું સેવન કરવાથી જાજ્ર સારુ આવતું

પણ ભૂખ લાગતી નહિ. વૈદ-ડોક્ટરના ઈલાજે શરૂ કર્યા. આમ ને આમ એકાદ વર્ષ વીતથું. કશો લાસ થયો નહિ. જિલ્લાનું પેટમાં સખત હુઃખાવો શરૂ થયો. સાખરમતી (મારું હાલનું રહેણાણ)ના ડોક્ટરના કહેવાથી શહેરના મોટા કંસલ્ટન્ટોને બતાઓયું. એકસ-રે, એરિયમ એનિમા વગેરે ક્ષારા તપાસ કરવામાં આવી. હૃદયની તપાસ માટે કાર્ડિયો-આમ પણ લેવરાંયો. પરંતુ રોગનું ખરું નિદાન થયું નહિ. દરમિયાન ઘણું જ પ્રકારની ફવાએ સાથે સાથે જ આપવામાં આવતી હતી. રોજ ઐ-ત્રણ ઈજ્જેક્શન લેવાતાં હતાં, છતાં તકલીફ તો વધતી જ ચાલી.

હોશિયાર ડોક્ટરો તથા સર્જનોએ નિર્ણય કર્યો કે તપાસથી કોઈ નિદાન થઈ શક્યું નથી, તો હવે લેપ્રેટામી -એપરેશન કરવું જેથી પેટ જોતવામાં આવતાં કોઈ તકલીફ હોય તો ઘ્યાલ આવે. ઘણું ડોક્ટરો એમ પણ કહેતા કે મને ખરેખર કશું થયું નથી, અમસ્તું વહેમ છે. સને ૧૯૬૮માં અમદાવાદના બાહોશ ડોક્ટર પાસે પ્રથમ એપરેશન કરાયું, જેનું પરિણામ શૂન્ય આયું. જે કે મને કહેવામાં આયું કે નાના આંતરડા પર અડધી સોપારી જેટલી ચરણીની ગાંડ હતી તે કાઢી લીધી છે.

આમ પહેલું એપરેશન તો થયું. પરંતુ પેટમાં કોઈક વસ્તુ ખૂંચતી હોય એમ લાગ્યા કરતું હતું. ખાવા-પીવાનું સાવ એછું થઈ ગયું હતું. સાવ થોડા પ્રમાણમાં ચા, દૂધ જેવાં પ્રવાહી લેવાથી શરીરમાં બળતરા થતી હતી.

શક્તિની તથા ભૂખ લાગવાની હવાઓના વધુ પડતા સેવનનો। કેમ હસ મહિના સુધી ચાલુ રહ્યો. ઓપરેશનવાળી જગાએ સખત હુઃખાવો થતો હતો. તેથી ફરીથી એકસ-રે લેવરાંયા. હસ માસ બાદ તે જ ડોક્ટર પાસે બીજું ઓપરેશન કરાયું, તેમ છતાં તકલીફ તો ઘરવાને બદલે વધવા માંડી.

કોઈકના કહેવાથી આચુરેંદ્રનો ઈલાજ શરૂ કરવાનું નક્કી કર્યું. ગુજરાતના એક વિદ્યાત વૈદરાજ પાસે ઈલાજ કરાવવા માટે બહાર જવું પડ્યું. ત્રણે બાળકોને સાથે લઈને બહારગામ જવું પડ્યું. વૈદરાજે નિદાન કર્યું કે મને અમૃતપિત્રનો પ્રકોપ હતો. તેથી પાણી ભીવાનું બંધ કરાયું, અને નાળિયેરના પાણી તથા હૃદ ઉપર રાખવામાં આવી. શરીરને પણ પાણીનો સ્પર્શ ન થાય તે માટે નાહવાનું પણ બંધ કરાયું. ત્રણે મહિના સુધી આ પ્રમાણે ઈલાજ કરવાથી પણ કાંઈ લાભ ન થયો, તકલીફ વધતી જ ચાલી. છેવટે કંટાળી, હારી, થાકીને ઘેર પાછાં આંયાં. જિ દંગી જાણે અકારી થઈ પડી.

કોઈક પાડોશીએ કર્યું કે સાખરમતીમાં જાણીતાં પ્રાકૃતિક ચિકિત્સક શ્રી ગિદવાણી રહે છે. તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા રોગને ચમત્કારિક રીતે હૂર કરે છે. આ સાંલળીને પહેલાં તો ઘણું જ અચરાજ થયું. પરંતુ “રૂખતો માણુસ તરણું પકડે” એ ન્યાયે ડોક્ટરો, વૈધોના ઈલાજથી હતાશ થયેલી હું તેમની પાસે ગઈ. તેમણે મારી કરુણ કથની ધ્યાનથી સાંલળી, અને મને આખાસન આપ્યું.

मने समझयुँ के आवानी रीतरसम अद्विवामां आवे तो
तकलीक द्वार थशे. पहेलां तो विश्वास न थेठो छतां एक
प्रकारनी उत्तुड्विवृत्तिथी तेमणे सूचवेला उपचार शड् कर्या.

सवारे शौचकम् बाह थेडुँ इरवानुँ राज्युँ. त्यार
बाह ताळां रसदार इणोनुँ सेवन शड् कर्युँ. अपेक्षना
ज्ञानमां प्रथम काचां शाकलालु आधा बाह मोणुँ मरी—
मसाला वगरनुँ रांधेलुँ शाक आवानुँ राज्युँ. थेडा समय
बाह धी चापडया विनानी एकाह रोटली आवानुँ शड्
कर्युँ. सांजना नास्तामां पण्य ताळां इण लेवानुँ राज्युँ.
ज्ञान बाह आराम करवा उपर आस लार मूळवामां
आ०ये. आठ हिवस आ रीतनो प्रयोग करवाथी जिंदगीमां
नवा उत्साहनो संचार थये. हुलु आठ हिवस पहेलां हुँ
पाण्यी भीवा रसेडा सुधी पण्य नहेती जर्द शक्ती तेने
अद्वेत आठ हिवस बाह नानुँ नानुँ घरकाम करवानुँ पण्यु
शड् करी शकी. एक मास बाह तो रसोर्धि सहित घरनुँ
घण्युँ कामकाज जते करवा लागी. तभियतमां धीमे धीमे
सुधारो जण्यावा लाग्ये.

आजे आ वातने आर वर्ष वीती चूकयां छे. त्यारथी
ते आज हिन सुधी कोई पण्य जतनी हवा के चूर्ण में
लीधां नथी. में आर वर्षथी कोई हवाखानाने उंभरे पग
मांडया नथी. मारा छोकराओने पण्य एज मार्ग वाज्या.
आजे पण्य हुँ नियमित इपे सवारना नास्तामां इण लडि
छुँ. अपेक्षे तथा सांजे काचां शाकलालु तथा रोटली-शाक

ખાઈ લઉં છું. ધરનું બધું કામકાજ જાતે કરી લઉં છું તથા સંપૂર્ણ તંહુરસ્ત જિંદગી જવું છું. મને જણે પુનર્જન્મ મળ્યો હોય એવું પણ કચારેક લાગે છે.

એક ખાસ વાત મારા ધ્યાનમાં આવી. તે એ છે કે વૈદ્યરાજે કેટલાય મહિના સુધી નાહવાનું બંધ કરાયું હતું. જે કે એ ખરું કે મારા શરીરને પાણીનો સ્પર્શ થતાં જ આખા શરીરમાં લયંકર લાદ્ય પ્રસરી જતી. મેં શ્રી ગિદ્વાણી સાહેબને આ વાત જણ્ણાવી તો તેઓ હસી પડ્યા, અને મને સ્નાનનો મહિમા સમજ્યો. તેમણે કહ્યું કે ચામડી-વાટે શરીરનું ઝેર શરીરની બહાર ઝેંકાય છે. ધણા મહિનાથી સ્નાન ન કરવાને કારણે સંબંધાચેલ મળ નાહવાથી જ્યારે બહાર નીકળે ત્યારે કષ આપે છે. એક વાર એ બહાર નીકળી જશે એટલે પછી નાહવાથી કોઈ કુઠ થશે નહિ. થયું પણ એવું જ. નાહવાથી પહેલે દિવસે શરીરમાં બળતરા થઈ પરંતુ ઐ-ત્રણ દિવસ સ્નાન ચાલુ રાખવાથી એ બંધ થઈ અને નાહવાનો આનંદ હું નિયમિત માણવા લાગી.

આજે મારા સમય પરિવાર ઉપર કુદરતી ઉપયારની સિદ્ધિનો એટલો પ્રલાવ છે કે પરિવારનો કોઈ સભ્ય કોઈ પણ પ્રકારના ઔષધનું સેવન કરતો નથી.



[૪]

અદ્ભુત

● વરધીલાલ પી. ઠક્કર

૧૯૭૦ની સાલ હતી, દિવાળીની રજાએ હતી, અને નવેમ્બર મહિનો હતો ભારતના સ્વર્ગસમા કાશ્મીરનો રણિયામણો પ્રદેશ હતો. દિવાળી વેકેશન માણુવા અમે કાશ્મીર આવેલાં પરંતુ મારો આનંદ પેટના ફર્દની અસહ્ય પીડાને લીધે જડી ગયો હતો. બધાં જ જ્યારે સ્વર્ગભૂમિમાં મોજ માણુંતાં હતાં ત્યારે હું ન સમજુ શકાય તેવા પેટના ફર્દની અસહ્ય પીડા લોગવતો હતો. જેમતેમ કરીને પ્રવાસ પૂરો કરીને અમે અમહાવાદ પાછાં આવ્યાં. (આ સંપૂર્ણ પ્રવાસંયવસ્થાની જવાબદારી મારી હતી.) તરત જ એલ. ૩૦. હોસ્પિટલમાં શરીરની તપાસ કરાવી તો નિદાન થયું હાઈપર એસિડિટીનું. હાઈપર ટેન્શનમાં જીવતાં જીવતાં એ હાઈપર એસિડિટી એટલી હુદે વધી ગઈ કે તેમાંથી ડોક્ટરોના રિપોર્ટ મુજબ ડીઓડુનલ અદ્ભુત (હાજરીમાં ચાંદુ) થઈ ગયું અને ડીઓડુનલ કેપ ડીઝાર્મ થઈ ગઈ. આ પરાકાણાએ પહેંચેલા ફર્દને લીધે ડોક્ટરોના કહેવા

મુજબ થોડા થોડા સમયના અંતરે થોડા થોડા ખોરાક લેવાનું રાખતો. ખોરાકમાં મુખ્યત્વે ફુધ, તેળાં, સિંગ, આઈસ્ક્રીમ, બિસ્કીટ, મમરા, ખાખરા, મીઠાઈ વગેરે જે હાથવગું હોય તે લેતો. દવાઓમાં ડાઈલન, મીલડીપ, ગોટ્યુસીલ, જયુકેનજેલ વગેરે દવાઓનો મારો તો ખરો જ. આ ઉપરાંત રેગ્યુલર કોર્સ્માં એન્ટીસીડાલ અને સ્ટેલાથીડ તેમજ રાત્રે જોંધવા માટે કંપોઝ વગેરે પણ ચાલુ જ હતાં. તેમ છતાં દર્દ ધરવાને બહલે વધતું જ ગયું. છેવટે કંટાળીને એલોપથીની દવા બંધ કરી આયુર્વેદિક દવા ચાલુ કરી. એક જાણીતા નિષ્ણાત આયુર્વેદ વૈધની સારવાર ચાલુ કરી.

તેમની દવાથી થોડી રાહત થઈ. ખૂબ જ કડક પરહેણ પાળવાની હતી. જતન્નતનાં ચૂરણ અને ભસ્મોનાં પડીકાં ફુધ અથવા મધ સાથે પેટમાં ઠવવાતાં ગયાં. ઉકાળા અને ક્ષાકીઓએ શરીરમાં ધમસાણ મચાવી હીધું. આ કેમ છ-એક મહિના ચાલ્યો. તેનાથી થોડોક સમય રાહત જણાઈ પણ દર્દ ફરી પાછું બમણુા વેગથી શરૂ થયું. આ વખતો વધારામાં સતત જીલટી થયા કરતી. આડામાં લોહી પડવા લાગ્યું. એ અરસામાં એક નવા ડેક્ટરની સલાહથી ખોરાક બંધ કરી ફક્ત ફુધ અને ઓલિવ ઓફિલ ઉપર રહેવાનું રાખ્યું તેમજ અગાઉ ગણુંબેલી એલોપેથીક દવાઓ પણ ચાલુ કરી. તેનાથી તાત્કાલિક તો રાહત જણાતી પરંતુ વચ્ચે વચ્ચે દર્દની પરાકાણા એટલી હુદે પહોંચી જતી કે પેટ ચીરીને દર્દવાળો ભાગ બહાર ફેંકી દઉં એમ થતું; પરંતુ લાચાર હતો !

એમ કરતાં કરતાં મારે ધંધારે ૧૯૭૬ માં હરિન જવાનું થયું. ત્યાંની આખોહવા અને ફેણકૂલનો વિશેષ ઉપયોગ કરતાં શરૂઆતમાં થોડાક સમય તો હીક ચાલ્યું. પણ પછી દર્દ ફરી પાછું પરેશાન કરવા લાગ્યું. સતત જીલટી થાય, લોહી પડે, ઓરાક ખવાય નહિ, રાતે જાંધી શકાય નહીં. પરિણામ એ આંધું કે મારું શરીર ખૂબ જ ક્ષીણ થઈ ગયું. ૭૮ કિલોગ્રામ વજન હતું એ ઘટીને ૪૬ કિલોગ્રામ થઈ ગયું. સતત પીડા વચ્ચે જીવવું પડતું. કામમાં જીવ ચોંટે નહીં, કંઈ જ ગમે નહિ. આવે વખતે કેટલીયવાર આત્મહત્યા કરી જિંદગી દ્વાંકાવી નાખવાની ધર્છા થઈ આવતી. ત્યાં એક મિત્રે ત્યાંની અધતન અમેરિકન હોસ્પિટલમાં સારવાર લેવાનું જણાયું. એ હોસ્પિટલમાં નિષ્ણાત તખીઓએ મારા શરીરની દરેક પ્રકારના અધતન સાધનોથી તપાસ કરી તેમજ ગેસ્ટ્રોસ્કોપી પણ કરી અને છેવટે એ જ નિદાન. ડોક્ટરોએ એ વખતે છેલ્લામાં છેલ્લી શોધાયેલી ટેગામેટ વગેરે દ્વાનો કોર્સ આપ્યો. અને જણાયું કે જો આ દ્વાઓથી મટે તો હીક નહિ તો ઓપરેશન કરવું પડશે. લાંખા સમય સુધી તે દ્વા લેવાથી દર્દમાં તત્પૂરતી રાહત જણાઈ. પરંતુ થોડા સમય ખાદ જૂની તકલીફોની સાથે એક નવી તકલીફનો ઉમેરો થયો-તે એ કે મોં સાવ સૂકું (ડાય) રહેતું. ઓરાક ખાઈએ અને ગમે તેટલો ચાવીએ પણ મોંમાં કોઈ પણ પ્રકારના રસ જ જરે નહીં. તેથી કોળિયા ગણે ઉતારવાનું ખૂબ જ સુશકેલ થતું. તેવામાં એક ફેન્ય ડોક્ટરની સુલાકાત થઈ. તેમણે પણ

તેમના નુસખા અજમાવી જેથા પણ બધું જ વ્યર્થ. છેવટે કંટાળીને ઓએપરેશન કરાવવાની ધ્રચ્છાથી ભારત પાછા આવવાનો નિર્ણય કર્યો અને ભારત આવી પહોંચ્યો. ૧૯૭૮ ની શરૂઆતમાં જ સારા સર્જન પાસે ઓએપરેશન કરાવવાનું નષ્ટી કર્યું. તારીખો નષ્ટી થઈ ગઈ ત્યાં મારા બનેવીએ પ્રિતમનગર ચેણાશ્રમમાં સ્વામીશ્રી મનુવર્યજીને મળી તેમની સલાહ પ્રમાણે ચાલવાનું સૂચયું એટલે તેમની પાસે જઈ તેમના માર્ગદર્શન હેઠળ ખાનપાનમાં ચોગ્ય ફેરફાર કરી જરૂરી આસનો-પ્રાણાચામ અને ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેનાથી અત્યાર સુધીની તમામ સારવાર કરતાં વિશેષ લાભ થયો. પરંતુ મારે વ્યવસાય અને સતત તાણું વચ્ચે જિવાતી જિંહાને કારણે દર્દ જડમૂળથી તો ગયું નહિ. અવારનવાર થોડી થોડી તકલીફો થયા કરતી. આ તકલીફો કચારેક કચારેક જેર પડતી તો કચારેક મંદ પડી જતી. આમ જીવન વીત્યે જતું હતું. પહેલાં જેવી તીવ્ર તકલીફો નહોતી તો સાથે સાથે દર્દ નિર્મૂળ પણ થયું નહોતું. જીવનમાં પ્રમાદનું પ્રાધાન્ય હતું. ગમે તેમ પણ એક વસ્તુ સારી ઘની અને તે એ કે શુદ્ધજીવા (સ્વામી મનુવર્યજીના) પ્રયત્નોથી ઓએપરેશનનો વિચર માંડી વાજ્યો.

એ જ અરસામાં મારે મારા મિત્ર પ્રકુલ પટેલની સોસાયટીમાં રહેવા જવાનું થયું. તેમના ઘેર પ્રો. વી. પી. ગિદ્વાણી અવારનવાર આવતા. મારા મિત્ર અને તેનાં ભાતા-પિતાને મારા દર્દની જાણ હતી. તેથી તેમની ભલામણુથી

શ્રી ગિદ્વાણીજીએ મારી સુરકેલીભરી કહુણી સાંભળી અને મને સંપૂર્ણ રોગમુક્ત થવા નેચરોપથીની સારવાર શરૂ કરવાનું સૂચયું. શરૂઆતમાં મને તેમનામાં શ્રદ્ધા નહોતી કેમકે તેમણે સૌ પ્રથમ તો મને ફ્રધ અને ફ્રધની બનાવટો જોરાકમાંથી બંધ કરવાનું સૂચયું જ્યારે ફ્રધ તો મારા દર્દને ત્વરિત અને રામખાણ ઈલાજ ગણ્યાય છે. તેમણે એ બંધ કરવાનું કહ્યું એટલે મને લાગ્યું કે અન્યની જેમ ગિદ્વાણીજી પણ મારી બાધતમાં નિષ્ઠળ જ જશે. પરંતુ તેમણે રોગ વિષે જે સિદ્ધાંત સમજાવ્યો એ સરળ વાત જ્યારે મારા મગજમાં ઠસી ગઈ તે દ્વિસથી મારા વર્ષો જૂના દર્દની જડ ઉપરદ્વારા લાગી. તેમને સમજાવેલ પાયાને સિદ્ધાંત આ સુજબ હતો :

આપણે જે જોરાક લઈ એ છીએ તે શરીરમાં ઉપયોગમાં આયા બાદ શરીરમાં ક્ષાર અથવા અમૃત પેઢા કરે છે. આમાંથી અમૃત શરીર માટે રોગજનક છે જ્યારે ક્ષાર રોગનાશક હોય છે. એટલે મારે એવા પ્રકારને જોરાક બંધ કરવો જોઈ એ કે જેનું અંતિમ ઝાપાંતર અમૃતમાં થતું હોય. જે દ્વિસથા આ સત્ય સમજાયું તે દ્વિસથી શ્રી ગિદ્વાણીજીએ ખતાવેલ નિયમો રેખ્જિંદા જીવનક્રમમાં મેં અપનાયા અને મારું દર્દ અડપથી ફર થતું ગયું. નિયમ સુજબ નાસ્તામાં ઇળાહાર, અપોરના લોજનમાં કાચાં શાક-ભાજુ, કોરી રોટલી અને રાધેલું શાક લેતો હતો (ભાત તથા તમામ કઠોળ બંધ કર્યાં). ઉપરાંત તીખું, ખારું,

આટું, ગજયું વગેરે ખાધોનો ત્યાગ કર્યો. અપેરે જરૂર જણાય તો કુરી કણાહાર અને રાત્રિલોજનમાં કુરી કાચાં શાકલાળુંઓ, રોટલી-શાક. આમ પદ્ધતિસરના આહારની સાથે નિયમ મુજબ આરામ અને ધર્મણુસ્નાનથી મારી તકલીફો આજે સંપૂર્ણપણે હૂર થઈ ગઈ છે. રોજના સોણથી અઠાર કલાક પ્રવૃત્તિમય રહીને પણ તાજગીસભર આનંદમય જીવન જીવી રહ્યો છું. કચારેક ભૂતકાળના એ ન્રાસહાયક હિવસો યાહ આવે છે ત્યારે એમ લાગે છે કે મારા જેવાં કેટલાંય ભાઈ-ખણેનો આવી અસહ્ય પીડા અને યાતનાભરી જિંદગીમાંથી રાહત મેળવવા વૈદ્ય અને ડોક્ટરોનાં ખિસ્સાં ભરતાં હશે અને છેવટે તો સાચી પરિસ્થિતિથી અજ્ઞાત રહીને પોતાના હુઃખ-દર્ઢીમાં વધારો જ કરતાં હશે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમના સુધી આ સંદેશ પહોંચે અને તેએ પણ કુદરતની આ અણુમેલ લેટ (નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ)નો કીમિયો. અપનાવે અને તેએ પણ નૈસર્ગિક જીવન જીવનનું પરમ સુખ માણે.

શ્રી ગિદ્વાણીજીના સતત સહવાસમાં આવતાં જીવનમાં રાહુણર બને એવાં કેટલાંક સૂત્રો સતત નજર સમક્ષ રાખવા જેવાં લાગ્યાં છે તેનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણ્ય એમ માનું છું. આ સોનેરી સૂત્રો છે :

(૧) લોજનમેં કુલ તથા કંચ્ચી શાકલાળું નિયમિત સ્થાન દેં; દાલ-કઠોળ બંદ કરો; મિર્ચ-મસાલા તથા તલે હુએ પદાર્થ ખાના બંદ કરો.

- (૨) બિના ભૂખ કે ખાના અપરાધ હૈ.
- (૩) પરિશ્રમ કે ખાંડ હી લોજન નહીં ઔર લોજન કે ખાંડ પરિશ્રમ નહીં.
- (૪) રોટીકો ખાના નહીં-પીના ચાહ્યે (અર્થात् ખૂખ ચાવીને એકરસ કરીને ખાલી જોઈએ).
- (૫) જિતની ભૂખ હો ઈસસે એક રોટી કમ ખાઓ.

મારા આ અનુભવમાંથી અનેક દ્વિતીએને ઉપયોગી માર્ગદર્શન મળશે એવી આશા રાખું છું.



ધણ્ણા માણુસના શ્વાસમાં બદલો હોય છે; તેને તેનો ઝોરાક અવશ્ય હજુમ થયો નથી. કેટલીક વાર વધારે ખાનારને ગૂમડાં થાય છે, તેને ખીલ ફૂટી નીકળે છે. નાકમાં માલણું થાય છે. આ બધા ઉપદ્રવોને આપણે ગણુકારતા નથી. કેટલાકને હેડકી જ આવ્યા કરે છે. કેટલાકને વા સરે છે. આ બધાનો અર્થ તો એટલો જ કે આપણું પેટ આપણું પાયખાતું બન્યું છે અને આપણે આપણા પાયખાનાની પેટી સાથે રાખીને ફરીએ છીએ.

[૫]

ચક્કર આવવાં (ચક્કરનો વ્યાધિ થયો રહુયક્કર)

● રણુછોડલાઈ છગનભાઈ પટેલ

મારી ઉંમર સંસઠ વર્ષની છે. હું એક વેપારી માણુસ છું. આજથી ૩૦ વર્ષ પહેલાં એટલે કે સને ૧૯૫૪માં મને ચક્કરની ખીમારી શરૂ થઈ. તે વખતે મારી પાસે મોટરસાઈકલ હતી. મોટરસાઈકલ ચલાવું ત્યારે કોઈ વખત ચક્કર શરૂ થઈ જાય. આખા શરીરે પસીનો આવે, જલટી થાય અને શરીર જરા ઠંડું થઈ જાય. તરત જ પથારીવશ થવું પડે. એકોપથીના ડોકટરોની હવા શરૂ કરી. ખાસ ઝાયદો થયો. નહિ. જેકે થોડા સમય પછી કામકાજ કરી શકું એવી સ્થિતિમાં આવી જતો. શરૂઆતમાં ચારેક વર્ષો આ દર્દનો હુમલો થતો હતો.

પછી વૈદ્યોની હવા શરૂ કરી. વૈદ્યોની હવાથી શરીરનું વજન ૧૦ થી ૧૨ રતલ ઓછું થયું. પરંતુ અશક્તિ આવી ગઈ અને ચક્કર આવવા લાગ્યાં. ધીરે ધીરે આ દર્દના હુમલા એ વર્ષો થવા માંડયા. ડોકટરો અને વૈદ્યોની હવા

વધારી પરંતુ ખાસ ક્ષાયહો થયો નહિ. સને ૧૯૮૦ થી ચક્કરના ફર્દી ઉપરાંત કાનમાં સીટી વાગવાની શરૂ થઈ. સતત સીટી વાગ્યા કરે. એથી મનમાં ડોધ જિલ્લારાયા કરે. છેલ્દાં એ વર્ષથી રાતદિવસ ચક્કર ચાલુ રહેવા લાગ્યાં, કામકાજ માટે બહાર પણ ન જઈ શકાય એવી પરિસ્થિતિ જિલ્લી થઈ. વધારામાં કાનમાં સીટી વાગવાનું અને પગમાં હુખાવો ચાલુ હતાં.

ગયા વષેં આ ફર્દિનો ઈલાજ કરાવવા મુંખી ગયો. ત્યાં નિષ્ણાત ડોક્ટરોને બતાયું. તેઓએ દ્વારા આપી, પરંતુ સહેજ પણ ક્ષાયહો થયો નહિ. ડોક્ટરોના કહેવાથી વારંવાર ચશમાના નંબર બદલાયા, તેમ છતાં ચક્કર ચાલુ જ રહ્યાં, સીટી ચાલુ રહી અને પગમાં હુખાવો પણ ચાલુ રહ્યો. જીવન જાળે જીવતું નરક બની ગયું. હું જીવનથી એકદમ કંટાળી ગયો. દ્વારા છોડી હીધી. બધું પરમાત્મા ઉપર છોડી હીધું. તે હુઃખમય જીવન જેઠલું લંખાવે એઠલું ખરું, એમ માની તેના ઉપર ભરોંસે મૂકી એસી ગયો. આ ફર્દિની પાછળ લગભગ ઇપિયા વીસ હન્જરનું ખર્ચ થયેલું.

આજથી દસેક માસ પહેલાં એક સગાના લગ્નપ્રસંગે એક એણખીતાની મુલાકાત થઈ, જે કુદરતી ઉપચારોમાં માનતા હતા અને તેમને એવા ઉપચારથી ક્ષાયહો થયેલો. તેમણે શ્રી ગિદ્વાણીનું કુદરતી ઉપચારનું પુસ્તક “નિસર્જો-પચાર દ્વારા રોગમુક્તિ” વાંચવા આપ્યું. આ પુસ્તક વાંચ્યા

પછી કુદરતી ઉપયારમાં શ્રેષ્ઠ ઉત્પન્ન થવા લાગી. એવો ઉપયાર મેં શરૂ કર્યો. એ પુરતકમાં આપેલાં સૂચનોને અનુસરવાથી એક જ માસમાં મને ફ્રાયહો દેખાવા લાગ્યો. હસ મહિનાથી નિયમિત કુદરતી ઉપયાર કરું છું. એનાથી મારી ચલ્લરની બીમારી સહંતર નાખૂદ થઈ ગઈ છે. પગનું દર્દી પણ તદ્દન નાખૂદ થઈ ગયું છે. કાનમાં જે સીટી વાગતી હતી, તે ઘણું ચોછી થઈ છે. એ પૂરેપૂરી જતી રહેશે એવી મને શ્રેષ્ઠ છે. કુદરતી ઉપયાર અંગેનો મારો કુમ નીચે પ્રમાણે છે :

સવારે નરણું કોઠે ભાજુઓનો રસ લઉં છું. તુલસી, મેથી, તાંદળો, સુવા પાલખ, કુલાવરનાં પાંડાં, મૂળાનાં પાન વગેરેનું મિશ્રણું કરી, એનો રસ કાઢી પીઉં છું. રસ લગલગ ૨૦૦ થામ પીઉં છું.

હું હસ માસથી છોડી દીધું છે. મીહું અને કઠોળ ચોછાં કરી નાખ્યાં છે. તળેલી વસ્તુઓ ખાવાનું બંધ કર્યું છે. હાથછડના ચોખા વાપરું છું. ધી તદ્દન ચોછું કરી નાખ્યું છે. મહિનામાં એ ઉપવાસ કેવળ પાણી પીને કરું છું. પંદરેક દિવસ આહાર એક ટંક લઉં છું.

આ કુમ અનુસરવાથી મારું વજન ૧૨ કિલોથામ જેટલું ઘટયું છે, પરંતુ સહેજ પણ અશક્તિ આવી નથી. સ્કૂર્ટિં ખૂબ રહે છે. દરરોજ પાંચેક માર્ધિલ ચાલી શરૂ છું. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. સગાં-સંખી અધાને કુદરતી ઉપયારની લલામણ કરું છું. ઘણુને ફ્રાયહો

થાય છે. કુદરતી ઉપયારની હિમાયત કરવી એ મારા જીવનનું સુખ્ય ધ્યેય બની ગયું છે. રાતદિવસ લોકોને કુદરતી ઉપયારની વાત કરતો રહું છું. શ્રી જિહવાણીજી આ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે તે વિષે જાણીને મારું મન આનંદવિલોર થઈ જાય છે.

કુદરતી ઉપયાર સ્વાસ્થ્ય સુધારવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તેના સિદ્ધાંતો મને ખૂબ ગમી ગયા છે. આપણા શરીરમાં એંસી ટકા ક્ષાર અને વીસ ટકા અમલ તત્ત્વ રહેલાં છે અને અમલ તત્ત્વોનું પ્રમાણ વધી જવાથી વિવિધ રોગ પૈદા થાય છે એ હકીકત બરાબર ગળે જાતરી ગઈ છે. ઓરાક રંધવાથી, તળવાથી તેના ઉપયોગી અંશ નણ્ઠ થઈ જાય છે એ વાત હું સમજુ ગયો છું. ઇણ અને કાચાં શાકભાજી આરોગ્યના દ્વિરસ્તાએ છે એ સત્ય પણ મને સમજાયું છે. હું ઈચ્છું છું કે ઓરાકમાં રહેલાં અમલીય અને ક્ષારીય તત્ત્વોને લોકો પિછાળે અને ક્ષારીય તત્ત્વવાળો ઓરાક અપનાવી તેઓ આવેલી બીમારીને ફૂર લગાડે અને આવનાર બીમારીને શરીરમાં પ્રવેશવા ન હે. મને ખાતરી થઈ ગઈ છે કે આરોગ્ય જાળવી રાખવાની ચાવી આપણા જ હાથમાં છે.

(ભગીરથ સૌસાયટી, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩)



[૬]

ટાઈક્રોઇડ

● રેખાણેન પી. જોશી

મારું નામ રેખા પી. જોશી છે. મારી ઉંમર ૨૩ વર્ષ છે. નાનપણુથી જૂને મરડો ધર કરી ગયેલો. પરંતુ એલાપથીની દવા કરવાથી તે દ્વારાઈ જતો હતો. ૧૯૮૮માં ડિસેમ્બર માસમાં મેલેરિયા થયો. તાવ વધુ હોવાથી ડોક્ટરે ઇજેક્શન આપ્યું જેનાથી મેલેરિયા તો દ્વારાઈ ગયો, પરંતુ ઇજેક્શન તથા ખીલુ દવાઓના રીએક્શન સ્વરૂપે ૧૯૮૪ના જન્યુઆરીની ખીલુ તારીખે રાતે ૧૦ વાગતાં પુષ્કળ રક્તસ્ખાવ થયો, જેથી એહોશી આવી ગઈ. હાથ-પગના નખ તથા હોઠ ફીઝ્કા થઈ ગયા. પગ ઠરી ગયા. તાત્કાલિક ઇજેક્શન તથા દવાઓ આપવામાં આવ્યાં. એક અઠવાડિયાના અંતે રક્તસ્ખાવ અટકી ગયો. અમહાવાહના પ્રસિદ્ધ ડૉ. નાડકણ્ણીએ નિદાન કર્યું કે શરીરના કોઈ પણ તંત્રમાં કોઈ જાતની ખામી નથી. અતિ રક્તસ્ખાવને કારણે જીવન-શક્તિ ઘટી ગઈ છે.

એ જ મહિનાના અંતે માંદળીનો ત્રીજો તથાંકો શરૂ

થયો. જન્યુઆરીની ૨૬ મીએ ટાઠ ચડીને તાવ લરાયો. એ દિવસ સુધી તાવની પરવા ન કરી અને આહાર તથા કામ કરવાનું ચાલુ રાખ્યાં. પરિણામે તાવ એકદમ વધી ગયો. ત્રીજા દિવસે ૧૦૩° તાવ હતો. તાવ ઉત્તરતો જ ન હતો. એલોપથીની દવા અનિયાયે પણ લેવી પડી. આ દવાઓમાં એસ્પિરિન તથા કલોરોકવીનનું પ્રમાણું ઘણું હતું. ડોક્ટરે તાવનાં લક્ષણો પરથી જ મેલેરિયા ગણીને દવા આપેલી. તાવ સાથે પાતળા આડા પુષ્કળ થતા હતા. પાણી પણ પેટમાં ટકાતું ન હતું, તે દવાઓ તો શો રીતે ટકે? દવાઓ લઈએ એટલે આહાર લેવો જ પડે. એટલે માત્ર નારંગી ખાવાનું રાખ્યું; જે ખાવાનું પણ મન તો થતું ન હતું; પરંતુ કુદરતને હું આહાર લડા તે મંજૂર ન હતું. દવા શરૂ કરી અને તે જ દિવસે રાત સુધીમાં આડ-દસ ઉલટીઓ અને પંદર-સોળ આડા થઈ ગયા. રાત્રે તો આડા વાટે લોહી પડવા માંડયું અને કસમયે માસિક આવવું ચાલુ થઈ ગયું. હાથેપગે ખાલી ચડવા માંડી. શરીરમાં પાણીની અછત એટલે ડીહાઈફ્રેશન થવા માંડયું. શું કરવું એ કોઈને સૂઝતું ન હતું. મારા પિતાજી ગુજરાત રાજ્યના એનિમલ હુસ્પાંડી વિભાગમાં નાયાન નિયામક છે. પશુ ચિકિત્સાશાસ્કના બહુ જુના સનાતક છે. તેમને પણ લાગ્યું કે દવાઓથી તો સ્થિતિ બગડી છે દવા ચાલુ રાખવાનો કંઈ અર્થ નથી. આખરે છેલ્લા ઉપાય તરીકે પિતાજીએ બધી જ દવાઓ બંધ કરીને મારાં મોટાંધેન (વિજ્યાધેન) જે કુદરતી ચિકિત્સક છે તેમને મારો કેસ સોંઘેયો. આમ

તો કુદરતી ઉપયારના સિદ્ધાંત અતુસાર જુદા જુદા હેખાતા બધા રોગ એક જ હોય છે તો પણ ડોક્ટરે કરેલા નિદાન સુજબ મને ચેલેરિયા નહોતો પરંતુ ટાઈફોઇડ થયેલો. આમ ડોક્ટરે એટું નિદાન કરેલું.

વિજયાખેને મારી અશક્તિ જેઈને માત્ર એ દિવસ ઉપવાસ કરાવ્યા અને ત્યારખાદ એક મહિના સુધી માત્ર ફેણોનો રસ પિવડાવ્યો. રસાહારના પહેલા અઠવાડિયે જ આડાની સંખ્યા ને દિવસના પંદર-સોળ જેટલી હતી, ઘરીને છ-સાત થઈ ગઈ અને સાત જ દિવસમાં તાવ ઘટતાં ઘટતાં નોર્મલ થઈ ગયો. ત્યારખાદ નાળિયેરતું પાણી, નારંગી-મોસંખીનો રસ, સફરજનનો રસ તથા ચીકુ આપવાનું શરૂ કર્યું. પંદર દિવસ પછી ગાજરનો રસ શરૂ કર્યો. એકાદ દિવસ ખજૂરનો રસ પણ આપતા, પરિચિતો ધણી સલાહો આપતા જેમ કે, બિસ્કટ ખવડાવો, ચા, દ્વધ પિવડાવો, ગલુકોઝ આપો, ટેનિક પિવડાવો વગેરે વગેરે. પરંતુ આ બધી સલાહોને અવગણ્ણીને કુદરતી આહાર જ ચાલુ રાખ્યો અને પરિણામ સારું મળ્યું. ચામડીનો રંગ બદલાવા માંડયો. ચામડીનો રંગ ફીઝો, પીળો હતો, તેને ખદલે લાલાશ આવવા માંડી. શરીર ખૂબ જ ફુર્યા થઈ ગયેલું. અશક્તિ ધણી જ આવી ગયેલી તો પણ બીજ પંદર દિવસ સુધી માત્ર ફેણો અને શાક (કાચાં તથા બાહેદાં) ખવડાવ્યાં, કારણું કે એવી સ્થિતિમાં નખળાઈ ફર કરવા પ્રેરિન, ચરણી, સ્ટાર્ચવાળો આહાર આપવો એ તો મોટી

ભૂલ ગણ્યાય. પાચનતંત્ર નખળું પડ્યું હોય એટલે તે એવો આહાર પચાવી શકે નહિ. તેથી હોઠ મહિના સુધી અનાજને હાથ લગાડવા ના દીધ્યો.

સગાં-સંખાંધીઓ જેઓ જતનતની સલાહો આપતાં હતાં તેઓ આશ્ર્યમાં દૂઝી ગયાં. વગર દ્વારે ટાઈફોન મટે શી રીતે? ટાઈફોન પછી આવતી અશક્તિ માટે મને નારંગી જ ટેનિક તરીકે અપાતી. એ મહિના પછી હું બિલકુલ સ્વસ્થ થઈ ગઈ. આ અનુભવ પછી મેં આજે પણ પુષ્કળ કાચાં શાકસાજુ તથા ઇણો ખાવાનું ચાલુ રાખ્યું છે. દિવસમાં ચારથી પાંચ કિલોમીટર ચાલી શકું છું. ટાઈફોન પછી મારા માથાના વાળ પણ ઓછા થયા નથી. ડોક્ટરની દવા લીધી હતી ત્યારે મારી દણ્ણ પણ નખળી થયેલી. હવે આંખો ફરી પૂર્વવત્ત તંહરસ્ત થઈ ગઈ છે. હૃદ તથા હૃદની સમય બનાવેઠો ખાતી નથી, દાળ-ભાત તથા લસણ, મરચાં, અથાળાં, આફુ, મરી-મસાલા પણ કદ્દી ખાતી નથી.

મને લાગે છે કે કુદરતી ઉપચારે મને નવી જિંહાગી અક્ષી છે તથા મારા કથળતા ભણુતરને પણ ઉગારી લીધું છે. એ માટે કુદરતી ઉપચારની હું સદાય ઝણું રહીશ.

(એ. ૬, પાંચ બંગલા, ગવર્નમેન્ટ ઓફિસર્સ ડેલોની, પોલિટેકનિક
પાછળ, અમદાવાદ-૧૫)



[૭]

મધુપ્રમેહ (ડાયાબિટિસ)

● બળદેવભાઈ મોતીરામ પટેલ

મારી ઉંમર હાલ પણ વર્ષની છે. મારી બધી નોકરી જિલ્લા લોકલ બોર્ડ અને ત્યારપણી જિલ્લા પંચાયત, અમદાવાદની હુક્મત હેઠળ જુદાં જુદાં તાલુકામથકોએ ખાંધકામ ખાતામાં કરવામાં આવી છે. ખાંધકામ ખાતાની નોકરી એટલે કે લગભગ ફરરોજ બહારનાં જુદાં જુદાં ગામોએ ઉપરોક્ત કામગીરી અંગે જવાનું થતું, એટલે કે શારીરિક શ્રમ તો ફરરોજ મળતો જ. જૂન ૧૯૮૮માં મારી બદલી ધોણકાથી દસકોઈ તાલુકામાં થઈ, પરંતુ ધોણકા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ મને કેટલાંક કામોનાં અંદાજપત્રકો અને બિલો બનાવવા જણુવેલ જેથી મારે તેઓની ધર્યા અને સૂચના સુજબનાં કામો કરવા રોકાવું પડેલું અને વધારે શ્રમ કરવો પડ્યો. અંદાજપત્રકો તથા બિલો બનાવવામાં લખાણું કામ વધારે કરવાથી મારા જમણા હુથની પહેલી આંગળીમાં હુઃખાવો થયેલો. આ કામ પૂરું કર્યા પછી મારી બદલી દસકોઈ

તાલુકામાં થઈ, પરંતુ નવી જગાએ નોકરી શરૂ કરતાં સાત દિવસની જેઈનિંગ રજાઓમાં મેં આંગળીના હર્દ માટે ઘરગથ્થુ ઈલાજ કર્યા પરંતુ તેનાથી મને કોઈ ઝાયદો થયો નહિં, જેથી મારા અંગત ડોક્ટરે કલ્યું કે આંગળી પાકતી હોય તેમ જણાય છે. તો તમારે વાડીલાલ હોસ્પિટલમાં જઈ ચીરો સુકાવવો જેઈએ. પરંતુ હું વાડીલાલ હોસ્પિટલમાં ન જતાં બીજા સારા વિદેશ જઈ આવેલા ડોક્ટર પાસે ગયો. તેણે મને તપાસીને કલ્યું કે આંગળીમાં પાક થયેલ હોવાથી ચીરો મૂકીને પડુ કાઢી નાખવામાં આવે તો એકદમ મટી જશો. તેમણે મને જરૂરી ઇજેક્શન આપીને ચામડી બહેરી બનાવીને વાફકાપ કરેલ અને ત્યારબાદ જરૂરી પાટાપિંડી કરેલ. પંદર મિનિટ પછી મને ચ્યક્કર આવવા લાગ્યાં અને તે મેં ડોક્ટરને જણાયું ત્યારે તેમણે મને પંદર મિનિટ સૂર્જ રહેવા જણાવેલ. તે સુજખ હું પંદર મિનિટને બદલે અડધા કલાક સુધી સૂર્જ રહ્યો, તો પણ મને કોઈ ક્રેક ન પડ્યો, જિલટાની વધુ ને વધુ બેચેની થવા લાગી. ડોક્ટરને કંઈક શાંકા પડતાં તેમણે મારા લોહી અને પેશાખ તપાસ્યાં. તેમના નિદાન સુજખ મારા લોહીમાં 432 મિલિથામ શર્કરા હતી. આ રીતે તપાસ થયા બાદ તેમને પણ લાયું કે આવી રીતે ચીરો લગાયો એ ડીક ન કલ્યું. ત્યારપછી મારે દરરોજ ડ્રેસિંગ કરાવવા અને હવા લેવા 15 થી 20 દિવસ સુધી જવું પડ્યું. પણ મારી આંગળીને રૂજ આવી નહિં. દરરોજ ડ્રેસિંગ કરાવતાં મને વેહના પણ ખૂબ થતી. મને એમ લાયું કે હુવે મારે ડાયાભિસિસના કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે

ઇલાજ કરાવવો જોઈએ. તેથી હું એવા નિષણું ઠોકટર પાસે ગયો, અને મારી આખી કથા કહી સંભળાવી. તેઓએ મને તપાસીને એક મહિના સુધી ઇન્સ્યુલીનનાં ઇન્જેક્શન આપ્યા. પરિણામે મારી બ્લડ-સુગર (Blood-sugar) 432 થી ઘરી 156 મિલિઅમ થઈ ગઈ. સાથે સાથે આંગળીએ રૂઝ પણ આવી ગઈ. એ પછી મારી વિનંતી ધ્યાનમાં લઈ ને ઠોકટરે મને બ્યોરે અને સાંજે હવાની એક-એક ગોળી ઉપર એક મહિના સુધી રાખ્યો. તે પછી તપાસ કરતાં મારા લોહીની અંદર 304 મિલિઅમ શર્કરા જણાઈ. આ તપાસને ધ્યાનમાં રાખીને તેઓશ્રીએ બ્યોરે તથા સાંજે એ-એ ગોળી લેવા જણાવેલ આ રીતે એ-એ ગોળીએ એક મહિના સુધી લેવડાવી. ત્યારબાદ ટેસ્ટ કરતાં લોહીમાં શર્કરાનું પ્રમાણું 208 મિલિઅમ થયું. આ જોઈને ઠોકટરે મને ઇન્સ્યુલીનનાં ઇન્જેક્શન લેવા કહ્યું, પરંતુ ઇન્સ્યુલીનથી મારે જૂથ બ્યથા અનુભવવી પડતી તેથી હું વિચારમાં પડી ગયો. સમસ્યા ખડી થઈ કે હવે મારે શું કરવું ?

અહીં એક-એ અગત્યની વાતોનો ઉલ્લેખ કરી શકું. મારા કુટુંબમાં કોઈને ડાયાબિટિસનો રોગ થયેલ નથી. વળી મારી નોકરી પણ દરરોજ મહેનતવાળી હોવાથી મને ડાયાબિટિસ હોય એવું તો કદ્વપનામાં પણ આવેલ નહિ. જૂન 1983 પહેલાં લગભગ એકાદ વર્ષથી મને માથામાં ગૂમડાં થતાં, આંખો લાલ થઈ જતી, પગે ખરજવા જોવું થઈ જતું. એટલે હું માની લેતો કે ગાડીની સફરને લીધે

કોલસી પડવાથી કે પવન લાગવાથી આગે લાલ થઈ જતી હશે. ઉનાળાની ગરમીને કારણે મને માથામાં ગૂમડાં થતાં હશે, પગે મચ્છર કરડવાથી અને ખણુવાથી ખરજવા જેવું થઈ જતું હશે, પણ એવો કોઈ ઘ્યાલ જ ન આવતો કે ડાયાબિટિસના કારણે આ બધું થતું હશે. એ તો આંગળી પાકી, વાદકાપ કરાઈ અને તપાસ કરાઈ ત્યારે ડાયાબિટિસની જણું થઈ. પરંતુ આ રોગ ગોળીએ અને ઈજેકશનો લીધા પછી પણ પીછો છોડતો ન હતો.

આવા ગુંચવણુલયી સંલેગોમાં મારા એક સણાને ત્યાં ગિફવાણીઓનો લેટો થયો. આમ તો હું તેમને વર્ષેથી ઓળખું છું. પરંતુ કેટલાંક વર્ષેથી તેમને મળવાનું થયું ન હતું. મને એટલી પણ જણું હતી કે શ્રી ગિફવાણી આજકાલ કુદરતી ઉપયારમાં બહુ રસ લે છે એટલે મેં મારી ઉપર મુજબની વિતક કથા તેમને જણાવી. આમ તો મેં તેમણે લખેલી ‘નિસર્ગોપયાર દ્વારા રોગમુક્તિની ચ્યાપડી ઘણા સમય પહેલાં ખરીદેલ, પરંતુ તેનો આસ જાંડો અલ્યાસ કર્યો ન હતો; માત્ર વાંચવા ખાતર વાંચી લીધી હતી, પરંતુ એમાંની કોઈ વાતનો અમલ કર્યો ન હતો. મારી વિતક કથા સાંભળીને તેઓએ મને આ અંગે વિસ્તારપૂર્વક ઘટતી સૂચના આપી કે મારે હું શું ‘કરવું’ તેઓએ આગ્રહ કર્યો કે ઉપરોક્ત પુસ્તકનું આઠમું પ્રકરણ “તો પછી આપણે શું કરવું જેઈએ” ખૂબ સારી રીતે વાંચી તેનો અમલ કરવો. ધ્યાન એટલું જરાખવું કે પુસ્તકના પાના નંખર 56 ઉપર

અતાવેલ મીડાં ઇળોનું સેવન કરવું નહિ. મારા આથડુથી તેઓએ મને સવારથી સાંજ સુધીમાં શું ખાવું, કેટલું ખાવું, કચારે ખાવું, દ્વિસ દરમિયાન બીજું કઈ પ્રવૃત્તિઓ કરવી તે અંગે વિસ્તારથી સમજણું આપી અને બીજા દિવસથી જ હું આ સૂચનાનો કંડક અમલ કરવા લાગ્યો. આ કુમ નીચે પ્રમાણે છે :

હું દરરોજ સવારમાં સાડા ચાર વાગે જોડીને પંદર વીસ ભિનિટમાં દાતણું-જરૂરું પતાવીને નારણુપુરામાં આવેલા મારા ઘરથી અટીરાના કુવારા સુધી કરવા જાઉં છું. લગભગ એક કલાક કરું છું. આશરે પાંચ કિલોમીટરનું અંતર કાપતો હોઈશ. પાછા આવીને પંદર ભિનિટ સુધી ધર્મણુસ્નાન કરું છું. હું કાયમ નળના તાણ પાણીથી સ્નાન કરું છું. ત્યારપણી ઈચ્છાનુસાર ઝતું પ્રમાણેનાં ઇણ (મીડાં ઇણ છાડીને) લઈ છું. ઇણ લીધા પછી પંદરથી-વીસ ભિનિટ આરામ કરું છું. પછી ઐ-ત્રણું કલાક મારી અંગત જરૂરિયાત પ્રમાણે કામ કરું છું. અપોરના લોજનમાં કાચાં શાકભાજુ એટલે સુવા, મેથી, પાલખ, તાંદળને, કોથમીર વગેરે ભાળુંઓ તથા કાકડી, ગાજર, કોખીજ, ગીલોડાં, લીંડા, ફંધી, રીંગણુ, વગેરે મારી રુચિ અનુસાર લઈ છું. આમાં ભાળુંઓની માત્રા 100 થામથી વધુ લેતો નથી. કાચાં શાકભાજુ ખાધા પછી મોણું વગરની કોરી રોટલી તથા કોઈપણ અનાજનો રોટલો ખૂબ ચાવીને ખાઉં છું. ડોક્ટર મને ચોખા અને બટાટા ખાવાની ના પાડતા હતા. પરંતુ ગિદ્વાણીલું મને

હાથછડના ચોખા ખાવાની ધૂટ આપી છે. તેઓ કહે છે કે ઘડની રોટલી કરતાં બટાટા સારા. મેંદાનું સેવન કરવાની તેઓ મનાઈ કરે છે. રોટલીના લોટમાંથી થૂલું કાઠવાની ના કહે છે. ડોકટરો હાળ, કઠોળનું વધુ સેવન કરવા માટે કહેતા હતા. જ્યારે ગિદ્વાણીજી હાળકઠોળનું સેવન કરવાની ના પાડે છે. પરંતુ લીલાં કઠોળ એટલે ગવારફળી, ચોળાફળી ફણુસી, પાપડી, લીલા વટાણા, વાલોળ, લીલી તુવેર, લીલા ચણા વગેરેનું સેવન કરવાનું કહે છે. અધાં શાક રાંધીને ખાવાની ધૂટ આપી છે, પરંતુ કુકર પર વજનનો દઢો મૂક્યા વગર તે રાંધવાં એવો આથડ રાખે છે. હું રાંધેલા શાકમાં કોઈ જાતનો તીજો મસાદો (લીલું-લાલ મરચું, મરી, આહુ, લસણ વગેરે) નાખતો નથી. મીહું સેવન કરવાની પણ ગિદ્વાણીજી ના પાડે છે. ફ્રધ તથા ફ્રધની બનાવટવાળા પહાર્થ પણ લેતો નથી. આ પ્રમાણે બપોરનું લોજન કર્યું બાદ હોઢેક કલાક આરામ કરું છું. સાંજે ભૂખ હોય તો ઇણ લઇં છું અને રાત્રે બપોરની જેમ લોજન લઉં છું.

પહેલાં તો હું-પંદર વીસ દિવસે લોહીની તપાસ કરાવતો, પરંતુ ગિદ્વાણીજીએ કહ્યું કે આ આહારકમથી લોહીમાં શર્કરાનું પ્રમાણ અડપથી ઓછું થશે. તેથી હવે લોહીની તપાસ પાંચ-સાત દિવસમાં કરાવને બહુ જ આશ્ર્યની વાત છે કે જે લોહીની શર્કરા કેટલાક સમયથી ગોળીએ. ખાતાં પણ 200 મિલિગ્રામથી ઓછી થતી ન હતી તે આવા પ્રકારના ખાતપાનથી એક અઠવાડિયામાં જ

ઘટીને 120 મિલિથ્રામ થઈ ગઈ. ગિફવાણીનું મારી દ્વારા જોળીએ એકદમ બંધ કરાવી ન હતી. તેએ કહેતા કે જેમ જેમ આ ખાનપાનની શરીર ઉપર અસર થશે તેમ તેમ કમશા: જોળીએ ઓછી કરવી અને થોડા જ વખતમાં જોળીએને ઉપયોગ મેં સહંતર બંધ કર્યો. પાછળથી હું દર પંદર દિવસે લોહીની તપાસ કરાવતો ત્યારે લોહીમાંની શર્કરા 120 થી 130 મિલિથ્રામ સુધી રહેવા લાગી એટલે મને લાગ્યું કે મારો ડાયાબિટિસનો રોગ ગયો છે. મધુપ્રમેહ અંતે પાંજરે પુરાયો છે.

ગિફવાણીના પ્રચોગ પહેલાંના દિવસોમાં ડોક્ટર સાહેબની દવા ચાલતી હતી તે વખતે મારી ડાયી બાજુની આંખમાં ઝાંખ આવી ગઈ હતી. વળી રાતના નાક પણ બંધ થઈ જતું. એ વખતે શિયાળાની ઝતુ હતી અને મને શ્વાસ લેવામાં સુશકેલી પડતી તેથી મૈં વડે શ્વાસ લેવો પડતો અને એના કારણે મૈં સુકાઈ જતું અને ભંધ પણ આવતી નહિ. રાત્રિનો મોટો લાગ ઓરડામાં આંદો મારીને પસાર કરતો, ધણો એચેન રહેતો. મૈં ડોક્ટર સાહેબને મારી આંખ કોઈ આંખના નિષ્ણાત ડોક્ટરને બતાવવા તથા પગના ખરજવા માટે કોઈ ચામડીના નિષ્ણાત ડોક્ટરને બતાવવા માટે સલાહ માગી તો તેમણે મને કહ્યું કે કોઈ ડોક્ટરને બતાવવાની જરૂર નથી. ડાયાબિટિસ કાણ્યુમાં આવી જશે. પરંતુ જ્યાં સુધી ડાયાબિટિસના નિષ્ણાત ડોક્ટર પાસે ઉપયાર

કરાયે। ત્યાં સુધી એ રોગ મર્ટચો નહિ. અને તેના કારણે આંખ, નાક અને ચામડીના રોગમાં કોઈ ફેર પડ્યો નહિ. હું ખૂણ વ્યથા અતુલવતો, પરંતુ જ્યારે ગિદ્વાણીજીની સૂચના પ્રમાણે ઝક્તા ખાવા-પીવામાં જ ફેરફાર કર્યો તો એક અઠવાહિયામાં જ મારો ડાયાબિટિસનો રોગ મર્ટી ગયો. અને ઉપર દર્શાવેલ આંખની, કાનની, ચામડીની મારી તકલીફ કર્યારે ફૂર થઈ તેની મને ખખર પણ પડી નહિ. હાલમાં પણ હું કોઈ તકલીફ વિના સ્વસ્થ રહું છું. ગિદ્વાણીજીએ મને આ વાત સારી રીતે સમજવી હતી કે જે આહાર-પરિવર્તનથી આ અસાધ્ય રોગ મર્ટી જશે તો આપણો હૈનિક અશુદ્ધ આહાર જ રોગનું કારણ છે એ સિદ્ધ થઈ જશે. તેમણે કલ્યું હતું કે પહેલાંનો આહાર જે ફરીથી લેવામાં આવશે તો રોગનું કારણ ઉપસ્થિત થતાં રોગ પણ ફરીથી પ્રગટ થશે. એટલે હું તેમણે બતાવેલ આહાર જ આજ સુધી લડું છું અને આખી જિંહળી એ જ આહાર લઈશ. તેઓ કહે છે કે આ આહાર વૈજ્ઞાનિક દ્વિતીય શરીર માટે સંપૂર્ણ છે. આમાં આહારના કોઈ જરૂરી ઘટકની અછત નથી. હવે તો હું દ્વિવસમાં એ વખત મારા રહેઠાણ નારણુપુરાથી નવરંગપુરા સુધી સેવાકાર્ય માટે આવ-જ કરું છું. શ્રમ કરવાથી મારું શરીર તંદુરસ્ત રહે છે.

દૂંકમાં મને લાગ્યું છે કે જે આપણે પણ, પક્ષી, જનાવરોની જેમ કુદરતના શરણે જઈશું, કુદરતે આપેલાં સારાં સ્વાહિષ્ટ શાકભાજુ અને ફોને આહાર તરીકે અપનાવશું.

તો જીવનભર નીરોગી રહી શકીશું. આ પ્રાણીએ કોઈ ડોક્ટર પાસે જતાં નથી. એ તો અનિવાર્ય છે કે શરીરને ધસાડે લાગવાનો જ, જેથી વૃદ્ધાવસ્થા પણ આવવાની જ અને અંતે મૃત્યુ પણ થવાનું જ. પરંતુ જે આપણે રોગમુક્ત જીવન ગાળી વન્ય પ્રાણીએની જેમ કુદરતી મૃત્યુ પામીએ તો તે ઉત્તમ સ્થિતિ ગણ્યાશે, એવી મારી નમ્ર માન્યતા છે. નિસર્ગોપયારના આ સનાતન સંદેશને વંદના જ કરવી રહી.

(૧૬-૧૭, હેવેન્ડ સોસાયટી, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩)



“જેને રોગમુક્તિ કે રોગશમન જોઈતું હોય તેને કેવળ નરવી જીવનસરણી અપનાવવી જોઈએ. જે જીવનસરણી કાકડાનો રોગ મટાડશે, તે જ જીવનસરણી આંત્રપૂર્ણનો વિકાર (એપે-નિડસાઈટીસ), મેનિન્જાઈટીસ, મૂત્રપિંડરોગ, નેત્રાઈટીસ, સંધિવા કે ક્ષયરોગને પણ દૂર રાખશે. બીજા શણદોમાં કહીએ તો આરોગ્ય વિધાયક જીવનસરણી નરવા શરીરનું નિર્માણ કરે છે, તેની નરવાઈ જાળવે છે. રોગ વિધાયક જીવનસરણી કોઈ પણ રોગનું નિર્માણ કરી શકે છે. રોગ તો બધા એક જ હોય છે.”

— ડૉ. એચ. એમ. શેલ્ટરન
એન. ડી.

[૮]

મેલેરિયા

● મહેશ શાંતિલાલ દલવાડી

મારી ઉંમર હાલ ૧૬ વર્ષની છે. હું ડિલોમા ટેક્સ્ટાઇલના છેલ્ખા વર્ષમાં અભ્યાસ કરું છું. મારા પિતાશ્રી સાખરમતીમાં રેલવે પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આથી રેલવે તરફથી નાનું કવાર્ટર મળેલ છે. મારા કરતાં એક મોટો ભાઈ છે, તથા મારાથી નાનાં એક ભાઈ અને એક બહેન છે.

હું દસ વર્ષનો હતો ત્યારે મેલેરિયાનો તાવ આવ્યો. હતો જે એ મહિના કરતાં પણ વધારે સમય સુધી ચાલ્યો હતો. તે સમયે ધણું ધનજેકશનો લીધાં હતાં અને ગોળીઓ આધી હતી. તાવ જિતર્યા પછી પણ કમનેરી એટલી બધી આવી હતી કે એક મહિના સુધી આરામ કરવો પડ્યો હતો. તે પછી પણ દર વર્ષે મેલેરિયાનો તાવ ત્રણું-ચાર દિવસ માટે ખણર કાઢી જતો. આ વર્ષે પણ તા. ૧૩-૭-૮૫ના રેાજ તાવની શરૂઆત થઈ. તે દિવસે હળવો તાવ એ કલાક માટે જ આવ્યો. પહેલા દિવસે હેચેની અને કમનેરી વરતાયાં તથા હેડકી આવતી હતી. ખાવાપીવાનું થોડું

આણુ હતું. ચૌદમી તારીખે તાવ આવ્યો. નહિ, પરંતુ પંદરમીના રોજ ટાઠ ચડીને તાવ આવ્યો. તે દિવસે કડુ, કરિયાતું અને ગળાનો ઉકાળો દિવસમાં એ વળત લીધો. ખાવાનું બંધ કર્યું અને એકાદ એ વાર ફેણ લીધાં. ઉકાળો લેવાથી પેટમાં બળતરા થઈ. જુલાઈની સોળમીએ તાવ ન આવ્યો, પરંતુ સત્તરમીએ ખૂબ ટાઠ ચડીને પાછો તાવ આવ્યો. ચારેક વાગે તાવ જીતરતાં એ રોઠલી અને થોડું શાક ખાધું. અઢારમી તારીખે તાવ ન આવ્યો, પરંતુ ૧૮મી તારીખે સવારથી ખૂબ ટાઠ ચડીને ફરી તાવ આવ્યો. ઠંડી એટલી બધી લાગતી હતી કે નણુ-ચાર જોદડી એઠબી પડી હતી. અડધા અડધા કલાકે પેશાખ કરવા જવું પડતું હતું. વધુ તાવ ચડતો ત્યારે તો પથારીમાં પણ થોડો પેશાખ થઈ જતો. માથાનો હુખાવો પણ ખૂબ જ થયો. એ દિવસે તાવ સાંજ સુધી રહ્યો. લગભગ રોજ કડુ, કરિયાતું લેતો છતાં તાવ તો રોજ વધતો જ ગયો. એટલે મારા પિતાશી તથા માતુશીને ચિંતા થઈ. અમદાવાદ શહેરમાં તોઝાનો કંઈક હુળવાં થયાં હતાં. મારી પરીક્ષા એાગસ્ટની શરૂઆતમાં થશે એવી વાત સાંભળવા મળી એટલે મને પણ ચિંતા થવા લાગી કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા ડેવી રીતે આપી શકીશ. કાં તો મારું વર્ષ બગડશે અથવા તો સાથ એણા ગુણુંક મળશે એવો ડર લાગવા માંડયો.

મારા પિતાશીને કુદરતી ઉપયારમાં રસ છે. તેઓ જાણુંતા નિસર્ગોપયારક શ્રી ગિદ્વાણીને સારી રીતે એળણે

છે અને કુદરતી ઉપચારની તેમની પ્રવૃત્તિઓમાં ભાગ પણ
કે છે. મારા પિતાશ્રી જુલાઈની ૨૦મીએ ગિદ્વાણીજુને
મળ્યા અને મારી માંદગી વિષે વાત કરો. તા. ૨૧-૭-૮૫ના
રોજ ખોસે ૧૨ વાગે ગિદ્વાણીજુ અમારે ઘેર આવ્યા. તે
ઘેલાં મને ઝૂથ ટાઠ ચડીને તાવ આવ્યો હતો. મને ચાર-
ઘાંચ ગોઢાં એઠાડવાં પડ્યાં હતાં અને પેશાબની તકલીફ
પણ ચાલુ હતી. ગિદ્વાણીજુ આવ્યા તે સમયે મને ૧૦૫૦
તાવ હતો. ગિદ્વાણીજુએ પહેલી વાત એ જ કહી કે મેં
ફોગટમાં આડ દિવસ ગુમાવ્યા. જે તાવ આવ્યો તે દિવસથી
ઉપવાસ કર્યા હોત તો અત્યાર સુધીમાં તાવથી મુક્તિ મળી
ગઈ હોત. તે દિવસે સવારે મેં પપૈયું લોધું હતું. ગિદ્વ-
ાણીજુએ કહ્યું કે જ્યાં સુધી તાવ ન જય ત્યાં સુધી કશું
જ ખાવાનું નહિ, કેઠા ઉકાળેલું પાણી તરસ લાગે તો
જ પીવાનું. તેમણે કહ્યું કે બિનજરી વાતચીત પણ
કરવી નહિ કેમકે વાતચીત કરવાથી પણ શક્તિનો વ્યય
થાય છે. મારે પેશાબ કરવા વારંવાર ઉડવું પડતું હતું
તેથી ગિદ્વાણીજુએ પેશાબ કરવા માટેનું વાસણું (યુરીનલ)
મોકલાવ્યું. હું જ્યાં સ્ફૂર્તો હતો તે જગ્યા ઉપર લોખાંડનાં
પતરાં હતાં તથા હવાની અવરજનર એછી થતી તેથી તેમણે
મારી સ્રૂવાની જગા ખદ્વાવીને એવી જગાએ સુવાડયો કે
જ્યાં હવાની સારી અવરજનર હતી અને ઉપર ધાખું હતું.
સવારે અને સાંજે આડની નીચે ખુદ્વામાં સ્રૂવું એવો
તેઓનો આગ્રહ હતો. દિવસમાં એક સમય સ્પંજ કરવાનું
એટલે કે પલાળેલા કપડાથી શરીર લૂછવાનું પણ તેમણે

મારે ૧૯૭૮ ના માર્ચની આખર તારીખે કોલેજના કામ સારુ અમદાવાદથી પાટણ જવાનું જડી હતું. નણળાઈ પુષ્ટળ હતી તેથી ગિફ્ટવાણીલુચે તો કહ્યું કે પાટણ ન જવાય તો સારું; પણ બીજે કોઈ વિકદ્ય ન હોઈ મેં જવાનું વિચારું; અને તે પહેલાં મારું લોહી અને પેશાખનો રિપોર્ટ લેવડાવતાં જાણવા મળ્યું કે લોહીમાં ૧ મિલિયામ % બીલીઝીન હતું અને પેશાબ તો બિલકુલ સારું હતો. આઠલું ૧ મિલિયામ % બીલીઝીન સાંજ નરવા માણુસના લોહીમાં પણ હોય છે તેમ જાણતાં થયું કે કમળો મટેલો છે. આ પછી મેં કોઈ રિપોર્ટ નથી લીધો અને હિન્પ્રતિહિન મારી તખિયત સુધરતી ગઈ છે.

(૨૧, મધુકુંજ સોસાયટી, કાશીવિશ્વનાથ મહાદેવ
પાછળ, મણિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮)



આપણા કર્મથી આપણે માંદા પડીએ તેમ વિચારથી પણ, માંદા પડીએ. પોતાના દીકરાને કોગળિયું થયું તે જોઈ બાપને પણ થયું, એવા દાખલા આપણે ધણા જોઈએ છીએ. એક પ્રસિદ્ધ વૈદે કહ્યું છે કે, જેટલાં માણુસો મરકી વગેરે રોગોથી મરે છે તેના કરતાં વધારે ભયથી મરે છે. “બીજાનું કમોતે મરે છે” એ કહેણું વિચારવાલાયક છે.

—ગાંધીજી

અનુભવવા લાગ્યો. અને હું વિચારવા લાગ્યો કે આ રીતે કયાં સુધી ઉપવાસ કરીશ અને કેવી રીતે પરીક્ષા આપીશ? મેં જિદ્વાણીજી આગળ મારી માનસિક વ્યથા રજૂ કરી. તેમણે મને ખૂબ જ ધીરજ આપી અને એ-ત્રણ ઉદ્ઘાટણ આપીને સમજાયું કે જ્યાં સુધી તાવ હટે નહિ ત્યાં સુધી ઉપવાસ ચાલુ જ રાખવા જોઈએ. મારાં બા અને બાપુજીએ પણ મને ધણી હિંમત આપી એટલે મારું મનોખણ વધ્યું અને ઉપવાસ ચાલુ રાખવાનો મેં નિર્ણય કર્યો.

તારીખ ૨૬/૭ ના રોજ પણ તાવ આવ્યો. પરંતુ ૨૧ જરા પણ ચડી નહિ. બધાં અનિષ્ટ લક્ષણો બિલકુલ શાંત થઈ ગયાં. થરમેઝીટર તાવ બતાવતું હતું, પણ તાવ હોય એવું મને લાગતું ન હતું. એ દિવસે વધુમાં વધુ તાવ ૧૦૧૦ થયો. મને લાગ્યું કે હવે એકત્રીસમી તારીખે કહાય તાવ આવશે નહિ અને એવું જ બન્યું. આમ ૧૦ દિવસના ઉપવાસથી તાવમાંથી મુક્તિ મળી. તા. ૧/૮ ના રોજ અડધો ગ્વાસ મોસંખીના રસમાં તેટલું જ પાણી ઉમેરી પારણાં કર્યાં. પહેલી અને બીજી તારીખે દિવસમાં ત્રણ-ચાર વખત ઉપર પ્રમાણે પાણી સાથે મોસંખીના રસ લીધો. તા. ત્રીજી અને ચોથીના રોજ દિવસમાં ત્રણ-ચાર વખત મોસંખી ચૂસી લીધી. હવે મારી ભૂખ ઉઘડવા લાગી અને થાડું થાડું વાંચવાનું શરૂ કર્યું. સફ્ફાલાગ્યે એવું બન્યું કે મારી પરીક્ષા જે ઓગસ્ટમાં થવાની હતી તે મુલતવી રહી તેથી મારી મોટી ચિંતા ફર થઈ ગઈ. તારીખ ૫ અને ૬ના

રોજ સવારમાં મોસંભીને રસ અને હિવસ દરમિયાન એ-ત્રણું વખત બીજાં ફેણ લેતો. એક સમયે એક જ જાતનું ફેણ લેતો. ભણુવાનું સારી રીતે ચાલુ થઈ ગયું. તા. જના રોજ સાંજે ૨૧ હિવસ પછી રોટલી અને મોળું શાક લીધું. હું રોજ સવારમાં તાબાં સસ્તાં ફેણનો નાસ્તો કરું છું. અપોરે કાચાં શાકલાળું, ડોરી રોટલી અને રાંધેલું શાક (મોળું) લડું છું. હાણ, કઠોળ તો તદ્વન બંધ છે અને તેને બદલે શુવારફળી, ચોળાફળી જેવાં સિંગોવાળાં શાક લડું છું. ભાત આવો હોથ તો હુથછડના અથવા તો પોલિશ કર્યા વગરના ચોખાનો ભાત ખાઉં છું. મારો તાવ ગયો આથી સગાં-સંબંધીઓને ખરેખર આશ્રમ્ય થયું છે. હું મારા શરીરની સ્થિતિ પૂર્વવત્ત થઈ ગઈ છે. ઉપવાસે મેલેશિયાના નાગને નાથી હીધો છે. હું પહેલાં કરતાં પણ વધુ સારી રીતે ભણું છું અને કામ કરું છું. કોઈ જાતનું શીએકશાન આંધું નથી કેમકે મેં કોઈ હવા લીધી ન હતી. કુદરતી ઉપયારમાં મારી શ્રદ્ધા દઢ થઈ છે. મને લાગે છે કે જે આવી રીતે હું ખાનપાનતું ધ્યાન રાખીશ તો કોઈ પણ પ્રકારનો રોગ મારાથી સહા હુર જ રહેશે.

(રેલવે સ્કૂલ કાંપાઉન્ડ, મીટરગેજ સ્ટેશન
સામે, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫)



[૬]

કમળો (પાંડુરોગ)

• જે. પી. જોશી

મારી ઉંમર અત્યારે આશરે ૬૩ વર્ષ છે. પાઠણની લો કોલેજમાં આચાર્ય તરીકે લગભગ પાં વર્ષ કામ કર્યા ખાદ ૧૯૮૮ માં હું નિવૃત્ત થયો છું. હમણું પ્રા-યોગ ટ્રસ્ટમાં જેડાઈ ગિફ્ટવાણીલુની સાથે નિસર્જોપચારને લગતું પ્રચારકાર્ય સેવાભાવથી કરી રહ્યો છું. નિસર્જોપચાર વિષે પહેલાં તો મને ખાસ વિશેષ માહિતી ન હતી. પાઠણની કોલેજમાં જેડાયા પહેલાં મેં ગાંધીનગરમાં ભાવા કુમિશનના અધ્યક્ષ તરીકે લગભગ ૬ વર્ષ સુધી કામ કર્યું હતું; એ વર્ષને કુદરતી ઉપચાર વિષે થોડું ધ્યાન જાણુવા મળ્યું હતું. એ અરસામાં જ ગિફ્ટવાણીલુના પરિચયમાં આવવાનું થયું. ત્યારે કુદરતી ઉપચાર વિષે ધ્યાન નવું જાણુવા મળ્યું. તેઓએ ગાંધીનગરમાં પાંચ-૭ મહિના દરમિયાન લગભગ ૪૦૦ જેઠલા રોગીઓનો કુદરતી ઉપચાર કર્યો હતો. એમાનો એક હું પણ હતો. મને તાવ ચઢ્યો અને કુદરતી ઉપચારના સિદ્ધાંત પ્રમાણે મેં એત્યું દિવસના ઉપવાસ

કર્યા. એથી તાવ જિતરી ગયો. આમ થતાં કુદરતી ઉપયારમાં મારી શ્રદ્ધા દદ થઈ ગિદવાણીનું એ ગાંધીનગરમાં આપેલાં વ્યાખ્યાન સાંભળ્યા પછી મને ખાતરી થઈ કે કુદરતી ઉપયાર પદ્ધતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક આધારવાળી પદ્ધતિ છે.

પૂર્વલુચનમાં વર્ષો સુધી ઐટાં ખાનપાન અને એટી રહેણીકરણી અપનાવ્યાં હતાં એ કારણે ૧૯૭૭ માં મારું આરોગ્ય કથળ્યું હોય એવાં ચિહ્નન દેખાવા લાગ્યાં તા. ૧૫-૬-'૭૮ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણમાં વોં કોલેજના આચાર્ય તરીકે જવાનું થયું. વ્યવસાયથ્રસ્ત કુદુંબને અમહાવાહ છોડી બડીલ માતાપિતા સાથે પાટણ ડૉ. સી. સી. પરીણના સકાનમાં રહેવા ગયો. તેઓ વારંવાર મને કહેતા કે મારા લોહીમાં હિમોગ્લોબિન ઓછું છે, ખૂબ ફીકાશ છે અને મારે હવા લેવી જેઈએ. હું તે લેવાની ના પાડતો ત્યારે તેઓ કહેતા કે હું ભૂલ કરું છું. પાટણ ગયા પહેલાંના મહિનાએ નિષ્ક્રિયતા અને ચિંતામાં ગયેલા તો પાટણમાં મહિનાએ સુધી ખૂબ પ્રવૃત્તિ અને પરિશ્રમ કરવાનું થયું. કોઈ કોઈ વખત પેશાખ પીણો આવતો અને થાકેડો લાગતો. મારા ખાનપાનમાં મેં ધી, હ્રદ અને ફળ-ફળાદિ વધાર્યાં પણ એકાદ માસ પછી તો વધુ પીણો પેશાખ આવવા લાગ્યો—ત્યારે થયું કે કમળો હતો અને વધેલો છે—લોકો જાતજાતની સલાહ આપવા લાગ્યા. કોઈ ચણ્ણ ખાવાનું કહે, કોઈ અમુક લાઇની હવા લેવાનું કહે—મને કુદરતી ઉપયારમાં શ્રદ્ધા હતી એટલે મેં શેરડીનો

રસ, ઇણો વધુ લેવાનાં રાખ્યાં. કઠોળ લેવાતું બંધ કર્યું
ધી વગરનો રોટલી કે રોટદો લેતો—હૃદ પણ બંધ કર્યું
આમ થોડા હિવસ ચાલ્યું પણ ખાસ ઝાયદો ન હેણાયો.

આ તકલીફ અંગે સલાહ લીધી ત્યારે શ્રી ગિદ-
વાણીએ મને થોડા ઉપવાસ સાથોસાથ આરામ અને ત્યાર
આદ ઇણો ઉપર રહેવા સૂચયું. મેં નણોક હિવસ એકલા
પાણ્ણી ઉપર રહી ઉપવાસ કર્યા. તે દરમિયાન આરામ લીધો.
પણ પછી આરામ ન લઈ શક્યો. ઇણકણાહિ લેવાતું વધાયું.
રોટલી—રોટલા સાથે રાંધીલ ભાજુઓ લેતો. પાછળથી શ્રી
ગિદવાણીએ કહેલું કે ભાજુઓનાં પાન કાચાં જ ખાવાથી
લાલ થાય છે. ભાજુઓ અને તેમાંથી પાલખ, તાંદળનો
આંક્ષી કે રાંધીને ખાવાથી તો પથરી થવા સંભવ છે. તેમણે
કહ્યું કે ડૉ. ટિલ્ડન કુમળામાં ઉપવાસ કરવા ઉપર અને
સંપૂર્ણ આરામ લેવા ઉપર ભાર ભૂકે છે, તો મારે પણ
થોડા વધુ ઉપવાસ કરવા. મારાથી તે ત્યાં શક્ય ન હતું.
વળી શારીરિક તપાસ પણ અમદાવાદમાં સારી રીતે થઈ
શકે એટલે અમદાવાદ આવી મેં તા. ૧૭-૨-'૭૬ના રોજ
એલ. જી. હોસ્પિટલમાં લોહી અને પેશાખનો રિપોર્ટ લીધો
તો તેમાં લોહીમાં બીલીઝ્બીન ૪ મિલિયામ % હતું,
અને પેશાખમાં બાઇલ સોલ્ટ તથા બાઇલ પિગમેન્ટ્સ
(Bile Salts & Bile pigments) હતાં; એટલે કુમળો છે
તેમ નક્કી થયું અને હવે તેનું કારણ શોધવા એકસ-રે
ફોટો પણ પડાવવા એલ. જી. હોસ્પિટલના ડૉ. સી. જી.

ખરીખ (એમ.ડી)ની સલાહ પડતાં તા. ૨૦-૨-'૭૬ના રોજ
ક્રીટો લેવડાંયો. તેનો રિપોર્ટ નીચે પ્રમાણે આંયો :

A single R. O. Shadow is seen in the right hypochondrum. May be artefact or calculus-Advised repeat after good preparation.

ઉપર્યુક્ત રિપોર્ટમાં ખતાંયું છે કે યકૃતના સ્થળે
એવું નિશાન છે કે જેથી ત્યાં પથરી હોવાનો સંભવ છે.
આ રિપોર્ટ શાંકાવાળો હોવાથી ઇરી એક્સે-રે ક્રીટો
પાડવાની સલાહ આપવામાં આવી.

આ ખધા રિપોર્ટ ડોક્ટર સી. જે. પરીખને ખતાવતાં
તેમણે મને બાઈસોલોન તથા નિએમાઈસીનની વીસ વીસ
ગોળીએ. અને એકાસ્યુલસની વીસ કેપ્સ્યુલ ખરીદી રોજ
એક એક લેવા પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. મેં આમાંથી કોઈ
ગોળી ખરીદી નહિ અને ગિફવાણીલુના માર્ગદર્શન નીચે
કુદરતી ઉપયારનો પ્રયોગ ચાલુ રાય્યો.

ગિફવાણીલું અમદાવાદમાં મારે ત્યાં અવારનવાર
આવતા. શા. કારણે કમળો થાય છે અને તે કેવી રીતે
કુદરતી ઉપયારથી મટે છે તે અંગેના વિશ્વપ્રાણીત ડોક્ટરદેઓનાં
મંતુંયો. તેઓ મને વંચાવતા ગિફવાણીલુએ મને
ખૂબુ સારી રીતે સમજાયું કે યકૃત લોહીમાંથી અનેક જેરી
પદાર્થી કાઢીને પિત્ત થનાવે છે. આ પિત્ત પિત્તનળી મારક્ષતે
નાના આંતરડામાં પહોંચે છે, જ્યાં તે પાચનતંત્રનાં મહત્વનાં
કાચોમાં સહાયક બને છે. કોઈ કારણુથી આ પિત્ત નાના

આંતરડામાં ન પહેંચી શકે તો લોહીમાં ઊરી પહ્ણાથેનું પ્રમાણું વધી જય છે. આને લીધે આખું શરીર પીળું પડી જાય છે, પેશાખ પણ પીળો આવવા લાગે છે. આ રોગને કમળો અથવા કમળી કહે છે. શરીરની બધી પ્રક્રિયાઓ મંદ પડી જાય છે અને અંતે મૃત્યુ નીપજે છે. પિત નાના આંતરડામાં ન પહેંચવાનાં ઘણાં કારણ હોઈ શકે છે. કોઈ ગાંડ, પથરી અથવા કેન્સરને લીધે પિતનળી ઝાઈ જાય છે, જેથી પિત નાના આંતરડામાં પહેંચી શકતું નથી અથવા તો અનેક કારણોસર યકૃત લોહીમાંથી આ વિષક્રોધ અલગ કરવામાં અસમર્થ બની જાય છે. આમ થાય તોપણું પિત નાના આંતરડામાં પહેંચી શકતું નથી. ડોક્ટર ટિલ્ડન (એમ.ડી.) લખે છે કે ગમે તે પ્રકારનો અવરોધ પેદા થાય અથવા રોગનાં લક્ષણ ગમે તેટલાં તીવ્ર હોય, રોગીને ખાંડ, સ્ટ્રાર્ચ અને ચરણી નહ્િં આપવાં જોઈ શે. માત્ર આરામ જ રોગીનો એકમાત્ર ઈલાજ છે. શરીરતંત્રનો આરામ (ઉપવાસ) સૌથી વધુ મહત્વનો છે. સાથે સાથે શારીરિક અને માનસિક આરામ પણ જરૂરી છે. અમદાવાદમાં આવી મેં ત્રણોક વધુ ઉપવાસ કર્યા અને પછી એકલા ઇણોના રસ ઉપર થોડા દિવસ રહ્યો. પરિણામે શરીરમાં ખૂબ નથળાઈ આવેલી હતી. આથી ઘરમાં બધાને ઢીક ઢીક ચિંતા રહેતી હતી.

થોડા દિવસ બાદ કુરીથી એકસ-રે ફેટો પાડવાનો હતો. તે લેવડાંયો. અને સાથેસાથ લોહી તથા પેશાખનો રિપોર્ટ પણ લીધો. લોહીમાં પહેલાં ભીલીડભીન ચાર

મિલિથામ % હતું તે ઘરીને ૩.૫ ટકા આંધું જ્યારે પેશાળ એવોને એવો જ હતો, પણ આ ઉપરથી કમળો હવે એછો થવા લાગ્યો છે એમ જાણવા મળ્યું. બીજે એકસ-રે લૈવડાંયો તેનો રિપોર્ટ એવો હતો કે યકૃતના સ્થળે કંઈક પથરી જેવું લાગે છે, સંભવ છે કે પિત્તાશયમાં પથરી હોય; પરંતુ પથરી જેવી સ્પષ્ટ આકૃતિ હેખાતી નથી; એટલે હવા આપી ડોલીસિસ્ટોથાઇ (એક પ્રકારની તપાસ) કરાવવી જેઈએ.

Evidence of calcification seen in Right Hypochondrum. May be calcification of gall-bladder (Physiological). No evidence of well shaped R. O. stone seen. Advised oral Cholecystography.

આ અને રિપોર્ટ ડોક્ટર સી. જે. પરીખને ખતાવતાં તેમણે મને પૂછ્યું કે મેં એમણે લખી આપેલ ગોળીઓ લીધી છે કે નહિ? જ્યારે મેં કહ્યું કે હું કુદરતી ઉપયારનો પ્રયોગ કરું છું એટલે મેં ગોળીઓ નથી લીધી ત્યારે તેમણે મને સ્પષ્ટ લાષામાં જણાંધું કે આમ કરશો તો તમારો કમળો નહિ મટે.

ડોક્ટર સી. જે. પરીખના મંત્રયની અસર ઘરમાં અને બીજાં સંગાંવહાલાંએ ઉપર ખૂબ પડી. બધાં મારે ઘેર આવી મને હોસ્પિટલમાં દાખલ કરાવવા અને હવા લૈવડાવવા આથડું કરવા લાગ્યાં. મારી યાસે કોઈ આવી આ બાખતે કાંઈ કહેતું તો તેને હું દર્શારો કરી રોકતો અને જણાવતો કે મારે પૂર્ણ આરામ લેવાનો હોઈ મારી

સાથે વાતચીત ન કરવી. આમ હું મૌન રાખવાનું પસંદ કરતો. છતાં કુટુંબમાં વ્યથતા અને ચિંતા ખૂબ હતાં. તેવામાં સુંબર્ધથી એક પત્ર આપ્યો, જેણે આ વ્યથતા અને ચિંતામાં ઉમેરો કર્યો. મારા એક પિતરાઈ લાઈને કમળો થયેલ. હોસ્પિટલમાં તે મટી જતાં ઘેર લાગ્યા, ત્યાર બાદ રોગે ઉથલો માર્યો અને તેમાં તેનું મૃત્યુ થયું. આ મૃત્યુના સમાચાર એ પત્રમાં હતા. હું દ્વારા લેતો ન હતો, હોસ્પિટલમાં દાખલ થતો ન હતો અને જે પ્રચોગ કરી રહ્યો હતો તેનાથી શારીરિક નખળાઈ ખૂબ આવી હતી. તેથી બધાં ખૂબ ચિંતામાં હતાં. હવે મારું પણ શું થશે તેની બધાંને ચિંતા હતી.

મુંખાઈવાળા પત્રથી મને થોડું માનસિક બળ મળ્યું. મને થયું કે એ લાઈને ઈલાજ સુંબર્ધની એક સારી હોસ્પિટલમાં કરવામાં આપ્યો. તે સારા પણ થઈ ગયા. ઘેર આપ્યા અને ત્યાર બાદ રોગે એવો ઉથલો આધ્યા કે તેમનું મૃત્યુ થયું. એનો અર્થ એ કે એ રોગ મટયો નહિ હોય. ઉપર્યુક્ત દ્વારાઓથી તે ફાયાઈ ગયો હશે. રોગનું ખરું કારણું હૂર નહિ થઈ શક્યું હોય. ઘેર આપ્યા બાદ રોગનું કારણું હૂર ન થયું હોવાને લીધે રોગનાં લક્ષ્ણણું ફરી પગટ થયાં હશે. દ્વારાઓ ખાવાથી જીવનશક્તિ બહુ ઘટી ગઈ હશે, જેથી શરીર દોગનો સુકાખલો નહિ કરી શક્યું હોય; પરિણામે મૃત્યુ નીપળ્યું હશે. એટલે કુદરતી ઉપયારમાં અટલ રહેવાનું મેં નષ્ટી કરી લીધું:

મારે ૧૯૭૮ ના માર્ચની આખર તારીખે કોલેજના કામ સારુ અમદાવાદથી પાટણ જવાનું જડી હતું. નણળાઈ પુષ્કળ હતી તેથી ગિફવાણીઓ તો કહ્યું કે પાટણ ન જવાય તો સારું; પણ બીજે કોઈ વિકલ્પ ન હોઈ મેં જવાનું વિચાર્યું; અને તે પહેલાં મારું લોહી અને પેશાખનો રિપોર્ટ લેવડાવતાં જાણવા મળ્યું કે લોહીમાં ૧ મિલિયામ % બીલીઝીન હતું અને પેશાખ તો બિલકુલ સાંકે હતો. આઠલું ૧ મિલિયામ % બીલીઝીન સાંજ નરવા માણુસના લોહીમાં પણ હોય છે તેમ જાણતાં થયું કે કમળો મટેલો છે. આ પછી મેં કોઈ રિપોર્ટ નથી લીધો અને હિન્પ્રતિહિન મારી તખિયત સુધરતી ગઈ છે.

(૨૧, મધુકુંજ સોસાયટી, કાશીવિશ્વનાથ મહાદેવ
પાછળા, મણિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮)



આપણા કર્મથી આપણે માંદા પડીએ તેમ વિચારથી પણ, માંદા પડીએ. પોતાના દીકરાને કોગળિયું થયું તે જોઈ બાપને પણ થયું, એવા દાખલા આપણે ધણા જોઈએ છીએ. એક પ્રસિદ્ધ વૈદે કહ્યું છે કે, જેટલાં માણુસો મરકી વગેરે રોગોથી મરે છે તેના કરતાં વધારે લયથી મરે છે. “બીજણ કર્માતે મરે છે” એ કહેણું વિચારવાલાયક છે.

—ગાંધીજી

[૧૦]

આંખનો રોગ

• કનુભાઈ શિવાભાઈ પટેલ

આદરણીય શ્રી ગિર્વાળીજી,

થોડાં વર્ષ પહેલાં હું જે ભીમારીમાં સપડાયો હતો અને આનુષંખિક તકલીફ જિલ્લો થઈ તેનું તથા કુદરતી ઉપયારે કેવી યારી આપી તેનું ધ્યાન દૂંકમાં રજૂ કરું છું.

તા. ૨૬-૧૦-'૮૨ના રોજ ટાઠ ચડીને તાવ આંખો. ઇમિલી ડોક્ટરે મેલેરિયાનું નિદાન કરીને કિવનાઈનની ખાર ગોળી આપી. પાંચ દિવસમાં તબિયત ઢીક થઈ ગઈ. ત્યાર પછી વીસ દિવસ સારું રહ્યું. તા. ૨૨-૧૧-'૮૨ના રોજ તાવ આંખો-ઠંડી વાઈને. ડોક્ટરને બતાયું. નિદાન કરવા માટે પેશાખ ચેક કરાયો. પેશાખમાં પરુ આંખું તેના માટે એકટ્રીમનો કોસર્સ આપ્યો. એત્રણુ ગોળી લીધા પછી જિલાટી અને પાતળા અડા શરૂ થઈ ગયા. ડોક્ટરે એકટ્રીમ ચાલુ રખાવી તથા અડાજિલટી ખંધ થવાની ગોળીઓ આપી. જીલ એ દિવસમાં તકલીફ ચાલુ રહ્યો અને તબિયત વધારે

ખગડી. તાવ ચોવીસે કલાક ૧૦૩ થી ૧૦૪ ડિંધી રહેતો તથા પ્રુણરી સખત આવતી.

તા. ૨-૧૨-'૮૨ના રોજ લોહીની તપાસ કરાવતાં કુલ શૈવેતકણ W.B.C. ૧૦૦૦ થી ઓછા થઈ ગયેલાં આંધા. બધી દવા બંધ કરી. ચોવીસ કલાકમાં તાવ એ કલાક માટે ૧૦૦ અંશ થઈ જતો, પછીના ૨૪ કલાકમાં તાવ ૪ થી ૫ કલાક ૧૦૦ અંશ સુધી રહેતો. વધુમાં વધુ એ ડિંધી રહેતો. બીજે દ્વિવસે કોઈ પણ દવા વગર તાવ નોર્મલ થયો. પછી કુલ W.B.C. તથા પેશાખના રિપોર્ટ નોર્મલ આંધા. અશક્તિ ખૂબ હતી. તાવ બિલકુલ ન હતો. ચાર પાંચ દ્વિવસ ઇક્ષત મગનું પાણી, નારંણી, મોસંબી તથા ચામચરા દેતો. સારું થઈ ગયું હતું પરંતુ અશક્તિ ખૂબ જણ્ણાતી હતી. તા. ૨૮-૧૨-'૮૨ની રાતના આંખમાં ખૂબ કળતર થઈ ને લાલ થઈ ગઈ આપો દ્વિવસ આંખમાંથી પાણી નીતરતું. આંખના નિષ્ણાતને બતાયું. તેમણે એટની સોલનાં ટીપાં ૧૫ દ્વિવસ નાખવા કહ્યું. ૧૫ દ્વિવસ પછી પાણી નીતરવાનું ઓછું થઈ ગયું પરંતુ આંખ લાલ રહેતી. તડકામાં વધારે તકલીફ થતી. દેખાવાનું આંખું થઈ ગયું હતું. ત્યાર પછી પણ એટનીસોલ તથા કેમ્બીરાન આંખમાં નાંખવાનું ચાલું રાખ્યું તથા પ્રોટીનેક્સ અને ફોસ્ફોમીન ચાલુ કરાયું. રાહત થઈ પરંતુ આંખું દેખાતું હતું. હવે દર પંદર દ્વિવસે એક આંખ લાલ થઈ આખી રાત કળતર થતી અને બીજે દ્વિવસે દેખાવાનું બિલકુલ બંધ થઈ જતું. ઉપર સુજણની સારવારથી લગભગ ૪-સાત દ્વિવસ પછી

આંખું દેખાવાનું શરૂ થતું. ધીમે ધીમે પંદર દિવસે દેખાવાનું સુધરતું પરંતુ વાંચી શકાય તેટલું સારું નહિ. બરાબર પંદરમે દિવસે બીજુ આંખ એકદમ રાતમાં કળતર થઈને લાલ થઈ જતી.

આજો દિવસ પાણી નીતરતું અને દેખાવાનું બંધ થઈ જતું. ધીમે ધીમે છ દિવસે આંખની લાલાશ ઓછી થતી ને દેખાવાનું શરૂ થતું. પંદર દિવસે માઇક્રોસરનું દેખાવા લાગે એટલે પાછી બીજુ આંખ લાલ થઈને દેખાવું બંધ થઈ જતું. આમ વારાઝરતી એક આંખ બગડે અને બીજુ સુધરે એવો કુમ લગભગ ચાર મહિના ચાલ્યો. દ્વામાં ખાસ પ્રોટીનેક્ષ તથા ફોસ્ફેટીન અને વધારામાં સુંમાનટીલ ગોળીઓ ૬૦, ત્યાર પછી ડેકાઝોન ગોળી ૨૦, ત્યાર પછી સુધારો ન લાગવાથી ડેકાઝોન ઈન્જેક્શન પાંચ આંખમાં આપ્યાં. આ સાથે પાઈનાકોર્ટ તથા કેમ્થ્રીશન આંખમાં નાખવાનું દિવસમાં એ વખત વારાઝરતી ચાલુ હતું.

એપ્રિલ '૮૭ના છેલ્લા અઠવાડિયામાં દ્વારા બંધ કરી. મે માસના પહેલા અઠવાડિયામાં આપનો પરિચય થયો ત્યારે મોઢેથી લેવાની દ્વારા બંધ હતી, પરંતુ આંખમાં નાંખવાની દ્વારા ચાલુ હતી. સી. ચુ. શાહ કોલેજમાં ચાલતા આપના કલાસમાં નિયમિત આવવાનું ચાલુ કર્યું ત્યારે પણ દર પંદર દિવસે વારાઝરતી આંખમાં લાલ થઈને દેખાવાનું બંધ થઈ જતું હતું. આપના કહેના સુજાય જમવામાં ફૂકા કાચાં શાક તથા પાંદડાવાળી ભાજુના રસ તથા ફળ લેતો.

આ સિવાય સોજનમાં કંઈ લેતો નહિ. આંખમાં ટીયાં ચાલુ હતાં. પંદર હિવસના અંતરે આવતો કેમ પહેલીવાર તૂટ્યો. આંખ લાલ થઈ નહિ ને હેખાતું બંધ થયું નહિ. આથી મને પુષ્કળ ભરેંસો એઠો. નેચરોપથી માટે મારું મન તથા શરીર બંને સો ટકા રાજુ થયાં. આંખનાં ટીયાં પણ બંધ કર્યાં. બીક લાગતી કે કચાંક બહારનો ચેપ લાગશે. પરંતુ આપના કહેવાથી તે પણ છોડી હીધી. હવે એલોપથીની કોઈ પણ દ્વારા હું લેતો ન હતો કે આંખમાં નાંખતો ન હતો. પરંતુ કંઈ તકલીફ થઈ નહિ. લગલગ એક મહિનામાં તો બંને આંખોની લાલાશ ગઈ. પાણી નીતરતું જિલકુલ બંધ થઈ ગયું. પરંતુ હજુ આંખું હેખાતું હતું. નેચરોપથી ચાલુ રાખી. એ મહિના પછી કાચાં શાક, પછી તેલ-ધી વગરની થૂલાવાળી રોટલી ચાલુ કરી. બરાબર અઠી માસ પછી બંને આંખો લગલગ સારી થઈ ગઈ. દૃષ્ટિ લગલગ ૬૦ ટકા સારી થઈ ગઈ. આપની રજા પછી સ્વીમિંગ પૂલ કે જેમાં બણે માસ જૂનું પાણી હોય છે તેમાં તરવા પણ જતો; પરંતુ આંખ લાલ થતી નહિ. ધીમે ધીમે ચાર માસ પછી દૃષ્ટિ ૬૫ ટકા સારી થઈ ગઈ. હવે જમવામાં બધું ચાલુ કર્યું છે. પરંતુ કાચાં શાક સોજનનો પોણો લાગ અને બાકીની રસોઈ પા લાગ આ પ્રમાણે અત્યારે ઝોરાક લડ્યા છું. હાલમાં મારી તખિયત તંહરસ્ત છે. કોઈ પણ જાતની તકલીફ નથી. કુદરતી ઉપયાર મારા માટે આશીર્વાદ રૂપ નીવડયો છે.

(૧૫, મેહુલપાર્ક સોસાયટી, જૂના વાડજ બસ સ્ટોપ સામે,

આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩)

અમારું મંતવ્ય

રોગમુક્તિની ઉપર્યુક્ત ઘટના કુદરતી ઉપયારના સિદ્ધાંતોને સંપૂર્ણ સમર્થન પૂરું પાડે છે. કુદરતી ઉપયારના સિદ્ધાંત અનુસાર અધા તીવ્ર રોગ (તાવ પણ) કુદરતે શરૂ કરેલી શુદ્ધિ (cleansing) ની એક પ્રક્રિયા જ હોય છે. આ પ્રક્રિયાઓને દ્વારા વડે રોકવી એ શરીર ઉપરને એક અત્યાચાર જ ગણ્યાય. આવા સમયે તો ઉપવાસ અને આરામ કરવાથી શુદ્ધીકરણની પ્રક્રિયા બહુ સરળતાથી પૂરી થાય છે અને શરીર ની રોગી બને છે, જેરી દ્વારા લેવાથી શુદ્ધીકરણની આ પ્રક્રિયા અટકી પડે છે અને દ્વારાંપી જેરથી શરીરમાં વિષદ્રવ્યનું પ્રમાણ ઓર વધી જય છે. થોડા સમય પછી કુદરત ફરી એકવાર તીવ્ર રોગના રૂપમાં આ વિષદ્રવ્યને અડપથી બહાર ફેંકવાનું શરૂ કરે છે અને આપણે ફરી દ્વારા લઈ આ પ્રક્રિયાને રોકીએ છીએ. વારંવાર આમ કરવાથી આપણી લુધનશક્તિ ઘટી જય છે અને શરીર તીવ્ર રોગના રૂપમાં ગંદકીને અડપથી બહાર ફેંકવામાં અસમર્થ બની જય છે. શરીર ધીમે ધીમે રોજ થોડી ગંદકી બહાર ફેંકતું રહે છે જેથી રોગતક્ષણ રોજ ચાલુ જ રહે છે. આવું બને છે ત્યારે આપણે કહીએ છીએ કે રોગ હઠીલો રોગ (chronic disease) બની ગયો છે. એને ફર કરવા ફરી જુદી જુદી જતની જેરી દ્વારાનું સેવન કરવામાં આવે છે. શરીરમાં વિષદ્રવ્ય પેહા થવાનું મૂળ કારણ (ખોટા પ્રકારનાં ખાનપાન અને રહેણીકરણી) ફર કરવાને બદલે શરીરમાં વધુ ને વધુ

ઝેરી દવાએ પધરાવતા રહીએ છીએ. પરિણુંમે હડીલો રોગ વધુ ને વધુ હુઃખદાયક બનતો જય છે. દવાએની ઝેરી અસરથી શરીરનાં બીજાં અંગો વિકૃત બને છે, અને તે અંગોને રોગિષ્ઠ બનાવે છે. એક હડીલા રોગમાંથી એ કે ત્રણું એવા રોગ જિલા થાય છે. આ ટાંકણે પણ આપણે જે ખાનપાન અને રહેણુંકરણુંની રીત સુધારી લઈએ એટલે કે શરીરમાં વધુ વિષદ્રોધ આવવા ન દઈએ તો કુદરત પોતે જ પહેલેથી એકઠાં થચેલાં વિષદ્રોધને બહાર ફેંકી શરીરને ફરી સ્વસ્થ બનાવી દેશે. કુદરત તો બધી રીતે સમર્થ હોય છે. આપણે જ તેના માર્ગમાં અંતરાય જિલા કરતા હોઈએ છીએ.

શ્રી કનુભાઈના દાખલા ઉપરથી કુદરતી ઉપયારના ઉપર્યુક્ત સિદ્ધાંત હસ્તામલકૃત એટલે કે એકદમ સ્પષ્ટ થઈ જય છે. તેઓએ પહેલીવાર તાવ આવ્યો ત્યારે જ જે એ-ત્રણું હિવસના ઉપવાસ અને આરામ કર્યો હોત તો તેમનો કેસ આટલો અટપટો ન બની ગયો હોત. ગિદ્વાણીજીની સાથે રહીને મારી પોતાની ઉપર તથા બીજાએની ઉપર આ ઉપયારની સફળતાનો અનુભવ અનેક વાર કર્યો છે. શ્રી કનુભાઈએ તાવ ઉતારવા દવાએ લઈ લાંણા સમય સુધી હુઃખ લોગણ્યું, પૈસાનું પાણી કર્યું, ઉપયાર માટે ધક્કા ખાધા અને હેરાનગતિ લોગવી. તેઓએ કુદરતનું શરણ ન લીધું હોત તો કહાચ આંખ ઘોઈ બેસત. તેઓએ ઘેર રહીને જ પોતાનું કામકાજ ચાલુ રાખી ફક્ત ખાનપાન અને

રહેણુંકરણુંમાં થાડો ફેરફાર કર્યો કે તરત ધારી સફળતા મળી. જલચિકિત્સા કે એવો ડોઈ બીજે ઉપયાર તેઓએ કર્યો ન હતો. ખાનપાન અને રહેણુંકરણુંમાં થાડો ફેરફાર કરવાથી જ, ને રોગ નિષ્ણાત ડોક્ટરો મટાડી શકતા ન હતા તેને પોતે જ કાણૂમાં લઈ શક્યા. એનો અર્થ એ કે કુદરત મોટામાં માટો ડોક્ટર છે.

ને. પી. જોધી
તંત્રી, આરોગ્ય પ્રકાશ.



દાક્તર મેજેન્ટી કહી ગયો છે કે, ‘વૈદું એ મહા પાખંડ છે.’ સર એસલી કુપર કરીને પ્રઘાત દાક્તર થઈ ગયો. તેણું કહ્યું છે કે ‘વૈદકશાસ્ત્ર એ માત્ર અટકળ ઉપર રચાયેલું છે.’ સર જેન ઇંસ્ટિઝ્યુન્ટ કહ્યું છે કે, ‘વૈદોના ઉહાપણ છતાં પણ ધણા માણુસોના રોગ કુદરતે જ હૂર કર્યા છે.’ દાક્તર એકેર જણાવે છે કે, ‘રાતિયા તાવમાં જેટલા દરદી ભરે છે, તેના કરતાં ધણા વધારે તે દરદની દવાથી ભરે છે.’ દાક્તર ફરોલ કહે છે કે, ‘વૈદ્ય કરતાં વધારે અપ્રામાણિક ધંધો લાગ્યે જ જોવામાં આવે છે.’ દાક્તર ટોમસ વોટસન કહે છે કે, ‘ધણા અગત્યના સવાલ વિષે શક્યી ભરેલા સમુદ્ર ઉપર આપણો ધંધો બટક્યા કરે છે.

(ગાંધીજી કૃત ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન’માંથી)

[૧૧]

કણનિયત

● દુર્ગાપ્રસાદ આર. ત્રિવેદી

મારી ઉંમર અત્યારે ૫૮ વર્ષ છે. શરીરનો બાંધી એકવડો છે. ગોસેવાના ક્ષેત્રે ઉજ વર્ષોથી સેવા આપવાનું તેમજ ગાંધી સમારક સંયુક્તાલયમાં આર્કાઈવના સંશોધન વિભાગમાં કાર્ય કરું છું. ગાંધી આશ્રમ વિસ્તારમાં આવેલા ગોસેવા સંઘ છાત્રાલયના સંચાલક તરીકે ત્યાં જ નિવાસ કરું છું. મારો પરિવાર રાજકોટ હોઈ લોજન બનાવવું આહિ કામ જાતે જ કરવાનું રહે છે. અત્યાર સુધીના જીવનકાળ દરમિયાન મારું શરીર લગભગ એક યા ખીળ રોગથી ઘેરાયેલું રહ્યું હતું. છેલ્લાં દોઢેક વર્ષથી કુદરતનું શરણ લીધું એથી હું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે.

મારા જન્મ કચ્છ-ભૂજ નજીકના ગામમાં થયો હતો. ૨૧ વર્ષની ઉંમરે મારા પિતાશ્રી સાથે પૂર્વ-ઉત્તર ભારત દર્શન યાત્રા પ્રવાસમાં ૬-૭ માસ ગાળ્યા. સ્વાલાવિક રીતે લોજન, નિદ્રા, શૌચ આહિ કિયા વગેરે જીવનબ્યવહારમાં વિરોષ અનિયમિતતા થઈ જતી અને જુદ્ધા જુદ્ધા પ્રહેરોાના

એચાકપાણીની અસરને કારણે સ્વાસ્થ્ય અગડયું. ૧૯૪૮માં ભૂજ પાસે આવેલા સ્વરાજ આશ્રમમાં છ મહિના સુધી પશુપાલનનું શિક્ષણ લીધું. ત્યાર બાદ અભિલ ભારત કૃપિ જોસેવા સંઘ, વર્ધાના વિદ્યાર્થી તરીકે ત્યાંની રાજ્ય સરકાર દ્વારા ચાલતી ટ્રેનિંગ કેલેજમાં જને ૧૯૫૦માં એક વર્ષનો કોર્સ પૂરૈ કર્યો. તેમાં પણિલક હૃદય સાથે વેટરનરી તથા ડેરી અંગેનો અભ્યાસક્રમ હતો. તે દરમિયાન ૧૯૫૧માં કાર્યજિયાતને કારણે તબિયત બરાબર રહેતી ન હોઈ વર્ધાની કરતૂરણ હોસ્પિટલમાં સારવાર લેવી પડી. ટ્રીટમેન્ટ જુદી જુદી પથીઓ દ્વારા થતી હોઈ, પ્રથમ એલોપથી દવા આપ્યા બાદ ઇસખગુલ જુદી જુદી રીતે ૪-૫ દિવસે સુધી (પાણી, હ્રદ, દહી, ધાસ વગેરે સાથે) આપેલ છુટે દિવસે સાખુવાળા ગરમ પાણીની એનિમા લેવી પડી. ડોક્ટરોનું સૂચન હતું કે એચાકમાં ભાજ લેવી, જેથી સંસ્થાના સંચાલકોએ મારે માટે ભાજનું શાક આપવા બ્યવસ્થા જોડવી હતી. પરિણામ સારું આંધું. નવેમ્બર ૧૯૫૨માં સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ પાસેની આદર્શ નૂતન ગૌશાળાના સંચાલક તરીકે મારે ત્યાં જવાનું થયું. ખુલ્લી હવા, તાજું હ્રદ, મુક્કા વાતાવરણ અને નિયમિતતા વગેરેની અનુકૂળતા પ્રાપ્ત થતાં સ્વાસ્થ્ય સારું જળવાયું. એચાકમાં સામાન્ય રીતે હાળ, ભાત, રોટલી, શાક, હ્રદ વગેરે લેતો.

જને ૧૯૫૩ના જાન્યુઆરીમાં ૨૫ વર્ષની ઉંમરે લગ્ન થયું. એતણું વર્ષ પછી ચોગ સાધનામાં રુચિ થતાં ચોગાસન,

સૂર્ય નમસ્કાર વગેરે કરવા લાગ્યો. એ સમયે સાધુસાંતોનો સંપર્ક થતાં જ્યોતિષ તथા હસ્તરેખાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એ વખતે કબજીયાતની ઇરિયાદ વારંવાર સતાવતી રહી. જ્યોતિષની દશ્ટિએ પેટની ભીમારી અને કબજીયાત જીવનમાં ચાલુ રહેશે તેવી જન્મકુંડળીના શ્રહણની સ્થિતિ જાણી સમાધાન મેળવતો આમ છતાં પ્રયત્નો ચાલુ રાખ્યા.

સને ૧૯૬૫માં જન્મસ્થળ કચ્છમાં જઈ કુવારપાડાનો કાચો ગર્ભ ખાવાનું શરૂ કર્યું. લોજનમાં બાજરીના રોટલા, ભાજુ વગેરે કેતો. તણિયત સુધરતી જતી હતી. ત્યાં પગે ખરજવું થયું. તે મટાડવા પ્રથમ બાદ્ય ઉપયારો કર્યા. એલોપથી તથા આયુર્વેદના મલમો લગાડયા. વરાળ શેક માટે કુદરતી ઉપયાર કેન્દ્રમાં ગયો. પેશાળના પ્રયોગથી પણ આરામ ન થયો. છેવટે ઉથ ઔષ્ઠ્યોમાં લીંબુનો રસ, લસણ, ડામર (Tar) ગરમ કરીને લગાડયો તેથી પણ ખરજવું એછું થયું નહિ. સલ્ફિયુરિક એસિડનો ઉપયોગ કરી લયંકર યાતના વેહીને પણ ખરજવું નાભૂદ કરીને જ જાયેલો. ખરજવાનો ઈલાજ ૩-૪ વર્ષ ચાલ્યો. તે દરમિયાન ૧૯૬૪થી લોજનમાં નિમક લેવાનું બંધ કરેલ. તેમ છતાં પાચનશક્તિ મંદ થવાની સાથે કબજીયાતની ઇરિયાદ ચાલુ રહી. આયુર્વેદ અને કુદરતી ઉપયારમાં મારી શરીર વધતી જતી રહી, કારણું કે એલોપથીની સારવારથી થતી આડઅસરોનું વિજ્ઞાન વર્ધાના તાલીમ અભ્યાસ દરમિયાન પ્રાધ્યાપકો દ્વારા સમજવવામાં આવેલ. સને ૧૯૬૫માં કુદરતી ઉપયાર કેન્દ્ર સાવરકુંડલામાં

એક માસ દરમિયાન ઉપવાસ, માટીના પચોંગ, જલચિકિત્સા વગેરે ઉપચારે કરાયા.

હુણાળનાં વર્ષો (૧૯૬૫-૬૬) હોઈ સૌરાષ્ટ્રનું પશુધન અચાવવા અમરેલીમાં કેટલ કેમ્પની વ્યવસ્થા માટે મારે અમદાવાદથી અમરેલી વગેરે સ્થળે રોકાવાનું થયું. ગોસેવાના કામે સતત પ્રવાસ કરવો પડતો; અનિયમિતતા વધતી ચાલી તેથી તખિયત બગડી. ડૉક્ટર મિત્રોની સલાહ પ્રમાણે ઉપચારે થતા રહ્યા. સને ૧૯૬૭-૬૮માં એકતાલીસ વર્ષની ઉંમરે પાચોરિયા થતાં ધીમે ધીમે હાંત બગડયા અને નખળા હાંત કાઢી નાખાવતો ગયો. વાંચવા માટે ચશમાં પહેરવાની શરૂઆત કરી. ગોસેવા અંગે દક્ષિણ ભારતના પ્રવાસમાંથી પાછા બળતાં ઉડ્લીકાંચન જઈ આયો. સને ૧૯૭૦માં ડાકોરના ભરત લખનમાં રોકાયો. એક અનુભવી વૈદે નિહાન કર્યું કે આંતરડામાં કાચ્યા આમ ભરાયેલ છે. તેમના સૂચન પ્રમાણે ફૂકત દાળનું પાણી અને ચોખા લેવાનું રાખ્યું. કેટલાક દિવસો સુધી સૂરણું અને આદુ ઉપર જ રહ્યો, ફૂધમાં ઈસખગૂલ લેવાનું ચાલુ રાખ્યું. સને ૧૯૭૪ની આખરમાં પેટની જમણી બાજુ તીવ્ર વેહના સાથે તાવ આયો. પેશાખમાં બળતરા, માથાનો હુખાવો થતાં આખરે પથારીવશ થયો. એક ડૉક્ટર મિત્રે મને તપાસીને જણાયું કે પિત્તપકોપ આનું કારણ છે અને તેનું મારણ ફૂધ છે. તેમની સૂચના પ્રમાણે ઐરાકમાં ફૂધનું પ્રમાણું વધાર્યું. લીંખુના રસમાં મધ મેળવી લેવાનું શરૂ કર્યું. ફૂધ, દઢીં, છાસ વગેરે

ખટાશવાળી ચીજે ખાવી નહિ, મોસંબી, નારંગી ઇણો ખાવાં,
વિટામીન બી કેમ્પટેક્ષવાળો થૂલીવાળો એસાક વધુ લેવો,
હાથછડના ચોખા ખાવા વગેરે સામાન્ય કુમ રાખેલ. ભૂખ
લાગે તો જ જમવું. એપેન્ડીસાઈટીસ હોવાની તથા અલ્સરની
શાંકાના નિવારણ માટે વા. સા. હોસ્પિટલમાં ઈલાજ કરાયો.
લોહી, પેશાખના રિપોર્ટ તપાસ્યા ખાદ એકસ-રે લઈ નિદાન
થયું કે હાડકાંના કારણે દર્દ થતું હશે, તેથી ઓથેપિઝિક
વિલાગમાં વધુ ચકાસણી માટે એકસ-રે લીધા. ડોક્ટરો
નિદાન અંગે કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવી શકયા નહિ.
વિહેશી બનાવટની ગોળીઓ ખાવા જણાયું, જે કે મેં
તેનો ઉપયોગ કર્યો નહિ. સને ૧૯૭૬માં આયુર્વેદ ઔષધ
ચિકિત્સાલય ગોંડલમાં ઈલાજ કરાયો. રોગ તો જૂની
કણજિયાતનો હતો. આયુર્વેદ ઔષધથી ધણી રાહત થઈ.
સને ૧૯૭૭માં ઉત્તર ગુજરાતમાં આવેલ દેવ દરખાર મઠમાં
રોકાવાનું થયું ત્યારે ફ્રાંકલ્ય અને આહુના પ્રયોગો કર્યો.
પણ તેથી કણજિયાતની અસર વધી જતાં એરંડિયાના રેલનો
ઉપયોગ કરવો પડ્યો. સને ૧૯૭૮માં સાયેટીકાની અસર
પગમાં થઈ તે માટે થોળી સારવાર કરાવેલી; તેમાંથી રાહત
મેળવી. સને ૧૯૭૯-૮૦માં જમણા હુથને અસર થતાં
કામકાજ થઈ ન શકે તેવી સ્થિતિ સર્જિચ. પેટ સાદ્ય રાખવા
જુહી જુહી રેચક ક્રાકીએ ઘરે તૈયાર કરાવી તેમનો ઉપયોગ
આખુ રાખ્યો. વાનો એક પ્રકાર છે તેમ માની આયુર્વેદ
તેલ માલિશ વગેરે ઈલાને કરાયા પછી રાજકોટ સિવિલ
હોસ્પિટલમાં સારવાર લીધી. કેટલાક હિવસો વીત્યા ખાદ.

આથેપેડિક ડોક્ટરને એક ક્ષાર્મસી કંપનીએ સેમ્પલ માટે એક ઈન્જેક્શન આપેલ તેનો ઉપયોગ મારા હ્રદી માટે કરવા ડોક્ટરે સ્થૂચન કર્યું. આ પ્રકારનું ઈન્જેક્શન આપતાં પહેલાં સીરમ ટેસ્ટ કરાવવાનું જરૂરી હતું. પેશાણ, અડો તથા બોહીના ટેસ્ટ રિપોર્ટ ઉપર અલ્યાસ કરી ઈન્જેક્શન આપવામાં આંદ્રું. ખાસ પ્રકારની ગોળીએ ખાવાની સ્થૂચના પણ મળી. વિશેષમાં જણાવવામાં આંદ્રું કે હું ખાવા ઉપર શેક ચાલુ રાખવો કારણ કે આ હ્રદી ધણી ધીમી ગતિએ મટે છે. અઠવાડિયા બાદ ૧૦-૧૫ ટકા અસર થઈ. હું મિયોપેથી છલાજ પણ અજમાવી જેયો. હું જણુતો હતો કે મૂળ કારણ કાણજિયાત છે.

સને ૧૯૮૨માં તુલસીશ્યામ ધામમાં રહ્યો ત્યાં રોજ સવારસાંજ ગરમ પાણીના કુંડમાં નાહવા જતો તેથી ઢીક જણ્ણાતું. ત્યાંની પાણાણુલેહ વનસ્પતિનો રસ, તુલસીનાં પાન ખાનાથી હ્રદી નીકળી ગયું—પણ ન સમજી શકાય તેથી ઝુલ્લરી સાથે તાવ આંદ્રો—ઓકદમ અશક્તિ જણ્ણાય, ખોરાક લેવાય નહિ. પેશાણ પીળા રંગનો અને બળતરા સાથે નીકળે ઉપવાસ ર હિવસ રાખ્યો. ફળ ઉપર રહ્યો. દર એ મહિને તે જ રીતે તાવ આવે. ત્રીજીવાર ઉનાના ડોક્ટર પાસે ઈન્જેક્શન લેવાની ફરજ પડી. પણ વિદેશી ગોળીઓનો વધુ ઉપયોગ કર્યો નહિ. ચોથી વાર હળવો હુમલો થયો. ત્યારે નજીકના શુષ્ટપ્રયાગ ધામમાં અદ્ભુતચારીજીના આશ્રમમાં રહ્યો. ત્યાં દેશી વનસ્પતિમાંથી ભરમો બનાવી સારવાર

આપવામાં આવતી. એકાદ માસ ત્યાં રહી સને ૧૯૮૮ની આખરમાં રાજકોટમાં કુટુંબ સાથે રહી સામાન્ય ઉપયારો ચાલુ રાખ્યા. સને ૧૯૮૪માં પાછે અમદાવાહ આવી ગયો. ગોસેવાના ક્ષેત્રે કામ કરતા સ્નેહીમિત્રોએ તાજું હૃદ્ધ પીવા સલાહ આપી. આશ્રમ ગૌશાળા વ્યવસ્થાપકે આ માટે ખાસ સગવડ કરી આપી.

સને ૧૯૮૪ના નવેમ્બર માસની ૧૬મી તારીખે રાત્રે ૯ વાગે એકાએક જમણા પડ્યે છેલ્લી પાંસળીની નીચે તીવ્ર વેહના ઊપડી. સખત ધુઝરી સાથે તાવ ચડ્યો. આખ લેતાં વધુ વેહના થતી. તે રાત્રે ઊંઘી ન શક્યો. ખાવાનું બંધ કર્યું. પથારીમાં આરામ કર્યા સિવાય બીજે કેઈ માર્ગ ન હતો. એક અઠવાડિયે ધીમે ધીમે વેહના એછી થતી ગઈ. ફરી વાર તા. ૧૬મી જન્યુઆરી, '૮૫ના રોજ બરાબર એ મહિના પછી અગાઉની જેમ દર્દનો હુમલો થયો. સામાન્ય નિયમ પ્રમાણે ભૂખ લાગે તો જ લોજન લેતો અને શક્ય તેટલો આરામ કરતો. ડોક્ટર મિત્રોની સલાહ લીધી શારીરિક તપાસ કરાવી ચોક્સ નિહાન મેળવવાનું નક્કી કર્યું. પણ હેસ્પિટલનો અનુભવ એક વાર અગાઉ થયેલ તેથી મન માનતું ન હતું. આ દરમિયાન પ્રા-યોગ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ગાંધી આશ્રમમાં જ તા. ૨૦-૧-'૮૫ના રોજ થયું. ત્યારે માત્ર એઓાકમાં જ પરિવર્તન કરવાથી જૂનાં હડીલાં દર્દ નાખૂદ થઈ શકે છે તે વિષે પ્રત્યક્ષ હકીકતો જણવા મળી ગાંધીજીએ

આ વિષયમાં પોતાના વિચારે દર્શાવ્યા છે તે પુસ્તકનું વાંચન કરી ગયો. પ્રથમ તો ગાંધી સ્મારક સંથકાલયના અંથકાલય વિલાગ માટે શ્રી. વી. પી. જિદવાણી લિખિત ‘નિસર્જાપચાર દ્વારા રોગમુક્તિ’ નામના પુસ્તકની ખરીદી કરી અને ‘આરોગ્ય પ્રકાશ’ (ત્રિમાસિક)નું વાર્ષિક લવાજમ ભર્યું. અનુકૂળતા પ્રમાણે સાંજના અવારનવાર પ્રા-યોગ પુસ્તકાલયમાં જવાનું થતું. ક્ષારાંત અને અમ્લાંત ખાદ્યોની અસર તેમજ તેનાં વૈજ્ઞાનિક કારણો સમજવા કેટલાંક પુસ્તકોનો અભ્યાસ કરતો રહ્યો. દરમિયાન શ્રી જિદવાણીજી સાથે પરિચય વધતાં તેઓશ્રીની દ્વિલસૂકી અને જાનદર્શિનો આનંદ માણવા લાગ્યો. કણજિયાત માટે રોજ ફાકીઓ જીવનભર ખાવી પડી. તેમ કરતાં કરતાં ઘણું પ્રયોગો કર્યાં તો પછી એક વધુ પ્રયોગ જેમાં દવા લેવી ન પડે તે પણ અજમાવી જેવી જોઈએ એમ લાગ્યું. આહારમાં એવિર્તિન લાવવા પ્રેરણું થઈ કારણ તે શુદ્ધ વૈજ્ઞાનિક અને સિદ્ધ થયેલ બિનહાનિકારક ઉપચાર હતો. પ્રથમથી મને કોઈ પ્રકારનું વ્યસન ન હતું. જોરાકમાં નિમક નહિ, બાંદેલાં શાકભાજી, કેળાં વળેરે લેતો જ હતો એટલે કુદરતી ઉપચારના ૫૦ ટકા નિયમોનું પાલન તો થતું જ હતું. માત્ર હૃદ્ય તથા કઠોળ ન લેવાં અને તેની જગ્યાએ ભાજુનાં પાન તથા કાચાં ખાઈ શકાય તેવાં શાકનું કચુંખર અને સવાર સાંજ ફળો લેવાની વાત મને અનુકૂળ લાગી. એકલો રહેતો, લોજન જાતે જ અનાવતો એટલે તા. ૧૧ માર્યથી ઉપર જણાયા પ્રમાણે આહારમાં થોડોક ફેરફાર કર્યો.

હર એ માસે થતો હર્દિનો હુમલો તા. ૧૬ને ખફલે તા. ૧૬-૩-'૮૫એ ત્રીજી વાર થયો. ૪-૫ દિવસમાં આરામ અનુભંગો. આ હર્દિનું ચોક્કસ નિદાન જણાવા ડોક્ટર મિત્રોની સલાહ પ્રમાણે વા. સા. હોસ્પિટલમાં તા. ૩૦-૩-'૮૫ ના રોજ તપાસ કરાવવા પ્રયત્ન કર્યો. લોહી, પેશાખ વળેરેની પ્રાથમિક તપાસ કરાવી. એકસ-રે (સંપૂર્ણ પાચનક્કિયાતંત્રના) લીધા. તહુપરાંત પિતની કોથળીની કિયા તપાસવા વિદેશી ગોળીઓનો ડોઝ લેવાની કરજ પડી. ભીજી ગોળીઓ લખી આપેલી પણ તે ખરીદી નહિ. પૂરી ચકાસણી કર્યા આદ નિદાનમાં કંઈ ખાસ જણાયું નહિ. જે સમયે હર્દિની શરૂઆત થાય ત્યારે આવી જવાનું માત્ર સૂચન ડોક્ટરે મને કર્યું.

સાડત્રીસ વર્ષ ગોસેવાના કામમાં પરોવાચેલો રહ્યો. ગાયનું ફ્રધ ઉત્તમ તથા પૂણું આહાર છે. લગવાન શ્રીકૃષ્ણ ચોતે ગોલકઠ-ગોપાળ હતા એમ માનતો હોવાથી રોજ ગાયના ફ્રધનું ખૂબ સેવન કર્યું. શ્રી ગિદવાણી કહે છે કે ગાયનું કે બીજા કોઈ પ્રાણીનું ફ્રધ પીવું એ અકુદરતી આખત છે. પ્રત્યેક પ્રાણીમાં કુદરત ફ્રધ તેને પેઢા થતા બન્યા માટે જ પેઢા કરે છે અને એ પણ બન્યું નક્કર આહાર લેતું ન થાય ત્યાં સુધી જ. ગાયનું ફ્રધ મનુષ્ય માટે નથી બન્યું, તેના વાછરડા માટે બન્યું હોય છે. તેમણે મને એવું સાહિત્ય બતાઓયું જેમાં ફ્રધ ઘણા રોજોનું કારણ છે, કેન્સર સુદ્ધાં પેઢા કરનાર છે એવાં લખાણું તેમણે વંચાવ્યાં. શ્રી ગિદવાણીની દલીલ વજુદવાળી લાગી. અત્યાર

સુધી મારું શરીર ડેકટરો અને વૈદોની દવાએ. માટેનું પ્રયોગક્ષેત્ર બની રહ્યું હતું. એ બધા પ્રયોગ નિર્ણય નીવડયા હતા. વિવિધ રેણોની યાતના અત્યાર સુધી સોણવતો રહ્યો હતો. સંકલ્પ કર્યો કે શ્રી ગિહવાણીના સૂચનનો અમલ કરી જોડાં અને મનને ડેઝિપણ રીતે મનાવી તા. ૧-૫-'૮૫ થી હૃદ લેવાનું બંધ કર્યો. તા. ૨૩-૫-'૮૫ના રોજ ચોથી વાર હળવો હુમલો થયો અને એત્રણું દ્વિવસમાં જ આરામ થઈ ગયા પછી આ દર્દનો અનુભવ ફરીવાર થયો નહિ. હવે મળનું વિસર્જન સવારમાં નિયમિતરૂપે થઈ જય છે.

લગભગ ૧૬ મહિના થઈ ગયા. એ દર્દ પણ ગયું અને ઉ૭ વર્ષની જૂની કબજીયાત પણ ગઈ. બધી રીતે સ્કૂર્ટિં જણાય છે, કામ કરવાની ક્ષમતા વધી છે. ચિત્તવૃત્તિ સાત્ત્વિક એકાયતાવાળી થવા લાગી છે. વરોથી રોગ યોગ-સાધનામાં બાધક બની રહ્યો હતો. હવે એ સાધના સુલભ બની છે. એકલો જ છું એટલે શ્રી ગિહવાણીએ સૂચવેલા આહાર-વિહારનું ખૂબ સારી રીતે પાલન કરું છું. એકલો હોવાથી ઘણીવાર રોટલી પણ બનાવતો નથી. કાચાં શાકભાજુ અથવા ફળો ખાઈ લડાં છું. ક્ષારાંત આહાર એટલે કે શાકભાજુ (કાચાં) અને ફળોને જ કુદરતી ઉપ-ચારક ઉત્તમ આહાર માને છે. અમલાંત આહાર-માંસ, મચ્છી, ઈંડાં, હૃદ, મરીમસાલા, ખાંડ, નિમક, ચા, કોકી, દાળ, કઠોળ, પરિજૂત અનાજ (મેંહે-પોલિશ કરેલા ચોખા), તળેલી અથવા અજરમાં વેચાતી ચીજેને તે રોગ ઉત્પન્ન

કરનાર પહાર્થે ગળે છે. અનાજ ખાવું જ હોય તો એછું અને અપરિષ્કૃત રૂપમાં લેવું જોઈ એ. હું આ બધી ખાખતોનું પૂરૈપૂરું પાલન કરું છું એમ કહું તો અતિશયોક્તિ નહિં ગણ્યાય. એનું પરિણામ પણ થોડા સમયમાં જ મળ્યું છે. મને લાગે છે કે આપણે જે આમજનતાને આ સરળ, સસ્તો અને વૈજ્ઞાનિક આહાર અપનાવતી કરી દઈએ તો કદાચ રોગ શાખદ જ સંસારમાંથી અને શાખદકોશમાંથી અલોપ થઈ જાય. આમ થાય તો એથી રૂકું પુણ્યકાર્ય ભીજું શું હોઈ શકે ?

(ગાંધી સ્મારક સંગ્રહાલય, ગાંધી આશ્રમ, અમદાવાદ-૩૮૦ ૦૨૭)



યુરોપ તરફ હાલ એવા તરીકે છે કે, જેઓ દરદીઓને ખુલ્લી હવા અને અજવાળું પુછ્યું આપી તેઓનાં દરદ મટાડે છે. તેઓ માત્ર ચહેરાને હવા અને અજવાળું આપે છે એટલું જ નહીં, પણ દરદીને લગભગ નગ્ન દર્શામાં રાખે છે અને આખા શરીરની ચામડી ઉપર હવા અને અજવાળાની અસર પહોંચાડે છે. આવી માવજતથી સેંકડો આદ્ભુતો સાંજ થાય છે. હવા અને અજવાળાની આવજન થાય તે માટે આપણું રહેવાનાં ધરનાં બારીબારણું રાત દહાડો ખુલ્લાં રાખવાં જોઈએ.

—ગાંધીજી

[१२]

કેન્સર

નોંધ : આ કેસમાં રેણી પોતાનું નામ પ્રકટ કરવા ઈચ્છતા નથી. આ અંગે કોઈ સજજન વિશેષ માહિતી મેળવવા માગતા હોય તો ગિદવાણીઓનો સંપર્ક સાથે.

૧૯૮૫ના માર્ચમાં મારી પત્નીને (વ્યવસાય-શિક્ષિકા, ઉંમર ૪૪ વર્ષ) ડાબી બાળુના સ્તનમાં કેન્સરની ગાંડ પેઢા થઈ. સ્થાનિક ઈસ્પિતાલમાં તપાસ કરાવતાં સલાહ મળી કે ઓએપરેશન કરાવવું પડશે. આપરેશન સાધારણ છે એમ માની ઓએપરેશન કરાયું. ગાંડ કેન્સરની જ હતી એમ ઓએપરેશન થતાં માલૂમ પડ્યું. અમદાવાદની એક પ્રતિષ્ઠિત પ્રયોગ-શાળામાં તપાસ કરાવતાં નીચે દર્શાવેલ રિપોર્ટ મળ્યો :
Microscopic examination of large nodules :

One of the nodules shows structure of Fibroadenoma. The other nodule shows picture of cystic mastitis with infiltrating duct Carcinoma.

Diagnosis :

- (1) Infiltrating duct Carcinoma. Histological grade III. Nuclear grade II.
- (2) Fibroadenoma.
- (3) Cystic mastitis.

Dated : 1-4-'85

દૂંકમાં રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે છાતીનું કેન્સર છે. કેન્સરનું નામ સાંલળી આખા કુદુંખમાં ગલરાટ ફેલાય એ સ્વાભાવિક હતું. એલોપથી કેન્સરનો ઉપયાર કરવામાં સર્વથા નિષ્ઠળ નીવડે છે એ હું સારી પેઠે જણુંતો હતો. કુદરતી ઉપયાર પદ્ધતિમાં મારો પૂરો વિશ્વાસ છે. તા. ૭.૪.'૮૫ ના રોજ હું કુદરતી ઉપયારક ગિદ્વાણીજીને મળ્યો. એમણે એ ચાર બાખ્યતો સ્પષ્ટ કહી : (૧) ક્ષારાનત અપક્રવ આહાર એટલે કાચાં શાકભાળ, ફળ અને નાળિયેર પર રહેવું પડશે. ફૈનિક આહારનો એદો ક્રમ બનાવી દીધો કે શરીરને કાર્યોદ્ઘિત, ચરખી, પ્રોટિન, વિટામિન તથા ક્ષાર ચોગ્ય પ્રમાણુમાં મળી રહે. (૨) શરીર પર ટેરેલીન જેવા સિન્થેટિક રેસાનાં કપડાં ન પહેરતાં સુતરાઉ કપડાં—એ પણ ઓછામાં ઓછાં પહેરવાં. (૩) ખુલ્લી હવા તથા સૂર્યપ્રકાશનો ખૂબ ઉપયોગ કરવો. (૪) ભય, ચિંતા વગેરે છોડી ખૂબ આરામ કરવો. (૫) ફ્રધ અને ફ્રધની બનાવટો બિલકુલ ન લેવાં. મિત્રો, સગાં-વહાલાંએ કહેવા લાગ્યાં કે એથી શું વળવાનું? પરંતુ મને પૂરી શક્ષા હતી કે ફ્રાયદો થશે તો આનાથી જ થશે; અને કોઈ રસ્તો જ નથી. એટલે ગિદ્વાણીજીએ સૂચવેલે।

ઉપરોક્ત ઉપયાર શરૂ કર્યો. મારી પતનીને પણ આ ઉપયારમાં પૂરી શ્રદ્ધા હતી અને તે તેનું બરાબર પાલન કરતી હતી. તેનું મનોભળ મજબૂત કરવા કુદુંબના બીજા લોકો પણ કચારેક અપક્રવ આહાર લેતાં હતાં. મારી પતનીને આરામ મળે એ માટે શાળામાંથી એ મહિનાની રળ લીધી. ગિદ્વાણીજુએ એક સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે વજન ઘટશે પણ એની ચિંતા ન કરવી. શરીરની શક્તિ જરૂર વધશે.

પરીક્ષાથી^१ પરિણામ જણુવા સહા આતુર હોય છે. સમાજ પણ ચેનથી બેસવા હેતો નથી. સૌ આથ્રહ કરતાં કે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં બતાવે. તપાસ કરાવવા હું પણ સંમત થયો. હું જે ખાતામાં નોકરી કરું છું તેની પોતાની હોસ્પિટલ છે. પાંચમે મહિને એ હોસ્પિટલ તરફથી અમને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં. ત્યાં મળ, મૂત્ર, લોહી બધી તપાસ કરવામાં આવી. ૮-૮-'૮૫એ X-Ray કરાવતાં માદૂર પડ્યું કે ફેસસાંમાં ગાંઠો થઈ છે. ત્યાંના ડોક્ટરે કણ્ણું કે કેન્સર ચોથા સ્ટેજમાં છે. છ મહિના સુધી Chemotherapy ઉપયાર ચાલુ કરે. અમે આવા ઉપયાર માટે બિલકુલ તૈયાર ન હતાં. અમે તો કુદરતી ઉપયાર ચાલુ રાખ્યો.

તા. ૯-૯-'૮૫એ ખાતાની ધસ્પિતાલમાંથી X-Ray નો રિપોર્ટ મળ્યો કે

No evidence (Radiological) of any abnormal shadow in lung field now. Dated : 9-8-'85

એટલે કે ફેસામાં હવે કશું નથી. તો પણ ફરી તપાસ માટે તા. ૧૩-૬-'૮૫એ અમદાવાદની ઐન્સર હોસ્પિટલમાં X-Ray કરાયો. જેનો રિપોર્ટ આ પ્રમાણે છે :

X-Ray Chest (Left).

Left mastectomy done. In Comparison with previous X-Ray of 8-5-'85 there is reduction in pulmonary deposits, suggestive of improvement. Heart size and Aorta appear normal.

Dated : 13-9-'85

આ રિપોર્ટ સૂચયે છે કે ૮-૫-'૮૫ ના X-Ray ની તુલનામાં હવે ફેસામાંની ગાંડો નાની થઈ ગઈ છે એટલે કે સુધારે છે.

રોગીનાં ખાનપાન તથા રહેણીકરણી એ જ રીતે ચાલુ રાખવામાં આવ્યાં. વજન ૪૨ કિલોથી ઘટીને ૩૫ કિલો થઈ ગયું. પરંતુ રક્તૂતી અને શક્તિ તો જળવાઈ રહ્યાં. આગળ ઉપર તો વજન પણ વધવા લાગ્યું. તા. ૪-૬-'૮૬ એ અમદાવાદની ઐન્સર હોસ્પિટલે ફરી પૂરી તપાસ કરી. તેનો X-Ray રિપોર્ટ મળ્યો કે—

Chest P. A.

Shows subareolar mastectomy. Soft tissue shadow seen in left midzone is due to nipple shadow. Rest of the lung field appear normal with clear C. P. angle. Heart, aorta and bony thorax appear normal.

Dated : 4-6-'86

અર્થात ફેફસાં હવે તદ્દન સાઝે દેખાય છે. કોઈ તકણીએ નથી. કેન્સર હોસ્પિટલના ડોક્ટરો માટે આ એક અસાધારણ કેસ છે કારણું કે તેમની ઉપચારપદ્ધતિમાં તો કેન્સર અને એમાંથી તે ફેફસાંનું કેન્સર અસાધ્ય જ છે. એ બિચારાઓને અસલી રહસ્યનો તો ખ્યાલ જ નથી. જિવાણીજીની હરતી ઇરતી હોસ્પિટલમાં ન તો કોઈ તપાસનું સાધન છે, ન કોઈ હવા, ન કોઈ ઈલેક્શન કે ન કોઈ ઓપરેશન થિયેટર. માનવમાત્ર માટેનો તેમનો સદ્ગ્લાષ, દ્વીંને રોગમુક્ત કરવાની તમજા, દ્વીં ધરમાં જ રહી ખુલ્લી હવા, કાચાં શાકભાળ અને ફળનો આહાર, સૂર્યપ્રકાશ કે અને માનસિક સંતુલન જળવે, ખસ્ત એ અધાનો સંગમ થાય એટલે ઉપર દર્શાવેલ ચમત્કાર સુગમતાથી સર્જય.



કઠોળ-વટાણા, વાલ, તુવેર, મઠ, મગ, મસૂર-બહુ તેજ ખોરાક ગણ્યાય છે. તેને પચાવતાં મુશ્કેલી આવે છે; કેમ કે તેને સારુ હોજરીમાં પુષ્કળ અજિન જોઈએ. કઠોળ ખાનાર માણુસને વખતોવખત વા સરે છે. તેનો અર્થ એ જ થયો કે તેનાથી કઠોળની અરદાસ થઈ નથી. કઠોળને આપણે 'વાયડા' ગણ્યીએ છીએ એ પણ એવા જ કારણુથી.

—ગાંધીજી

[૧૩]

બહેરાશ, લોહીનું નીચું દખાણું, જામર,
મેલેરિયા, દાંતના રોગ, સક્રેદ કોઈ

● શાંતિલાલ નાનાલાલ શાહ

આજથી સાતેક વરસ ઉપર મારા મિત્ર નરસિંહલાઈએ
મને તેમની હુકાને કહ્યું કે ગિદ્વાણીજુનાં ‘કુદરતી ઉપયાર’
ઉપર પ્રવચનો કોચરણ આશ્રમમાં છે અને તે સાંભળવા
જેવાં છે. અમે બન્નેએ રોજ સાંજે ૭ થી ૯ કોચરણ
આશ્રમ જવાનું રાખ્યું અને ગિદ્વાણીજુનાં દસ પ્રવચનો
અમે સાંભળ્યાં. આ પ્રવચનોથી હું ખૂબ આકર્ષિયા. અત્યાર
સુધી કુદરતી ઉપયાર અંગે થોડું ધ્યાન વાંચેલું, પ્રવચનો
પણ સાંભળેલાં પણ ગિદ્વાણીજુ કંઈક નવી જ વાત કરી
રહ્યા છે તેમ લાગેલું. “આહારવિહાર ઠીક કરેલા, રોગ
કેસા લી કયું ન હો, ચલા જાયેગા.” આ વાક્યથી હું
ખૂબ પ્રભાવિત થયો. થોડા સમય પછી તેમનું “નિસર્જો-
પચાર દ્વારા રોગમુક્તિ” નામનું પુસ્તક પ્રકાશિત થયું. હું
કોઈ કોઈ વાર ગિદ્વાણીજુને તેમના વેર મળતો રહ્યો.
સ્વાસ્થ્ય અંગે કેટલીય નવી વાત તેમની પાસેથી જાણુવા

મળી. કચારેક રોગથી પીડાતા મારા મિત્રોને પણ તેમની પાસે લઈ જતો. જે મિત્રો ગિફવાણીજીએ સૂચયન્યા મુજબ ખાનપાન અને રહેણીકરણી અપનાવતા તેમને એહદ લાભ થતો. હું પણ વર્ષોથી નાનામાટા રોગોથી પીડાતો હતો. જ્યારે તેમના કહેવા મુજબ ખાનપાન અને રહેણીકરણીમાં ફેરફાર કર્યો ત્યારે મને પણ જૂના રોગોમાંથી મુક્તિ મળી.

ગિફવાણીજીનો મુખ્ય સિદ્ધાન્ત એ છે કે વધુ પડતો અમ્લાંત (શરીરમાં અમ્લ પેહા કરવાવાળો ખોરાક) શરીરને નુકસાન કરે છે અને અનેક રોગો પેહા કરે છે જ્યારે ક્ષારાંત આહાર—સોડિયમ, પોટેશિયમ, કેલિશિયમ, મૈગનેશિયમના ક્ષારોવાળો આહાર—શરીરનું શોધન કરી એટલે શરીરમાં પેહા થયેલાં અમ્લરૂપી વિષોનું શમન કરી શરીરની બહાર કાઢી, શરીરને અનેક રોગોમાંથી મુક્ત કરી તંહુરસ્તી બદ્ધે છે. ગિફવાણીજીની આ વાત બહુ સહેલી અને સચોટ છે. ચાર ટંકનો આહાર દિવસ દરમિયાન લેવાનો. તેમાં (૧) સવારે કેળાં, ચીકુ, પપૈયું, ખજૂર, સીતાકૃષ્ણ, રાયણ જ્યેવાં મીઠાં ફેણો. સિવાયનાં કોઈ એક રસવાળાં ફળનો ચોણ્ય પ્રમાણુંનાં નાસોનો, (૨) બપોરે લોજન જેમાં કાચી ભાજુનાં પાન ૭૫ થી ૧૦૦ અામ (પાલખ, મેથી, સૂવા, તાંદળનો, કોથમીર, મૂળાનાં પાન, કુલાવરનાં પાન વગેરે) તથા કાચાં શાક ૧૫૦/૨૦૦ અામ (કાકડી, કોણીજ; કુલાવર, ગાજર, મૂળા, ફંધી, પરવળ, ટીડોરાં વગેરે). તે પછી રોટલી તથા ભરચાં-મસાલા, ખાટા પહાર્યો વગરનું અને વધાર્યો

વિનાળું રંધેલું શાક. (૩) બપોરના ભોજન પછી પાંચ કલાક ખાદ નાસ્તામાં કોઈ પણ એક જાતનું કેળ. (૪) સાંજે બપોરની જેમ ભોજન, જેમાં કાચી લાળ, કાચાં શાક, રોટલી, રંધેલું શાક. હૃદ અને હૃદની ખનાવટો નહીં લેવાની. દ્વાર બધી જ બધ, કડોળ બધાં જ બધ. ખૂબ કરતાં ઓછું ખાવું. ખૂબ ચાવીને ખાવું. સંચોજન નિયમોને ખ્યાલ રાખવો. આ બધી બાબતો હતી, જે ગિફવાણીનું અવારનવાર સમજવતા હતા.

આ આહારનો પ્રથમ અનુભવ—પ્રચોગ છ વર્ષ પહેલાં મેં મારી જાત ઉપર કર્યે. મને મેલેનિયા તાવ આવ્યો અને તાવ જિતર્યા પછી Blood Pressure Low થઈ ગયું—ઘટી ગયું. કમરની ઉપરનો ભાગ કામકાજ ન કરે એટલે પથારીમાંથી બેઠા થવાય જ નહિ. ઇમિલી ડોક્ટરને ઘેર ખોલાવ્યા. નિદાન થયું કે B.P. ખૂબ Low થઈ ગયું છે. ગોળીએ લખી આપી. દિવસમાં ત્રણ વખત લેવાનું કહ્યું અને B. P. રોજ મપાવવાનું કહ્યું. મને દવા કે એરાક આપવો હોય તો એ હાથ આલીને બેઠો કરે તો જ બેઠા થવાય તેવી મારી સ્થિતિ હતી. એ વખતે ગિફવાણીનું પુસ્તક ‘નિસર્ગોપ્યાર દ્વારા રોગમુક્તિ’ પ્રકાશિત થયું ન હતું. એમણે છપાવેલું પેમ્ફ્લેટ ‘નિસર્ગોપ્યારી આહારવિહાર’ મારી પાસે હતું. પથારીમાં પડયો પડયો હું તે વાંચતો હતો. નષ્ટી કર્યું કે તેમાં જણાવ્યા મુજબ એરાકની અજમાયશ કરવી છે. ગોળીએ, દવા વગેરે પથારી નીચે

મૂકી દીધાં અને સવારે મોસંબીનો રસ, જમવાના ટાઈમે,
તાવમાંથી તાજે ભડેલ એટલે ખાખરો અને થોડી ચા લેતો.
તેનો સાથે પ્રથમ એક ડીશ કાચી લાળ (પાલખ વગેરે)નાં
પાન અને કાકડી, કોણીજ, ગાજર વગેરે કાચાં શાક ૧૦૦
થી ૧૨૫ ચામ; તે પછી એ-ત્રણુ ખાખરા અને ચા લેતો.
(ગિદ્વાણીણુના સિદ્ધાન્ત સુજર્ખ ચા ન લેવી જોઈએ). મને
ચાથે જ હિવસે ચમત્કાર થયો હોય એમ લાગ્યું. મારામાં
અડપથી એક માર્ધિલ ચાલી શકું તેવી શક્તિ આવી, મારું
B.P. જે ડોક્ટર માપતા હતા તેમણે કહ્યું કે-તમારું
B.P. બિલકુલ નોર્મલ છે. નાડી અને હૃદયના ધર્મકારા
નોર્મલ છે અને તમારા મેં ૭૫૨ તેજ લાગે છે. તમારા
જેવા કેસમાં એ-ત્રણુ મહિના સુધી ઠેકાણું પડતું નથી.
તમને અડપથી સુધારો થયો છે—Low B.P.ની તમે ગોળીએ
બધી પૂરી કરો? તેમ ડોક્ટરે પૂછ્યું. મેં ગોળીએ
લીધી ન હતી, કારણ મારે આહારનો પલાવ જેવા હતો.
પણ મેં ડોક્ટરને જણાવ્યું કે તમે લખી આપેલી બધી
ગોળીએ મેં પૂરી કરી છે. ડોક્ટર નારાજ ન થાય એટલે
થાડું જૂડું બોલ્યો. ખરેખર આ સુધારો વગર હવાએ ક્રફ્ટ
આહારના ફેરફારથી જ થયેલો. (જે કે કેટલાક રોગોની
ખાખતમાં ડોક્ટરની સલાહ વગર એકદમ હવા બંધ કરવી
ન જોઈએ. આહારના ફેરફારથી જેમ જેમ ક્ષાયહો થાય તેમ
તેમ હવા ઘટાડવી જોઈએ). તે પછી તો મેં આ રીતનો
ખોરાક રાજ નિયમિત જેવા માંડયો. તેથી નીચેના રોગોમાં
મને ક્ષાયહો થયો છે :

(૧) મને અવારનવાર low B.P. થતું તે મટી ગયું છે. છેલ્લાં પાંચ વરસમાં એક પણ વખત થયું નથી. પહેલાં વરસમાં અવારનવાર થતું: તે વખતે ચઙ્ગે આવે. શરીરની શક્તિ ઘટી જાય અને પથારીમાં પડયા રહેવું પડે. આહારના ફેરફારથી લો B.P. બિલકુલ મટી ગયું છે.

(૨) મારા ડાયા કાનમાં ૧૦ વર્ષની ઉંમરથી પર્દુ આવતું હતું. બિસ્સામાં દીવાસળી ને ઇ કાન સાંકે કરવા રાખવાં પડતાં, જે ભાવન વર્ષ પછો એટલે કે ૬૨ વર્ષની ઉંમરે બિલકુલ મટી ગયું છે. નિષ્ણાત ડોક્ટરોનો અલિપ્રાય હતો. કે પર્દુ બંધ થશે નહિ, કારણ કે કાનના પદહામાં કાણું છે. આ માટે વૈદ-ડોક્ટરોના ઈલાજ કરેલા, પણ કંઈ કાયદો થયો. ન હતો. અને પર્દુ આવવાનું ચાલુ રહેતું. જે હવે વગર દવાએ આહારના ફેરફારથી મટી ગયું છે.

(૩) મને ૩૦ વરસથી ભયાંકર શરદી રહેતી હતી. નાકમાંથી લીંટ નીકળ્યા જ કરતું. દિવસમાં એ ત્રણ વખત ઇમાલ બદલવા પડતા—શરદીને લીધે મારી આંખો બગડેલી. મને આમર (Glaucoma) થઈ ગયેલો. અને ૧૯૭૦માં મારી બન્ને આંખો આમરનું ઓપરેશન કરાવેલું. આ શરદી બિલકુલ મટી ગઈ. ચોમાસામાં પલળવા છતાં છેલ્લાં પાંચ વરસથી શરદી બિલકુલ થઈ નથી.

(૪) અવારનવાર મેલેરિયા તાવ, ખાંસી, કદ, શરદી વગેરે થઈ જતાં. તે પાંચ વરસમાં એક પણ વખત થયાં નથી અને કોઈ વખત બીમાર પડવાનું બન્યું નથી.

(૫) મારા બધા દાંત હાલી ગયેલા. એ હાડો પડી ગઈ. રોટલી કે ખાખરો ખાવામાં દાંત હુઃખે. બધા દાંત પડી જશે અને ચોકડું લાવવું પડશે તેવો ડર રહેતો, પણ આહારના ફેરફરથી હવે મારા બધા જ દાંત મજબૂત થઈ ગયા છે. આજે કાચાં શાક, ટોપડું, સોપારી જેવી કઠળું ચીજ પણ ચાવી શકાય છે. ૬૨-૬૪ વર્ષની ઉંમરે દાંત ફરી મજબૂત થવાની આશા ન રાખી શકાય. આ પણ આહારનો ચમતકાર છે.

(૬) મને સફેદ ડાઘ-કોઢ (Leucoderma)ની અસર ગળા ઉપર અને બરડામાં થયેલી. બરડામાં છ ઈચ્છ પહેલોના અને નવ ઈચ્છ લાંધો કોઢનો ડાઘ થયો. તેમાં પણ આ ઝોરાકથી ૫૦ ટકા અસલ ચામડી આવી ગઈ છે. તે પૂરેપૂરો મટી જશે તેવી આશા છે, કારણું કે રોજ થોડો થોડો ભાગ અસલ ચામડીમાં ફેરવાતો જય છે.

(૭) પહેલાં થોડું ચાલતો ત્યાં જ થાકી જતો, જ્યારે હવે ચાલવાથી બિલકુલ થાક લાગતો નથી. એક વખત પ્રયોગ ખાતર કોચરબ આશ્રમથી વિજયનગર, નારણપુરા સુધી ચાલવાનું રાખ્યું. થાક લાગો તો બસ કે રીક્ષા પકડવી તેવો વિચાર કરેલો, પણ છેક વિજયનગર સુધી ચાલતાં સહેજે થાક લાગ્યો નહિં.

(૮) પહેલાં મોં ઉપર કિકાશ લાગતી, ને હવે બિલકુલ નથી.

(૯) પહેલાં કંઈક વાગતું તો ૧૫ દિવસ સુધી રૂભ

ન આવતી. હવે વાળ્યું હોય તો એ-ત્રણ દિવસમાં રૂઝ આવી જાય છે. એક વખત હજમત કરતાં જ્વેઠ વાગેલી, ત્રોઝ દિવસે રૂઝ આવી ગઈ. આવી ઠડા પાણીની પટ્ટી બાંધેલી. (“લોહીમાં ક્ષારોની વિપુલતા હોય તો રૂઝ જડપથી આવી જાય છે” તંમ ગિદવાણીજી કહેતા તેનો પ્રત્યક્ષ અનુસવ થયો.)

(૧૦) ૧૯૭૦માં જામરનાં બંને આંખે ઓાપરેશન કરાવ્યા પછી મને જામરને અંગે Optic Atrophy થઈ. ઓાપરિક નર્વ સુકાઈ ગયો. આંખોનું તેજ ઓછું થઈ ગયું. વાંચતી વેળા કાળા અક્ષરો જાંખા લાગતા. હવે અક્ષરો કાળા દેખાય છે અને બરાબર વાંચાય છે. જેકે Optic Atrophy માં કંઈ ફેર પડ્યો નથી.

કાચાં શાકભાજી ખાવાં એ મેં રોજને નિયમ જનાવી હીધેા છે. રોજ લોજન સાથે કાંચી ભાળુનાં પાન, કાચાં શાક અને રોટલી, રંધેલું શાક લઉં છું. મને ઉપર જે ક્ષાયકાર થયા છે તે ૨૦થી ૨૫ ટકા સૂચવેલા આહારવિહારનું પાલન. કરવાથી થયા છે. મને લાગે છે કે વધારે સારી રીતે પાલન થાય તો હજુ વધુ સારાં પરિણામ ભળી શકે. ગિદવાણીજીનો આહારનો સંદેશો ઘેર ઘેર પહોંચતો થાય અને તેમની વાત લોકો સમજતા થાય તો લોકોના હાથમાં વગર ફવાએ રોગમાંથી મુક્ત થવાની અને તંહુરસ્ત રહેવાની ચાવી આવી જાય. શ્રી ગિદવાણી કૃત “નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ”નો અને પ્રા-ચોગ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ત્રિમાલિક

“આરોગ્યસિંહુ”નો પ્રચાર કેટલો વધે તેણો લોકોને વધુ લાભ થયા તેમ છે. આ સિદ્ધાંતોના અમલથી અનેક રોગોથી પીડાતા લોકો પોતાના રોગોથી મુક્ત બની શકે અને ઇક્તા આહારવિહારના ફેરફારથી, કોઈ પણ જાતની દવા વગર, તંડુરસ્તી અને હીધીયુધ્ય જીવની શકે એમ મને લાગ્યું છે.

નોંધ : હું ઉપરોક્ત આહારવિહાર અપનાંયા ઉપરાંત રોજ આસન, કુંલક વગર અનુલોમ-વિલોમ પ્રાણાયામ પણ કરું છું. સાથે સાથે સ્નાન કરતી વેળા ભીજવેલા ખરણયડા કુવાલ વડે શરીરને ઘૂંઠ રગડીને સ્નાન કરું. છું.

(૬૮/૪૦૭, વિજયનગર, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩)



દ્વારાંધી થવા ઉપર જુલાએ લેનારને હરસ વગરેના રોગો થયાના દાખલા જોવામાં આવે છે. દરદ થાય તેનું કારણ શોધી, કારણ દૂર કરી દરદને જવા દેવું અને પછી કુદરતના નિયમો જીવની રહેવું એના જેવી પુષ્ટ આપનારી એક પણ લસ્મ નથી; એ ચોક્કસ વાત છે. લોહલસમ વગરે ધાતુઓને મારી ભૂકીઓ બનાવવામાં આવે છે. તેને પણ અક્સર ઈલાજે સમજવા એ મિથ્યા સમજવાનું છે.

—ગાંધીજી

[૧૪]

પાચનતંત્રનો રોગ (દી. બી. I.)

અત્યારે મારી ઉંમર લગભગ ૪૨ વર્ષની છે. અમદાવાહના એક મોટા કારખાનામાં સીનિયર ઇજનેર તરીકે હું ૧૭ વર્ષથી કામ કરું છું. બાળપણુથી જ મારા શરીરનો ખાંધી મધ્યમ રહ્યો છે. જીવનના શરૂઆતના કાળમાં પણ કોઈ કોઈ વાર શારીરિક તકલીફો થતી હતી. સને ૧૯૬૮ માં મને પેટનો હુઃખ્યાંબો, અનિદ્રા અને થાકની તકલીફ થઈ હતી એટલે શરીરની પૂરી તપાસ કરાવવાનું જરૂરી લાગ્યું. લોહી, મળમૂત્રની તપાસ તથા ઐરિયમની એનિમા લીધા બાદ એકસ-રે દ્વારા પેટ અને આંતરડાની તપાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરાવી. આ બધી તપાસ પછી કહેવામાં આવ્યું કે આંતરડામાં ક્ષયની અસર છે (Tubercular Lesion of Caecum). આ નિદાન પ્રમાણે ઉપચાર ચાલુ કર્યો, જે લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યો. સ્ટ્રોટોમાઇસીનનાં લગભગ સો ઈજોક્ષણ લીધાં. લગભગ ત્રણસો ગોળીઓ આઈસોનેક્સની ખાંધી. આટલા ઉપચાર પછી લાગ્યું કે રોગ પૂરેપૂરો મટી ગયો છે. બાકી શરીરનું વજન વગેરે જેમનાં તેમ રહ્યાં.

૧૯૭૫ના અંતમાં કુરી એવી જ રીતે રોગલક્ષણું હેખાવા લાગ્યાં. એવી શાંકા જગી કે પહેલાંનો રોગ બીજું ડ્રેપે શરીરમાં રહ્યો ગયો છે. કુરી શરીરની એકસ-રે દ્વારા તપાસ કરાવી, પરંતુ શાંકા એટી ઠરી. રોગનાં કોઈ ચિહ્ન હેખાયાં નહિં, તોપણું પેટનો હુખાવો, જિંદ ન આવવી ને આક વર્તાવો એ લક્ષણું ચાલુ જ રહ્યાં. પંદર દિવસ સુધી મને Hagyl Stelabid ની ગોળીએ ખવડાવવામાં આવી. અને જિંદ લાવવા માટે વેલિયમની ગોળી આપવામાં આવી. પંદર દિવસ સુધી આ ગોળીએ ખાવાથી પેટનો હુખાવો મટી ગયો. પરંતુ એ ઉપચાર બંધ કર્યો કે કુરીથી પાછો તે હુખાવો થવા લાગ્યો. એટલે વળી કુરીથી એ ગોળીએ ખાવાની સલાહ આપવામાં આવી. વેલિયમની ગોળી ખાવાથી રાત્રે ચાર કલાક જિંદ આવતી પરંતુ સવારે સ્કૂર્ટિં રહેતો નહિં. નોકરી પર જવા જિડવું તો પડતું પરંતુ પથારી છાડવાનું મન થતું નહિં.

શ્રી ગિદ્વાણી સાથે મારી ઘનિષ્ઠ મિત્રતા તો છેક ૧૯૫૬થી છે. ૧૯૬૮ માં મને માંદગી આવી એ વખતે તેમને કુદરતી ઉપચાર વિષે કશું જાન ન હતું. તેઓ પોતે સંધિવાથી પાંચ છ વર્ષ સુધી હેરાન થયા હતા ૧૯૬૬માં તેમને કુદરતી ઉપચાર દ્વારા સંધિવાના રોગથી મુક્તિ મળી. આ સઝણતા વિષે મને બરાબર માહિતી હતી. તેમના ઘણ્ણા મિત્રો પોતાના રોગેના ઉપચાર માટે તેમની પાસે જતા અને તેમણે સૂચવેલા કુદરતી ઉપચાર અપનાવવાથી સાબન

થઈ જતા એ વાતની પણ મને ખખર મળતી રહેતી. હું પણ મારા રોગી મિત્રોને તેમની પાસે લઈ જતો હતો અને તેઓ જે ગિફવાણીનું સૂચયન્યા પ્રમાણે ખાતપાન અપનાવતા તો તેમને પૂરૈ લાલ થતો. પરંતુ મનુષ્ય કયારેક એવા સંજેગોથી ઘેરાઈ જતો. હોય છે કે હિત-અહિત સમજવા છતાં તે હિતકારી ખાખતોને અપનાવી શકતો નથી. મારી પોતાની સ્થિતિ એવી હતી કે મારે ફેંકટરીના કામકાજ માટે મહિનામાં લગભગ વીસ દિવસ બહાર રહેવું પડતું. એવા સંજેગોમાં આહાર વગેરેના નિયમોનું પાલન કરવાનું ખૂબ અધ્યક્ષ હતું. વળી જ્યાં સુધી ગોળીએના ઉપયારથી કામ ચાલતું હોય ત્યાં સુધી મનુષ્ય કુદરતી ઉપયારને લગતા આહારના નિયમોનું પાલન કરવામાં એદરકાર રહેતો હોય છે. મારી સ્થિતિ પણ કંઈક આવી જ હતી. ગિફવાણીનું મારી ડેગમાં ઇપકડા પેકિંગવાળી ગોળીએ. જેઈને હસતાં હસતાં કહેતા કે ભાઈ, મીડાઈની આ ગોળીએ બહુ ન ખાએ. ત્યારે હું લાચારી ખતાવતો.

૧૯૭૫ માં જ્યારે મેં જેથું કે હું કે “મીડાઈની ગોળીએ” કામ કરતી નથી. વેલિયમની ગોળીએ ખાવાથી પણ જિંધ આવતી નથી. ત્યારે મને લાગ્યું કે હું ગંભીરતા-પૂર્વક વિચાર કરવો જેઈએ; બાકી દિવસના દસ-બાર કલાક કામ કર્યા પછી પણ જે રાત્રે છ-સાત કલાક જિંધ ન આવે તો ભવિષ્યમાં કોઈ ગંભીર તકલીફ જિલ્લી થઈ શકે એમ લાગ્યું. એટલે ગિફવાણીનું સલાહ લઈ હું કંઈક

કરવું જ પડશે એમ નક્કી કર્યું. તેમની સાથે વાતચીત કરી. કુદરતી ઉપચારપદ્ધતિ પ્રમાણે કોઈ હવા તો ખાવાની ન હતી. એ પદ્ધતિમાં તો માત્ર ખાનપાન અને રહેણી-કરણીની રીતમાં ફેરફાર કરવાનો હોય છે. એટલું કરવાથી જ અસાધ્ય કહેવાતા રોગોથી પણ પૂરી સુક્ષ્મિતા મળી જય છે. જિહ્વવાણીજીએ સવારથી સાંજ સુધીમાં મારે શું ખાવું, કચારે ખાવું, કેટલું ખાવું વગેરે વિસ્તારથી સમજાયું. થોડો સમય પૂરો આરામ લેવો એવો પણ તેમનો આગ્રહ હતો. જતાં જતાં એમ કહી ગયા કે પંદર દિવસ સુધી સંયમપૂર્વક આ પ્રકારનાં ખાનપાન ચાલુ રાખજો. હું હવે તમને પંદરમે દિવસે મળીશ. મેં ફેરફારીમાંથી સાત દિવસની રજ લીધી. વલસાડ નજીક સમુદ્રકિનારે એક મિત્રના બંગલામાં સાત દિવસ રહ્યો. સવારમાં લગભગ એક કલાક સુધી સમુદ્રકિનારે ફરવા નીકળી પડતો. ત્યાંથી આવીને સાદા પાણીથી શરીર ખૂબ ઘસીને સ્નાન કરતો. સવારના નાસ્તામાં એક જ પ્રકારનાં રસદાર ફળ ઈચ્છાનુસાર પ્રમાણમાં લેતો. એ પછી પા-અર્ધો કલાક આરામ કરતો. બપોરના લોજનમાં સો આમ પાંદડાંવાળી લાળનાં કાચાં પાન, કેટલાંક કાચાં શાક, ખૂબ પ્રમાણે કોરી રોટલી, મરીમસાલા વગરનાં કે કોઈ ખરાશ વગરનાં અને વધાર્યા વિનાનાં શાક ખાઈને હોઢથી એ કલાક આરામ કરતો હતો. સાંજે ચાર-પાંચ વાગે થોડાં ફળ અને રાત્રે બપોરે લેતો. તેવું જ લોજન કરતો હતો. સાત દિવસ પછી હું અમહાવાદ આવ્યો.

કારખાનામાં જવાનું શરૂ કર્યું પરંતુ ખાનપાન અને રહેણીકરણીની રીત તો પૂરેપૂરી ગિફવાણીલુચે સૂચંધા પ્રમાણે આદુ રાખી.

આશ્ર્યની વાત તો એ છે કે પેટનો હુખાવો હિન્પ્રતિહિન એછો થતો ગયો. આ પ્રયોગના દસમા-અગિયારમા હિવસે તો હુખાવો સાવ ગાયબ થઈ ગયો. ઊંઘ પણ સારી આવવા લાગી. દવાઓ તો આ પ્રયોગ શરૂ કર્યો તે હિવસથી જ બંધ કરી હતી, એક એ વાતનો પણ અનુભવ થયો. કે પહેલાં ઓઝિસમાં એક-દોઢ કલાક ખુરશીમાં જેસી રહ્યા પછી ઊડતો ત્યારે બન્ને ઢીંચણુમાં હુખાવો થતો. હવે એ હુખાવો પણ બંધ થઈ ગયો. મને તો આ બધું જાહુ જેવું લાગ્યું. જ્યારે નિપણુાત ડોકટરો કંઈકરી શક્યા નહિ ત્યારે કેવળ આહારમાં ફેરફાર કરવાથી આ બધું કેમ બની શક્યું? બરાબર પંદરમે હિવસે ગિફવાણીલું સાંજે ઘેર આવ્યા. મારા ચહેરા પર ખુશી જોઈ બધું સમજુ ગયા. હું એલો ઊડચો કે ત્રણચાર હિવસથી પેટનો હુખાવો સાવ ફર થઈ ગયો. છે. તેઓએ કહ્યું: મને તો તમારી ઊંઘ વિષે ચિંતા છે. ઊંઘની શો હાલત છે? મેં કહ્યું: હવે તો એવી ઊંઘ આવે છે કે જેવી જીવનમાં પહેલાં કહી નહોતી આવી. રાત્રે દસ અગિયાર વાગે સૂઈ જાઉં છું અને સવારે ચાર-પાંચ વાગે આંખ ખૂલે છે. એવી ગાઠ નિદ્રા આવે છે કે એકાઠ કલાક જ સૂતો હોડું એવું લાગે છે. આંખ ખૂલતાં જ શરીરમાં એકદમ સ્કૂર્ટિં

હેખાય છે. પથારીમાંથી અટ ભલો થઈ જઉં છું અને હૈનિક કાર્યેમાં લાગી જઉં છું. ધૂંટણુના હુખાવા વિષે પણ મેં ગિફ્વાણીજીને કહ્યું. સાથે સાથે એક ઇસ્રિયાદ પણ કરી કે પ્રયોગ કર્યો એ હિવસે મારું વજન ૧૦૫ રતલ હતું. આને તો ઘરીને ૮૫ રતલ થઈ ગયું છે. આમ તો તેમણે પહેલે હિવસે જ કહ્યું હતું કે વજન ઘટશે. શરીરની ગંદકી (Toxic Tissue) બહાર નીકળશે તેથી વજનમાં ઘટાડો થશે. હું તેમણે આહારમાં પ્રોટિનનું પ્રમાણ થોડું વધારી હીધું, જેથો થોડા સમય પછી વજન વધીને ૧૦૫ રતલ થઈ ગયું. બીજુ એક બાખત વિષે પણ તેઓએ મને શરૂઆતમાં જ સાવધાન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કચારેક ઉપચાર ચાલતો હોય એ સમય દરમિયાન થોડો સમય અનેક પ્રકારનાં રોગલક્ષણ હેખાય છે એ વખતે ગલરાઈ જઈ ને કોઈ દવા લેવી નહિ જોઈ એ. કુદરતી ઉપચાર પદ્ધતિમાં આવી સ્થિતિને “ઊભરો” (Healing crisis) કહેવાય છે. આ પદ્ધતિમાં જ્યારે શરીર-માંથી ગંદકી અદ્યથી બહાર નીકળે છે ત્યારે આવાં રોગ-લક્ષણ હેખાય છે. ગંદકી જેટલી વધુ અદ્યથી બહાર નીકળે છે તેટલાં જ વધુ ઉથ આ લક્ષણ હોય છે. આવા સમયે સંપૂર્ણ આરામ, ઉપવાસ અને ધૈર્ય અનિવાર્ય છે. આવો ઊભરો રોગી માટે હિતકારી હોય છે. એનાથી સંકેત મળે છે કે શરીરની શુદ્ધિ થઈ રહી છે અને હું રોગ જશે. ગિફ્વાણીજીના આ કથનનો પણ મને સારી પેઠે અનુભવ થયો. એક હિવસ એસ્ક્રિસમાં કામ કરતાં કરતાં ચક્કર આવવા

લાગ્યાં. મિત્રોએ તરત જ કંપનીના ડોક્ટરને યોલાંયા. ડોક્ટર સાહેબે લોહીનું હણાણ માણ્યું તો ઓછું જણાયું, પરંતુ શ્રોડા સમય પછી એ હણાણ ખરાખર થઈ ગયું, એક દિવસ ગિફવાણીલુને ઘેર ગયો. હસતાં હસતાં મેં તેમને પૂછ્યું કે તથીયીવિજાને આટલી પ્રગતિ કરી છે છતાં ડોક્ટરને મારા રોગ વિષે કશી ખરા પડી નહિ. તમે કાચાં શાકભાળ અને કુળ વધારે ખવડાંયાં અને રોગ હૂર થઈ ગયો. સમજાતું નથી કે આ કેમ બન્યું. તમે કોઈ જાહુ તો કર્યો નથી ને? અથવા ચોગની કોઈ સિદ્ધિને કારણે તો આમ બન્યું નથી ને? કંરણું કે તમે તો ચોગના અસ્થાસી છો. ગિફવાણીલુએ ઓરડામાંના કબાટમાંથી એમ.ડી.ની ડિશ્રીવાળા અનુભવી ડોક્ટરો ડૉ. રિલ્ડન, ડૉ. ટ્રાલ, ડૉ. શેલ્ટન વગેરેનાં ગ્રારપાંચ પુસ્તકો કાઠચાં અને એમાંથી કેટલાંક અવતરણું મને વંચાયાં. મને લાગ્યું કે આ પદ્ધતિ કોઈ સાંદુર મહારાજની વિભૂતિ જેવી નથી. આ તો પૂરેપૂરી વૈજ્ઞાનિક આધારવાળી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રસિદ્ધ કરનાર ડૉ. રિલ્ડન વગેરે અમેરિકા જે દેશોના વિખ્યાત ડોક્ટરો હતા. તેઓએ શરૂઆતમાં ૨૦-૨૫ વર્ષ સુધી એકોપથીની પ્રેક્ટિસ કરતાં કરતાં દોગીએને ધણું હવાએ ખવડાલી હતી, પરંતુ એ હવાએની ખરાખ અસરે જેઈને હવાએ આપવાનું બંધ કર્યું હતું. એ પછી ૩૦-૪૦ વર્ષ સુધી તેઓએ કુદરતી ઉપયારક અની કામ કર્યું અને કુદરતી ઉપયારની આ પદ્ધતિ પ્રચલિત કરી. મારું કુતૂહલ વધી ગયું. ધણું દિવસો સુધી રોજ સાંજે

એક એ ઈજનેર ભિત્રોને લઈ ગિદ્વાષુણીની રૂમ પર જતો હતો. રોજ દોઢ એ કલાક સુધી તેઓ નિષ્ણાત ડોક્ટરોનાં પુસ્તકોમાંથી અવતરણે. વાંચતા-વાંચાવતા હતા. મને લાગ્યું કે વિક્ષાન ડોક્ટરોએ આ પદ્ધતિ એવી સરળ રીતે રજૂ કરી છે કે એસ.એસ.સી. સુધી વિજ્ઞાન લાણ્યા હોય તેવા વિદ્યાથી આ પદ્ધતિને સમજી લઈ પોતાને માટે તથા બીજાંએને માટે સરળ ચિકિત્સક બની શકે છે. મેં તો બી.ડિ.ની ઈજનેરી પહવી મેળવી છે એટલે આ પદ્ધતિના બધા મૌલિક સિદ્ધાંત મને એકદમ સ્પષ્ટ થઈ ગયા. મારી સાથે બી.ડિ. પાસ થયેલા ૩૦-૪૦ ઈજનેરો કામ કરે છે. એમાંથી કોઈ કોઈ જ્યારે માંદગીને કારણે ચારપાંચ હિવસની રજ માગે છે ત્યારે હું તેમને કુદરતી ઉપયાર પદ્ધતિ અજમાવવાની સલાહ આપું છું. તેઓ ઘણુંખરું મારી વાત માની લે છે. કુદરતી ઉપયાર પદ્ધતિ અપનાવે છે અને કોઈ ખૂરા પરિણામ વિના રોગમાંથી જલદી સુક્રિત મેળવે છે. હું હવે કારખાનામાં એક ડોક્ટર તરીકે પ્રખ્યાત થતો જહું છું. કારખાનાના ડોક્ટરે મશકરીમાં કહ્યું કે ભાઈ તમે તો મારા ધરાક ઓછા કરી રહ્યા છો. તરત મેં જવાણ આપ્યો. કે હું તો તમારા કામનો એન્ઝે હળવો કરી રહ્યો છું. તમને આંધેલો પગાર તો મળે છે એટલે ઓછા લોકો બીમાર પડશે તોપણ તમને કોઈ આર્થિક નુકસાન થશે નહિં. હા, એટલું ખરું કે કોઈ બીમારનો ઉપયાર કરવા રાત્રે જાંધ બગાડીને દોડલું પડતું એ પરેશાની જરૂર ઓછી થશે. હિવસ દરમિયાન પણ દ્વારાખાનામાં રોગીઓની ખૂબ લીડ

નહિ થાય અને કંપનીને પણ દ્વારા વગેરે માટે ઓછો ખર્ચ કરવો પડશે. કંપનીને સૌથી મોટો ફાયદો તો એ થશે કે કારખાનામાં કામ કરતાં સૌ સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ રહેશે એમટથે ઉત્પાદન પણ વધશે. મારું પોતાનું તખીઝી સારવારનું બિલ વાર્ષિક એત્રણ હજાર રૂપિયાનું આવતું હતું તે ઘટીને હવે ૨૫-૩૦ રૂપિયાનું જ થઈ ગયું છે. આખા કુદુંબને બીમારી અંગે કે પીડા ને પરેશાની રહેતી એ પણ એકદમ ઘટી ગઈ છે, કારણું કે પરિવારનાં સૌ કોઈ મને સહકાર આપી રહ્યાં છે.

પ્રચોગ શરૂ કરતાં પહેલાં ગિદવાણીલુચે જ્યારે ખાનપાન ને રહેણીકરણીની રીત સમજવી હતી ત્યારે મેં એક સમસ્યા તેમની આગળ રજૂ કરી હતી. મેં કલ્યાં હતું કે મહિનામાં લગભગ ૨૦ દિવસ કારખાનાના કામ નિમિત્તે મારે અમદાવાદની બહાર જવું પડે છે તો પછી ખાનપાનની આ રીત કેવી રીતે નલી શકશે? એ વખતે ગિદવાણીલુચે એક ટૂકો જવાબ આપેલો કે પહેલાં સાબલ તો થઈ જાયો પછી જોયું જશે. સાંજે થયા પછી એ-ત્રણ મહિના બાદ કારખાનાના કામે હૈદરાબાદમાં આવેલ લારત હેવી ઈલેક્ટ્રિકલ્સ કંપનીમાં જવાનું થયું. હવે મને ગિદવાણીલુને કંઈ પૂછવાની જરૂર જણાઈ નહિ. હૈદરાબાદમાં હું કંપનીના અતિથિગૃહમાં જિતચોરી હતો. સવારે ઓફિસર્સ મેસ (Officers' mess)ના મેનેજરને મેં કલ્યાં કે મારા માટે બજારમાંથી થોડાં કાચાં શાકભાળું મંગાવજો અને મારા માટે થોડી કોરી

રોટલી રાખજે. એ સિવાય આપના મેસમાં બીજે કોઈ આહાર હું લઈશ નહિ. ત્યાર ખાદ તેના ઈજનેરોને મળી હું મારું કામ કરતો રહ્યો. અપોરના બારેક વાગે સૌની સાથે મેસમાં ગયો. મારી સામે કોરી રોટલી ને કાચાં શાકભાજી મૂકવામાં આવ્યાં અને ખૂબ આનંદપૂર્વક હું તે ખાવા લાગ્યો, કારણ કે ખૂબ ભૂખ લાગી હતી. સાથે એઠેલા ઈજનેરો આશ્રમમાં પડી ગયા કે આ શું? કશાં હાળ-શાક વિના લોજન કરાતું હશે? એક ઈજનેરે મશકરીમાં કહ્યું કે આપ તો બકરા બની ગયા છો. મેં જવાણ આપ્યો કે હા, બકરાની જેમ પૂરેપૂરે સ્વસ્થ પણ બની ગયો છું. હાળશાક વગેરેનાં મરચાં-મસાલા તો હવે મારા મોંમાં બળતરા પેઢા કરે છે, એટલે એમના પ્રત્યે ધૃણુા થઈ ગઈ છે. કાચાં શાકભાજી અને કણ તો સર્વત્ર મળી જ રહે છે એટલે ગિદ્વાણીજી સમક્ષ રજૂ કરેલી સમસ્યાનો ઉકેલ તો આપોઆપ જ આવી ગયો.

મારી મોટી હીકરીનો ઉંમર અત્યારે ૧૨ વર્ષની છે. તેની જાંચાઈ એછી લાગતી હતી. એમ લાગતું હતું કે જાંચાઈ હવે વધશે નહિ. તેની સાહેલીઓ તેને ચીડવતી હતી એથી તેનો સ્વભાવ બહુ શરમાળ બની ગયો હતો. સાહેલીઓ સાથે હળવામળવાનું તેને ગમતું ન હતું. મને લાગ્યું કે આ છોકરીનું લવિષ્ય સારું નહિ રહે. સગાઈ કરવામાં પણ મુશકેલી જબી થશે. એક દિવસ ગિદ્વાણીજી આગળ મેં મારી ચિંતા રજૂ કરી. તેઓએ કહ્યું

કે આ કોઈ મુશ્કેલ વાત નથી. એ છોકરીને રોજ સવારે નાસ્તામાં ધૂઢ્છા ગુજરુ સંતરાં કે મોસંખો આપો. બન્ને વખતના ભોજનમાં રોટલી શાક સાથે કાચાં શાકભાળું, શીંગોવાળાં શૂક તથા નાળિયેર જડુર આપો. સંતરાં-મોસંખોમાં એવો ગુણું છે કે તે બીજા આહારમાંના કેલિશયમ, ફૈસ્ક્રિસ્ તથા પ્રોટિનને શરીરમાં આત્મસાતું કરવામાં મહદુદ્દ્ય થાય છે અને આ તત્ત્વો આત્મસાતું થતાં હાડ-પિંજર તથા બીજુ પેશીઓનો સારી રીતે વિકાસ થશે. આ પ્રકારનો પ્રયોગ છ મહિના ચાલુ રાજ્યો અને એ અવધિ પૂરી થવા આવી ત્યારે છોકરીની જાંચાઈમાં એ-ગ્રણું દૂચનો વધારો થયો અને વજન ૧૦ કિલો જેટલું વધ્યું. મારી એક મોટી સમસ્યાનો ઉકેલ આવી ગયો. મને લાગે છે કે કુદરતી ઉપયાર પદ્ધતિના આ સત્ય જ્ઞાનનો હુનિયામાં બરાબર પ્રચાર થાય તો મનુષ્ય રોગડૂપી યાતનાઓમાંથી જડુર સુક્રિત મેળવી શકશે.



એક લેખક તો એવું કહે છે કે, જે આપણે જોરાકને એટલો ચાવીએ કે મોટામાં તેનો તદ્દન રસ થઈ જઈ યું કની માઝક પેઠે પોતાની મેળે ગળે ઉત્તરી જય, તો આપણે માત્ર પાંચથી દસ ઇથિયાભાર જોરાકથી ચલાવી શકીએ.

—ગાંધીજી

[૧૪]

રંઝણ

● વી. પી. ગિદ્વાણી

રંઝણનો વ્યાધિ લગભગ અસાધ્ય વ્યાધિ ગણ્ણાય છે. એ વ્યાધિએ અચાનક મારા જેવા અટલ નિસર્જોપચારકનાં દ્વાર ખખડાયાં અને શરીરમાં પરાણે પ્રવેશ પણ કર્યો. એ વ્યાધિનો સામનો મેં કેવી રીતે કર્યો અને અમદાવાદના આદ્ધશાહે સાધુ માણેકનાથને સાંકડા કૂળમાં કેદ કરી લીધો હતો તેમ મેં એ વ્યાધિને કેવી રીતે કેદ કર્યો તેનો રસપ્રદ હેવાલ અહીં રજૂ કરું છું. રંઝણ સામેની લડતમાં કસોટી વિવિધ ચિકિત્સાપદ્ધતિઓની પણ હતી અને એક સંનિષ્ઠ નિસર્જોપચારક તરીકે મારી પણ હતી. એ પદ્ધતિઓને મેં તક આપો પણ અંતે વિજય નિસર્જોપચાર પદ્ધતિનો થયો. એ વાતનું મને ગૌરવ છે. વળી, આ વ્યાધિ મારો જ મહેમાન બન્યો. એટલે એ વ્યાધિનો જીણુવટખર્યો અભ્યાસ કરવાનો અને એનાથી લોકોને પરિચિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. એટલે મારે એ અતિથિનો આલાર પણ માનવો જોઈએ. તો હવે મારા અતુલવનો વાત જ દૂંકમાં રજૂ કરું છું.

તા. ૧૮૪-'૮૪ થી તા. ૩૦-૫-'૮૪ સુધી અમદાવાદની નવગુજરાત કોલેજમાં કુદરતી ઉપયાર પદ્ધતિ વિષે મારાં વ્યાખ્યાન ચોણેલાં હતાં. મે માસની શરૂઆતમાં એક હિવસ ઘરમાં મને લાગ્યું કે પગના પાછળના ભાગમાં અંદર કોઈક નસ જણે જેંચાઈ રહી છે. સાધારણ હુખાવો પણ થયો. સાંજે સાઈકલ પર નવગુજરાત કોલેજ ગયો. અને હુખાવો તદ્વન શામી ગયો. ચૌદ પદર હિવસ આ કુમ ચાલુ રહ્યો. પણ હુખાવો ધીમે ધીમે વધતો ગયો. અને મને ખાતરી થવા લાગી કે રંઝણુંનો વ્યાધિ મારો. મહેમાન ખંચ્યો. આ વ્યાધિને અંગ્રેજીમાં Sciatica કહે છે. કરોડના કર્મરવાળા ભાગ (Lumber)ના મણુકાઓના સાંધાઓમાંથી કેટલીક ચેતાઓ. નીકળે છે. આ ચેતાઓ લેગી થઈ એક લાંબી ચેતાહોરી બનાવે છે, જે કર્મરથી શરૂ થઈ પગ સુધી પહોંચે છે. પગની પેશીઓની કાર્યક્ષમતા અને સંવેદનશીલતાનો આધાર ચેતાઓની આ હોરી પર રહે છે. મેની રૂતમીઓ રંઝણુંનો હુખાવો એટલો વધી ગયો. કે હું પાંચ મિનિટ પણ એસી શકતો ન હતો. જિલ્લા થવાનો કે હરવાક્રવાનો તો પ્રશ્ન જ ન હતો. એ કિયાઓ અશક્ય બની ગઈ. વ્યાખ્યાન ચાલુ હતાં એટલે મેટરમાં સીટ પર સૂઈને નવગુજરાત કોલેજ પહોંચ્યો. વર્ગમાં આવેલાં ભાઈબહેનોની ક્ષમા ભાગી અને વ્યાખ્યાન ત્રણ હિવસ બંધ રાખ્યાં.

વ્યાખ્યાનવર્ગમાં ચુંબકીય ચિકિત્સક (magnet therapist) એક ભાઈ આવતા હતા. તેમણે એ પદ્ધતિ

અજમાવવા કહ્યું એટલે તેમને વેર ગયો. કલાક હોઠ-કલાક લોહચું બકનો. પ્રયોગ કર્યો. વેર આવી આખી રાત લોહચું બકેનો. પ્રયોગ કર્યો પણ કરોા ફાયહો થયો. નહિ. રાંઝણુના વ્યાધિની ભયાનકતા વિષે વાંચ્યું-સાંભળ્યું હતું. તેના દર્દથી રોગી ખૂમો પાડે, રોવે વગેરે વાતો સાંભળો હતી. રોગી છ-આઠ મહિના અથવા એક-એ વર્ષ સુધી ભારે કષ વેઠે એનો પણ જ્યાલ હતો. એમ પણ સાંભળેલું કે કચારેક તો રાંઝણુનો દરહી જિંદગીભર હુઃખ લોગવે છે. આ રોગનો કોઈ ઈલાજ હોતો. નથી એવો પણ જ્યાલ હતો. ડોક્ટરો આ રોગમાં પથારીમાં પૂરો આરામ (Complete Bed Rest) લેવાની સલાહ આપે છે અને પીડાશામક દવાઓ (Pain Killers) લેવાનું કહેતા હોય છે. વૈધો અને વાત-રોગ માને છે અને વાતનાશક ઔષધોનું સેવન કરાવે છે. કેટલાક રોગીઓ આ બધા ઉપચારોની નિષ્ણળતાથી હતાશ થઈ રાંઝણ મંત્રાવે છે. મંત્ર દ્વારા રાંઝણુનો ઉપચાર કરનાર પણ ઘણ્ણી જગાએ મળી આવે છે.

મને એવો વિચાર આંદોલા કે હાડવૈદો તૂટેલા હાડકાના ભાગ ગોઠવી પાટો બાંધી હો છે અને ધીમે ધીમે કુફરતી રીતે જ હાડકું જેડાઈ જાય છે એની જ રીતે કદાચ ઉપર્યુક્ત મજાહદારી પોતાના સ્થાનેથી અસી જતાં રાંઝણુનો હુખાવો થતો હશે, એટલે એ હારીને ફરી પોતાના સ્થાને લાવી હેવાય તો પીડા શમી જાય. આ વિચાર આવતાં હું હાડવૈદ પાસે ગયો. પણ તેણે કહ્યું કે અમે રાંઝણુનો ઈલાજ

કરતા નથી. એક મિત્રે વળી એકચુપેશર અને એકચુપંકચર પદ્ધતિનાં વિહેશી સાધનો દ્વારા રાંઝણનો ઉપયાર કરાવી જેવાની સલાહ આપી. ત્રણું હિવસ સુધી રોજ દસથી પંદર મિનિટ સુધી મેં આ સાધનો વડે ઉપયાર કરાવી જેયો. લગભગ ૧૫૦ રૂપિયા ખર્ચ થયો. પણ જરાપણ ફાયદો થયો. નહિ. બીજી-ત્રણું ચાર ઉપયારકો પાસે એકચુપેશર પદ્ધતિનો ઉપયાર કરાવી જેયો. પણ રાંઝણ મહેમાન તો હતા ત્યાંના ત્યાં. X-Ray ફોટા પડાવ્યા, ચાર અસ્થિવિશારહો (Orthopaedic Surgeons) અને એક ન્યુરોસર્જનની સલાહ પણ લીધી. એ તરીણોએ ખૂબ સારી રીતે તપાસ કરી. એ-ત્રણુનો એવો મત થયો કે રાંઝણ નથી. એ તરીણોએ ખાતરીપૂર્વક કહ્યું કે રાંઝણ જ છે. તેઓએ સંપૂર્ણ આરામ લેવાનું અને પીડાશામક અને વિટામિનની ગોળીઓ લેવાનું સૂચન કર્યું. આરામ તો મારે પરાળે કરવો પડતો હતો. પણ પીડાશામક ગોળીઓ તો અમારા માટે સર્વથા વર્જિંત છે. વિટામિન તો કાચાં શાકભાળ અને ફોન્માંથી પુષ્કળ પ્રમાણમાં ભળી રહે છે. યોગાસનના એક-એ હિમાયતીઓએ ચાર-પાંચ આસન કરવા સૂચાવ્યું. તેમણે કહ્યું કે આ આસન હિવસમાં ત્રણું-ચાર વાર દસ દસ મિનિટ કરવાથી ત્રણું-ચાર હિવસમાં રાંઝણ મટી જશો. આ સલાહ અનુસાર આઠ-દસ હિવસ આસન કરી જેયાં. આસન કરતી વેળા ફુખાવો તો ખૂબ થતો છતાંચ આસન કરતો હતો. આ તપશ્ચર્યા કર્યા છતાં બ્યાધિનો. પડાવ તો ચાલુ જ રહ્યો. ગજખની પરેશાની હતી. શૌચ જતી વેળા એ-ત્રણું મિનિટ એસવું પડે ત્યારે નસ

એચાતાં એટલી ભથડકર પીડા થતી કે પરસેવાથી રૈષ્ટેબથ થઈ જતો. નહાવું હોય ત્યારે બાથડમમાં સૂતાં સૂતાં નહાતો. એડા થઈ શરીર લુછો શકાતું ન હતું. થોડીવાર એસી પાછું તરત સૂર્જ જવું પડતું. રિક્ષા કે મોટરમાં સૂર્જને જ સફર કરી શકાતી હતી. લગભગ એક મહિનો આ રીતે વિતાયો.

કુદરતી ઉપયારકો લખે છે કે જ્યાં સુધી રોગનાં લક્ષણું સાવ હૂર ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવા જોઈએ. અને આરામ કરવો જોઈએ. પોતાના મૂળ સ્થાનેથી ખસી ગયેલી (સાયટિક) ચેતાહોરી ઉપવાસ કરવાથી ડેવી રીતે ઠેકાણું આવી શકે એ સમજતું ન હતું. અસ્થિવિશારદો કહેતા હતા કે કરોડના મણુકાએ વચ્ચેની ગાહી પોતાના મૂળ સ્થાનેથી ખસી જય (Slip Disc) તો એનાથી રાંઅણુનો પણ હુણાવો થાય છે. આ પ્રકારનો સંકેત મળતાં મેં Bailey and Love's Short Practice of Surgery મેળયું. આ પુસ્તક M. B. B. S. ના વિદ્યાર્થીએ માટેનું પુસ્તક છે. એમાંથી મેં Prolapse of Intervertebral Discનું પ્રકરણ વાંચ્યું. આ વાંચવાથી રાંઅણુના દર્દ વિષે ઢીક ઢીક માહિતી મળી. પુસ્તકમાંથી એમ જણું કે કરોડના દર એ મણુકા વચ્ચે એક ગાહી હોય છે. આવી ગાહી હોવાથી શરીરને લાગતા અટકાની અસર એછી થાય છે. વળી આવી ગાહી હોવાથી એ મણુકાએનું પરસ્પરનું હુલનચલન સરળ બને છે.


આ સમજવા માટે પાન ૧૧૨ તથા પાન ૧૧૩. ઉપના એ આકૃતિઓને સમજવી પડશે.

આપણા શરીરનું ધડ કરોડના આધારે રહેલું છે. કરોડ નનાં નાનાં તેત્રીસ હાડકાંની બનેલી છે. આ હાડકાંએને કરોડના મણુકા કહેવામાં આવે છે. આકૃતિ રૂમાં આ મણુકાએની ગુંથણીવાળી કરોડ જેઈ શકાય છે. કરોડના એક મણુકાનો સમક્ષિતિજ સ્તર (Horizontal Surface) આકૃતિ ૧માં બતાવવામાં આવ્યો છે. પ્રત્યેક મણુકામાં એક કાણું હોય છે. મણુકાઓ પેશીઓ વડે એકખીલ સાથે એવા સંજગ બાંધેલા હોય છે કે તેમનાં કાણુંઓ-છિદ્રો-એકખીલ પર ગોઠવાઈ એક પોલી નળી બની જાય છે. કરોડરજીજુ આ નળીમાંથી પસાર થાય છે. આકૃતિ ૧માં મણુકાનું છિદ્ર અને એમાંથી પસાર થતો કરોડરજીજુનો આડછેદ અંગેજુ H આકારનો જેઈ શકાય છે. કરોડરજીજુ સંવેહીચેતાઓ અને પ્રેરક-ચેતાઓની ગુંથણીથી બનેલી દોરી જેવી છે. સંવેહીચેતાઓ આખા શરીરમાં ફેલાયેલી છે અને તેઓ સ્પર્શેન્દ્રિય કારાથ્રહુણું થતું જાન (સંવેહન) મસ્તકમાં રહેલા મગજને પહોંચાડે છે. પ્રેરકચેતાઓ મગજમાંથી મળેલો સંકેત શરીરના વિવિધ ભાગોને પહોંચાડે છે. આ સંકેતોને અતુસરીને શરીરના જુદા જુદા ભાગોનું હુલનચ્ચલન થાય છે. દર એ મણુકા વચ્ચેથી બંને તરફ એક એક સંવેહીચેતા અને એક એક પ્રેરક ચેતા ફૂંટાય છે અને શરીરના વિવિધ ભાગોમાં તે પહોંચે છે. આ ચેતાઓના શરૂઆતના ભાગોને ચેતામૂળ (Nerve Root) કહે છે. કરોડના મણુકાઓ એવી દફતાથી સંકળાયેલા હોય છે કે તેની ગુંથણીથી બનેલી કરોડ આમતેમ હુરીકુરી શકે એવા મજબૂત સ્થંભથી શરીરના ધડને આધાર પૂરો પાડે છે.

આકૃતિ ૧માં એ મણુકા વચ્ચેની ગાહી નંખર ઉ દ્વારા દર્શાવેલ ચપટા વર્તુળાકારે બતાવી છે. આકૃતિ ૨ માં મણુકાઓ વચ્ચેની ગાહીએ ત્રાંસી લીરીએ આંકડીને દર્શાવેલી છે. મણુકા વચ્ચેની આ ગાહીની અંદર ખુરશીની ડનલોપની ગાહીમાં હોય છે એવો નરમ પદાર્થ રહેલો હોય છે. આ પદાર્થની ચારેકોર સાધારણું જાઈવાળું કૂર્ચાનું પડ હોય છે. આટકા સાથે આગળ ઝૂકી સખત મજૂરી કરનારા જેવા કે લારે ષોંજ જાંયકનારા, એન્જિનમાં કોલસા નાખનારા, ભારે હૃથોડીથી ટીપવાનું કામ કરનારા વગેરે લોકો કામ કરતી વખતે શરીરને અટકા હેતા હોય છે. આવા અટકાને લીધે મણુકાએ વચ્ચેની ગાહીનું પડ ફાટી જાય છે અને ગાહી કરોડરજુ તરફ ફેલાય છે. એ કરોડરજુને દ્વારા લાગે છે જેથી ઉથ વેદના થાય છે. સામાન્ય લાખામાં આને 'સ્લિપહિસ્ક' એટલે કે ગાહીનું ખસી જવું કહેવાય છે. ૮૦ ટકા કિસ્સાઓમાં આ તકલીફનું કારણું કામ કરવાથી લાગતા અટકા હોય છે. આકૃતિ ૧ (પાન ૧૧૨)માં નંખર ૨ વાળા તીર દ્વારા ફાટેલી ગાહીનો ફેલાવો બતાવવામાં આવ્યો છે. ૨૦ ટકા કિસ્સાઓમાં તકલીફનું કારણું ફ્રાંચિત ખાનપાન અને શરીરની એટા પ્રકારની સ્થિતિ (Wrong Posture) હોય છે. એ પ્રકારના કિસ્સાઓમાં ગાહીનું કૂર્ચાનું પડ કોઈ જગાએ પાતળું બની નથળું પડી જાય છે, જેથી ગાહીની અંદરનો નરમ લાગ, કૂર્ચા ફાટી ન હોવા છતાં, કૂર્ચાના પડ સહિત કરોડરજુ તરફ અથવા કરોડરજુભાંથી નીકળતી ચેતાઓનાં ભૂળ (Nerve Roots) તરફ ફેલાય છે. કોઈવાર તે એ ચેતાઓ વડે ખનતા ચેતાકંદ (Ganglia) સુધી પણ

પહેંચે છે. કુર્ચા કાટીને ગાહીનું આગળ ધસી જવું અથવા કુર્ચા સહિત ગાહીનો ફેલાવો જે આકૃતિ ૧ માં નંબર ૧ વાળા તીર દ્વારા હર્ષાંયો છે તે ખાસ કરીને કરોડના એ ભાગોમાં થતાં હોય છે જ્યાં મણુકાઓનું સંચાલન વધુ થતું હોય છે.


૧૬ ટકા કિસ્સાઓમાં આ સ્થિતિ ગરદનના (Cervical) મણુકા પાંચ અને છની નીચેની ગાહીઓમાં અને ૮૦ ટકા કિસ્સાઓમાં કમરના (Lumber) મણુકા ચાર અને પાંચની



આકૃતિ-૧

કરોડના મણુકાનો સમક્ષિતિજ સ્તર

- | | |
|-------------------------|-----------------------------|
| 1. ગાહીનો સાધારણ ફેલાવો | 5. કરોડજન્જુ |
| 2. ગાહીનો વધુ ફેલાવો | 6. મણુકામાંથી ફંટાયેલી ચેતા |
| 3. ચેતાકંદ | 7. મણુકાઓ વર્ચેની ગાહી |
| 4. ચેતામૂળ | |



આકૃતિ-૨

ડાખી બાજુનું રૈખાંકન
આખી કરોડ

જમણી બાજુનું રૈખાંકન
કમરના ભાગના પાંચ મણુકા-વિકૃત સ્થિતિમાં,

ગાહીઓમાં પેહા થતી હોય છે. ગાહીનો આ ફેલાવો સાધારણું હોય તો તેનું ધર્ષણ ચેતાઓના મૂળ (Nerve Roots) સાથે થતાં ઉથ વેહના થાય છે. આ વેહનાને જ રાંજણું દર્દી કહે છે. આમ થવા છતાં ચેતાઓનું સંવેહન અને ગતિ પ્રેરણાનું કાર્ય લગભગ સારી રીતે ચાલુ રહે છે. આ ફેલાવો થોડા વધુ હોય તો સંવેહીચેતા દખાઈ જાય અને ધર્ષણ પેહા ન થાય, જેથી વેહના ઓછી થર્ડ જાય છે. પરંતુ સંવેહીચેતા દખાઈ જાય એટલે શરીરના જે ભાગમાંથી એ ચેતા સંહેરો મગજને પહોંચાડતી હોય તે ભાગની સંવેહનશીલતા પણ ઘટી જાય છે. ગાહીનો ફેલાવો ઘણો વધુ હોય તો તે સંવેહી અને પ્રેરક ચેતાઓના મૂળને સાવ દખાવી હે છે જેથી વેહના તો સાવ બંધ થર્ડ જાય છે, સાથેસાથ પ્રેરક ચેતાઓનું કાર્ય પણ અટકી જાય છે. અલગ અલગ મણુકાઓમાંથી નીકળતી ચેતાઓ શરીરના અલગ અલગ ભાગમાં પહોંચતી હોય છે એટલે શરીરના અમુક ભાગની સંવેહનશીલતા ઘટી જાય તથા અમુક પેશોઓનું હલનચલન ઘટી જાય તેના પરથી એ જાણી શકાય કે કરોડના કયા મણુકાની ગાહીનો ફેલાવો થયો છે.

એ તો આપણે જેર્ડ ગયા કે ૨૦ ટકા કિસસાઓમાં ફૂષિત ખાનપાન તથા શરીરની ઓટા પ્રકારની સિથ્ટિ (Wrong Posture) ના કારણે ગાહીનું કુર્ચાનું પડ ફાટ્યા વિના કેવળ નખળું પડવાને લીધે, ગાહીની અંદરનો ભાગ કુર્ચાના પડ સાથે જ કરોડરઙજુ તરફ ધસી જતો.

હોય છે. શરીરની આવી જોટી સ્થિતિ રાંઝણ અને કમરનાં ઓળાં દર્દીનું કારણ કેવી રીતે બને છે એ સમજવું બહુ જરૂરી છે. એ સમજવા માટે આકૃતિ ર જુએ.

આકૃતિ રમાં એ રેખાંકન છે. ડાખી ખાજુવાળા રેખાંકનમાં આખી કરોડ દર્શાવી છે. જમણી ખાજુવાળા રેખાંકનમાં કમરના (Lumber) પાંચ મણુકા અને એ મણુકાએ વચ્ચેની ગાડીએ જરા ભોટા આકારમાં દર્શાવી છે. આખી કરોડ દર્શાવતું રેખાંકન જોતાં સ૪૦૮ થાય છે કે કરોડ સાવ સીધી હોતી નથી. સ્વસ્થ મનુષ્યની કરોડનું રેખાંકન સામેથી જોઈએ તો તેમાં વિવિધ વળાંક હેખાય છે. કરોડનો ગરદનવાળો લાગ જે સર્વિકલ લાગ (Cervical Part) કહેવાય છે, એ લાગ બહિરોળ (Convex) છે. કરોડનો છાતીવાળો લાગ જે થોરાસિક લાગ (Thoracic Part) કહેવાય છે એમાં અંતરોળ (Concave) વળાંક હોય છે. એથી નીચે કમરવાળો લાગ જેને લંબર (Lumber) કહે છે એમાં પાછો બહિરોળ વળાંક છે અને સૌથી નીચેનો નિત ખવાળો લાગ જેને સેક્રલ લાગ (Sacral Part) કહે છે એમાં આ વળાંક અંતરોળ હેખાય છે. શરીરના ધડનો સમય લાર આ કરોડે ઉપાડવાનો હોય છે. વળી આખા ધડને જરૂર પ્રમાણે આમતેમ ધુમાવવાનું હોય છે. એટલે કુદરતે ગજખનું કૌશલ્ય હાખવી કરોડના વિવિધ વળાંક સંજર્યા છે. આ અદ્ભુત ડિઝાઇનને ધ્યાનપૂર્વક જુએ તો એકદમ હોશિયાર ધજનેર પણ ધડીલર ચકિત થયા વિના

ન રહી શકે. અગાઉ જણાવી ગયા છીએ કે કરોડના કમરવાળા ભાગને સૌથી વધુ હલનચલન કરવું પડે છે અને એ ભાગ ઉપર આપા ઘડનું વજન મુકાયેલું છે. સામાન્ય સ્થિતિમાં તો કરોડનો આ ભાગ ઉપર કદ્યું એ પ્રમાણે અહિરોળ હોય છે. આકૃતિ રમાં આખી કરોડનું રેખાંકન જોઈએ અને લંખરના પાંચ મણુકાએ. પર નજર નાખીએ તો જણાશો કે હર એ મણુકા વચ્ચેનું અંતર આગળના ભાગમાં વધુ અને અંહરના ભાગમાં જરા ઓછું છે. ત્રાંસી લીટીએ વડે દર્શાવેલી ગાહીએ જોવાથી આનો ખ્યાલ આવી જશે. અંતરોનો આ ફરક લંખરના પાંચમા મણુકાની નીચેની ગાહી જોવાથી વધુ સ્પષ્ટ જણાશે. આપણી ઉમર જેમ જેમ વધતી જય તેમ તેમ આપણે એવી એટી રીતે બેસવા લાગીએ છીએ કે કરોડનો કમરવાળો ભાગ તેની કુદરતી અહિરોળ સ્થિતિ ગુમાવી સીધો અથવા તો અંતરોળ આકારનો અની જય છે. કરોડના એ ભાગનો વળાંક અકુદરતી અનતાં એમાંના મણુકાએની અને મણુકાએ વચ્ચેની ગાહીએની શી હાલત થાય છે તેનો ખ્યાલ આકૃતિ રમાં જમણી બાજુનું રેખાંકન જેતાં આવી જશે. આવી રીતે વિકૃત થયેલો વળાંક આપણે જડા ગાઢલા પર કે ઉન્નોપની પથારી પર સૂઈએ તો પણ અંતરોળ જ રહે છે. આકૃતિ રમાં જમણી બાજુનું રેખાંકન જેતાં જણાશો કે આ અકુદરતી અંતરોળ વળાંકને લીધે મણુકાએ વચ્ચેનું અંતર જે આગળના ભાગમાં અંહરના ભાગ કરતાં વધુ હતું તેને બદલે હવે અંહરના ભાગ કરતાં ઓછું થઈ ગયું છે. મણુકાએ વચ્ચેના અંતરમાં

આવેલી આ વિકૃતિ આકૃતિ-રના જમણું બાજુના રેખાંકનમાં વાંસી લીટીએવાળી ગાહીએ જેતાં સ્પષ્ટ હેખાઈ આવે છે. આ વિકૃતિને પરિણામે ગાહીએમાંનો રખર જેવો ચોચો માવો મણુકાની અંદર ધકેલાય છે. આપણું ઝોરાકમાં કેવિશયમ વગેરે ક્ષારોની જણપ હોય તો ગાહીએનું કૂર્ચાનું પડ પણ નથળું પડે છે અને આ પડના નથળા પડેલા ભાગમાં ગાહીનો રખર જેવો માવો આગળ ધકેલાય છે અને કૂર્ચાનું પડ ફાટ્યા વિના ગાહીનો આ ભાગ કૂર્ચા સાથે કરોડરનજુ તરફ ધસી જાય છે. ગાહીનો આ પ્રકારનો એછી-વત્તો કે જુદી જુદી જગાએ થયેલો ફેલાવ જ રાંજણ, સ્લીપ-ડિસ્ક (Slip Disc), કમરનો ફુખાવો વગેરે બ્યાધિએનું ભૂળ કારણ હોય છે એ તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ રોગોમાંથો કેવી રીતે મુક્તિ મેળવવી એ વિષે હવે આપણે જોઈ એ.

આપણે જોઈ ગયા કે કરોડના મણુકાએ વચ્ચોની ગાહીએની અંદર રહેલો ચોચો માવો, ગાહીની કૂર્ચાનું પડ ફાટી જવાથી અથવા એ પડ ફાટ્યા વિના કરોડરનજુ તરફ ધકેલાય છે ત્યારે રાંજણ, સ્લીપ ડિસ્ક તથા કમરના અન્ય ફુખાવા પેઢા થાય છે. આમ થવાનાં મુખ્ય એ કારણ છે. એક તો આપણું ઝોરાકમાં જે કેવિશયમ વગેરે ક્ષારોની કમી હોય તો ગાહીએનું કૂર્ચાવાળું પડ નથળું થઈ જાય છે. બીજું કરોડ સતત ઓટી સ્થિતિમાં (Wrong Posture) રહે તો કૂર્ચાના આ નથળા ભાગમાંથી અંદરનો

માવો કરોડરન્ઝુ તરફ ધકેલાય છે અને ઉપર દર્શાવ્યા તે હુણાવા પેઢા કરે છે.

સૌ પ્રથમ આ એ કારણું હુર કરવાં જોઈએ. પહેલું કારણું હુર કરવા આહારમાં ક્ષારોથી ભરપૂર તાજા ઇણ અને તાજાં કાચાં શાકભાળું નિયમિત સ્થાન આપવું જોઈએ. અમલ પેઢા કરનાર ખાદ્ય જેવાં કે દાળ, કઠોળ, માંસ, મચ્છી, ઈંડાં વગેરે છાડવાં જોઈએ. મરી-મસાલા તેમજ આરોગ્ય બળાડનાર પીણુંઓને પણ તિલાંજલિ આપી સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું પાલન કરવું જોઈએ. બીજું કારણું હુર કરવા સૌ પહેલાં તો શરીરને એટી સ્થિતિમાં રાખવાની ટેવ સુધારવી જોઈએ. આપણે ધ્યાનથી જોઈએ તો મોટી ઉંમરવાળા લોકોમાંથી બહુ જુઝ લોકોને બાદ કરતાં મોટા ભાગના લોકો એસતાં, જિલા રહેતાં કે સૂતી વખતે શરીરને એટી સ્થિતિમાં રાખતા જણાય છે. તેઓના કમરવાળા ભાગનો વળાંક (સામેથી જોઈએ તો) સ્વાભાવિક રીતે બહિરોળ હોવો જોઈએ તેને બદલે અંતરોળ રહેતો હોય છે. આ વળાંક બહિરોળ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. જિલા રહેતી વખતે અને એસતી વખતે તો એ બાબતનું ધ્યાન રાખી કમરનો વળાંક બરાબર રહે તેવી સ્થિતિમાં શરીરને રાખી શકાય, પરંતુ પ્રશ્ન એ થાય કે સૂતી વખતે સાચી સ્થિતિ (Correct Posture) કેવી રીતે જણવવી. કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો સૂતી વખતે પણ કરોડનો વળાંક બરાબર જણવી શકાય. પહેલી વાત એ કે લાકડાના

સપાટ પાટિયાવાળા પલંગ પર અથવા ફ્રેસ પર જ સૂવું. પાથરવા માટે ચટાઈ કે શેતરંજી જ રાખવી. કારણું જડા ગાઢલા પર સૂવાથી શરીરનો કમરવાળો ભાગ અંતર્ગોળા સ્થિતિમાં જ રહેશે. બીજી વાત એ કે પહેરણું કે બનિયનની સાથે નવ દુંચ X ચાર દુંચની અને અર્ધધારી પોણા દુંચ જડાઈની ગાહી એવી રીતે સીવડાવી લેવી કે સૂતી વેળા તે કમરની નીચે રહે. આ ગાહી કપડાની કે ડનલોપ-રખરની રાખી શકાય. કમર નીચે આવી ગાહી રાખવાથી કમરવાળો ભાગ બહિરોળા સ્થિતિમાં રહી શકશે. ત્રીજી વાત એ કે છાતો અને ચેટ નીચે રહે એ રીતે ઊંધા સૂઈએ તો પણ આ ભાગ બહિરોળા રહી શકે. પડખું ફેરવીને સૂવું હોય ત્યારે પગ જરા પાછળ ધકેલવા અથવા જે પગ ઉપર હોય તેને ગોઠણું પાસેથી વાળીને જરા આગળ કરવો. આમ કરવાથી કમરના ભાગનો વળાંક આપોઆપ બહિરોળા સ્થિતિમાં આવી જશે. એસતી વખતે આપણે જ્યારે દીવાલને કે તકિયાને અઢેલીને એક્સીએ છીએ ત્યારે પણ કમરવાળો ભાગ અંતર્ગોળા સ્થિતિમાં રહેતો હોય છે. જે આપણે આડ કે નવ દુંચ બ્યાસનું ગોળ ઓશ્ઝીકું પીડને નહિ પણ માત્ર કમરને ટેકો મળે એ રીતે રાખીએ તો કમરનો બહિરોળા વળાંક જળવાઈ રહે. આમ જે આપણે સદ્ગુરૂ સાવધાન રહીએ તો કમરનો ભાગ સાચી સ્થિતિમાં રહે એવી ટેવ પાડી શકાય.

જે મિત્રોએ મને રાંજણુનો હુખ્ખાવો દૂર કરવા ચોગાસનો કરવાની સલાહ આપી તેએએ અર્ધશલલાસન, કટિઉત્થાનાસન,

બુજ્જાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન વગેરે એ બધાં આસન સ્થાયોંના. આ બધાં આસન એવાં છે કે તે કરતી વેળા કમરનો લાગ બહિરોળ રહેતો હોય છે. હુઃખાવો હોય અને આ આસન કરવાનાં હોય તો તે સારી પેઠે કષ્ટદાયક હોય છે; વળી એ હિવસમાં એ-ત્રણુ વાર પાંચથી દસ મિનિટ કરવાની સલાહ અપાય છે. આસન ન કરતાં હોય ત્યારે તો શરીરની એટી સ્થિતિ ચાલુ રહેતી હોય છે. એટલે કમરનો લાગ સ્વાભાવિક બહિરોળ સ્થિતિમાં રહે એવી ટેવ પાડીએ અને એ વિષે સહા સાવધાન રહીએ તો જ પૂરેપૂરો લાલ થાય એવી મારી દઠ માન્યતા છે.

હુખાવો ચાલુ હોય ત્યારે ચોગાસન કરવાં કે કેમ એ એક વિચારવા ચોણ્ય પ્રશ્ન છે. સંધિવા થયો હોય અને હાથ-પગના સાંધા વિકૃત થવા લાગે, હુલનચલન માંડ કરી શકાય અને બહુ કષ્ટદાયક બની જય ત્યારે હિતેચ્છુ મિત્રો વગેરે સલાહ આપે છે કે હુખાવો થતો હોય તેમ છતાં એ સાંધાઓનું ચોડું હુલનચલન ચાલુ રાખવું જોઈએ જેથી એવું હુલનચલન સાવ બંધ ન થઈ જય. ડૉ. શેલ્ટનનો મત એનાથી જુદો છે. તેમણે લખ્યું છે કે હુખાવો હોય ત્યારે હુલનચલન નહિ કરવું જોઈએ. જે કારણુથી સાંધાઓ જકડાયા હોય એ કારણો ફર કર્યા વિના વ્યાયામ કરવાથી તો તકલીફ જિલટી વધી જશે. એ અસ્થિવિશારદ ડોકટરોએ પણ એવું જ મંતંય દર્શાવ્યું કે હુખાવો હોય ત્યારે આસન નહિ કરવાં જોઈએ. હુખાવો મરી જય એ પછી જ આસન કરવાં જોઈએ.

શરીરની જોટી સ્થિતિને તો ઉપર જણાવેલ રીત મુજબ ઢીક કરી શકાય. એમ કરવાથી વિકૃત થયેલી ગાહી પોતાની સ્વાભાવિક સ્થિતિમાં આવી શકશે, પરંતુ પ્રક્રિયા તો એ જાસો થાય છે કે ગાહીનો ને ફેલાવો કરેાડરજગુ તરફ થયો છે તેનું શું થશે? શું એ ફેલાવો ઢીક થઈ જશે અને ગાહી પૂર્વવત્ત સ્થિતિમાં આવી શકશે ખરી? કુદરતી ઉપચારક કહે છે કે આ શકય છે. શુદ્ધિકારક આહાર લેવાથી આ જલહી થઈ શકે અને ઉપવાસ કરવાથી તો વળી એ ઘણું જલહી સિદ્ધ થઈ શકે. ઉપવાસ કરવાથી માંસપેશીઓની ગાંઠ ઓગળી જાય છે. હાડકાં જલહી જોડાઈ શકે છે એ તો આપણે જણીએ છીએ. કેન્સરની ગાંઠ પણ ઉપવાસથી ઓગળી શકાય છે. અસ્થિવિશારદો જણે છે કે હાડકું તૂટ્યું હોય અને તે બરાબર સાંધાર્યું ન હોય—તેના એ ટુકડા બરાબર બેઠા ન હોય તો હાડકું જોડાઈ તો જાય છે પણ સાંધારાળી જગાએ ગઢો બની જાય છે. કુદરતમૈયા પાસે આવી ગાંઠ ઘસી નાખવા માટેનો રહ્નો હોય છે, જે ધીરે ધીરે આવા ગઢુને ઘસી નાએ છે ટેડપોલ કે જે દેડકાના વિકાસની આદ્ધ સ્થિતિ હોય છે તેનું ઉદ્ઘાંરણ ધ્યાનમાં લેવા જેવું છે. ટેડપોલનો પૂરો વિકાસ થઈ જાય એટલે તે આવાનું બંધ કરી વે છે. એમ થાય છે ત્યારે ટેડપોલની પૂંછડી અંદરને અંદર ઓગળવા લાગે છે. આ પૂંછડીમાંના માંસ, હાડકાં, ચામડી બધાં જ આપોઆપ ઓગળી જાય છે અને ટેડપોલનું દેડકામાં પરિવર્તન થાય છે.

આ અંગેના મારા અનુભવની એક વાત કહીશ. રાંઝણુનો હુખ્ખાવો શરૂ થયો તેના આડ-દસ હિવસ પહેલાં હું સાઈકલ પર જતો હતો ત્યારે એક ટેમ્પો મારા જમણા હાથને છોલીને પસાર થઈ ગયો. ઢીક ઢીક લોહી નીકળ્યું. ઠંડા પાણીનો પાટો બાંધતાં લોહી બંધ થઈ ગયું. ઘા પણ ત્રણુ-ચાર હિવસમાં રુઅઈ ગયો. દસ-પંદર હિવસ પછી ખખર પડી કે ટચલી આંગળી તરફ જતું હુથેળીનું હાડકું તૂટ્યું છે અને તૂટેલો ભાગ બાકીના ભાગ સાથે બરાબર જોડાયો. નથી-આડો જોડાયો છે. આમ હાડકું જોડાઈ તો ગયું હતું પણ આંગળીએ વાળતો ત્યારે ટચલી આંગળીની નીચે અધો પોણ્ણો સેન્ટીમીટર જાંચ્યો એક ગજો દેખાવા લાગ્યો. આ બનાવ બન્યાને આજે આડ-દસ મહિના થઈ ગયા અને પેલો ગજો લગભગ અદૃશ્ય થઈ ગયો છે. દ્વાંકમાં કુદરત પાસે ગાંડ ઘસી નાખવાનો રહ્યો તો છે જ. આમ જે હાડકાંની ગાંડ ઘસાઈ જય તો કરોડના મણુકાએ વચ્ચેની ગાહીનો ફેલાવો હું કેમ ન થઈ શકે. મને તો શ્રદ્ધા છે કે ડૉ. જે. એચ. ટિલડને એવું જે લગ્ન્યું છે કે રાંઝણુનું દર્દી સંપૂર્ણપણે ઢીક ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવા જોઈએ એ સાચું જ વિધાન છે. ઉપવાસ કરવાથી મણુકા વચ્ચેની ગાહીનો ફેલાવો ઓટોલિસોસની પ્રક્રિયા દ્વારા હું થઈ જશે જ અને ગાહી મૂળ સ્થિતિમાં આવી જશે તથા હુખ્ખાવો હું થઈ જશે એવી મને ખાતરી હતી, એટલે ઉપવાસ કરવાનો મેં નિર્ણય કર્યો.

ઉપવાસ કરવાનો નિર્ણય લીધો અને ૨૫-૬-'૮૪થી
પાણી સિવાય કશું લીધા વિના ઉપવાસ શરૂ કર્યા. વિચાર
તો એવો હતો કે ડૉ. ટિલ્ડનના કહેવા સુજાય હુખાવો
સાવ મટે નહિ ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશ પરંતુ
સાતમા દિવસે અત્યંત નખળાઈ લાગવા માંડી અને
એસતી વખતે ચક્કર આવવા લાગ્યાં ઘરમાં રહીને જ
ઉપવાસ કરતો હતો. એકદો જ છું એટલે સંભાળ રાખ-
નાર અન્ય કોઈ ન હતું. એટલે ઇણનો રસ લઈ ઉપવાસ
તોડી નાઓ. આઠલા ઉપવાસનું પણ એક સારું પરિણામ.
એ આંધું કે ઉપવાસ પહેલાં જે એ-ત્રણ મિનિટ એસવાનું
મુશ્કેલ હતું તેને બદલે હવે એ-ત્રણ કલાક એસવા લાગ્યો.
ત્રણ-ચાર દિવસ ઇણના રસ ઉપર રહી ઇરી ઉપવાસ
ચાલુ કર્યા. ઉપવાસ સાત દિવસ ચાલ્યા અને રાંજણનો
હુખાવો ગયો, સહાને માટે ગયો. ઉપવાસ તોડતી વેળા
ત્રણ-ચાર દિવસ પહેલાં માત્ર ઇણનો રસ, પછી ઇણનો
રસ અને ઇણના માવા ઉપર રહ્યો. ધીમે ધીમે શાકભાજ
અને નાળિયેર વગેરે ખાવાનું શરૂ કર્યું. હવે ચાવીસે
કલાક એ વાતનું ધ્યાન રાખું છું કે એસતાં, જિલા રહેતાં
કે સૂતી વખતે કમરનો વળાંક બણીગોળ સ્થિતિમાં જ રહે.
આ વળાંક જળવાઈ રહે એવી હવે ટેવ પડી ગઈ છે.

મને લાગે છે કે કમરના હુખાવા તરફ લોકો હુર્દ્દક્ષ
જ કરતા હોય છે. ભાગ્યે જ એવો કોઈ માણુસ હશે જેને
જિંદગીમાં દસ, પંદર કે વીસ વખત કમરનો હુખાવો થયો.

ન હોય. અનેક મહિલાઓ આએ દિવસ કામ કર્યા યાદ કેઢના હુખાવાથી પીડાતી હોય છે. તેઓ એમ માનવા લાગે છે કે કમરનો હુખાવો હોવો એ તો ખીચોનો જન્મ-સિદ્ધ અધિકાર છે. ધણ્ણીવાર તેઓ કહેતી હોય છે કે કમર તો હુઝે જ, બધાંને એવો હુખાવો થતો જ હોય છે. આવો હુખાવો તેમને એવો રાગે પડી ગયો હોય છે કે તેના તરફ તેઓ ધ્યાન પણ હેતી નથી; પરંતુ ઉંમર વધતી જય તેમ તેમ કમરનો હુખાવો વિકરાળ રૂપ ધારણું કરે છે. આ હુખાવો રાંજણું, સ્થિપડિસ્ક, સ્પોન્ડિલાઈટીસ વગેરે વ્યાધિઓના રૂપે પ્રગટ થાય છે. આ બધી વ્યાધિઓ પાછળ મુખ્ય કારણું હોય છે, આપણી કરોડને જોટી સ્થિતિ (Wrong Posture)-માં રાખવાની ટેવ. વર્ષો સુધી કરોડ જોટી સ્થિતિમાં રહેતી હોય છે તેથી તેના મણુકાઓ વચ્ચેની ગાદીઓના વિકૃતિ દઠ થઈ જય છે અને ઉપર્યુક્ત વ્યાધિઓ પ્રગટ થાય છે. કેટલીકવાર તો આ વિકારને લીધે શરીરના અન્ય લાગ જેવા કે છાતી (Chest), અંતર્પૂછ (Appendix) વગેરેના રોગનાં લક્ષણું પણ દેખાવા લાગે છે. સામાન્ય ચિકિત્સકોની તો મૂંઝવણું માં સુકાઈ જય છે, કારણું કે જે તે રોગનાં બધાં લક્ષણું દેખાતાં ન હોવાથી સ્પષ્ટ નિદાન થઈ શકતું નથી. વિશેષજ્ઞ એટલે કે સ્પેશ્યાલિસ્ટ પારખી લઈ શકે છે કે તકલીફ કરોડરન્ઝુને લગતી છે અને મુખ્ય કારણું કરોડની જોટી સ્થિતિને લીધે ગાદીઓ વિકૃત બની ગઈ છે એ છે. ગાદીઓ નખળી પડવાનું કારણું આપણું આહારમાં કેવિશયમ વગેરે ક્ષારોની કમી હોય છે. દૂંકમાં એટલું જ કહેવાનું કે

કમરનો હુખ્યાવો હોય તો તેની ઉપેક્ષા ન કરતાં કરેડની સાચી સ્થિતિ (Correct Posture) જળવાય અને આહાર ઉચિત રહે એ એ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાંજણ અસાધ્ય વ્યાધિ નથી જ એ હુકીકત મારા પોતાના અનુભવની તારવણી છે.

(પ્રા-યોગ પુસ્તકાલય, ગ્રામ ઉદ્યોગ ગાંધીહાટની પાછળ,
ઉરિજન આશ્રમ, અમદાવાદ-૨૭)



દરહીને દરદ ગયા પછી નખળાઈ રહે છે અને કેટલાક દરહી પાછળથી કંઈ દરહેથી પીડાયા કરે છે. તેનું કારણ થયેલું દરદ હોતું નથી; પણ દરદને વારતે લેવાયેલા ઉપયાર હોય છે. તાવમાં લેવાયેલ કિવનિનથી ધણી વેળા કાન બહેર મારી જય છે, કોઈને કિવનિનિઝમ નામનું લયંકર દરદ થાય છે. વ્યાલિયારથી થતા રોગો મટાડવાના ઈલાજ પારો વગેરે હોય છે. પારાથી જે રોગ પેદા થાય છે, તેમાં માણુસ હમેશાં પીડાયા કરે છે એ અસિદ્ધ વાત છે; એટલે દ્વારા લેવાથી દરદ મટતું નથી: એટલું જ નહિ પણ તે દ્વારા બીજ રોગોનું કારણ બને છે.

—ગાંધીજી

દાણિની કમજોરી અને ચામડીના ડાધ

(આ-ચોગ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થતા ત્રિમાસિક ‘આરોગ્ય પ્રકાશ’ના ‘પત્રપેટી’ શીર્ષકવાળા લેખમાંથી ઉતારેલું)

‘નિસર્ગોપચાર’ દ્વારા રોગમુક્તિ પુસ્તકનો સંદર્ભોને અને ત્રિમાસિક ‘આરોગ્ય પ્રકાશ’નો પ્રકાશ દેશના સીમાડા વટાવી નજીકના આરળ દેશમાં પહોંચ્યો. છે એ જાણી કુદરતી ઉપચારના સૌ સમર્થ્કોને હર્ષ થાય એ સ્વાલાવિક છે. સલ્વનત ઓઝ ઓમાનના રૂખી શહેરથી શ્રીમતી સંવિતા-એન પોપટ તથા શ્રીમતી રમિલાએન પોપટના પત્રો મળ્યા છે. તેમાંનો સારાંશ રજૂ કરીએ છીએ.

સંવિતાએન લખે છે કે તેમનાં સુપુત્રી વીણાએનને આંખની તકલીફ ઊભી થઈ છે. કીકીની પાછળ રેટીના પટલ પર ડાધા છે. ડોક્ટરો કહે છે કે આ ઉંમરે (૨૮ વર્ષની ઉંમર છે) કોષોનો વિકાસ ન થાય. કીકીની પાછળ ડાધ હોવાથી ધુમ્મસ જૈવું આંખું દેખાય છે. આંખે તા॥/તા॥ નંબર પણું છે. વીણા બહુ હતાશ થઈ ગઈ છે. અમે આપને ‘નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ’ દ્વારા તથા ‘આરોગ્ય પ્રકાશ’ના અંકો દ્વારા ઓળખીએ છીએ. આંખની તકલીફનો ઉપાય જરૂર સૂચવશો.

રમિલાએન (ઉંમર ૩૦ વર્ષ) લખે છે કે ૧૯૮૪ના મે-જૂનમાં મને આપા શરીરે ચળ-ખંજવાળ થયેલ. ડોક્ટરે હવા-ઇન્જેક્શન આપ્યાં તેતું રીએક્શન થયું. શરીરે સહેલી ડાધ

થઈ ગયા. ૧૯૮૫ના મે મહિનાથી ૧૯૮૬ના એપ્રિલ સુધી સ્કીન સ્પેશિયાલિસ્ટની દવા કરી. ત્યાર બાદ રોગમુક્તિનું આપતું પુસ્તક વાંચી વિદેશી દવા ગ્રત્યે નક્રત થઈ ગઈ. દર્રિમયાન મેથીના પ્રથોળો વિષે એક પુસ્તક પણ વાંચ્યું. તેમાં સૂચ્યવેલ ઉપયાર પણ કર્યો. રોગમુક્તિના પુસ્તકમાં સૂચ્યવેલા કેમથી ડાધામાં ફરક પડ્યો છે. નાના થતા લાગે છે. ઉપયાર કેટલો સમય ચાલુ રાખવો તે અંગે માર્ગદર્શિન આપશો.

સવિતાણેનને અમે પત્ર લખ્યો ત્યાર બાદ આ સપ્ટેમ્બર આખરમાં તેમનો જવાબ આપ્યો. તેઓ લખે છે કે ખોરાકમાં ફેરફાર કરવાના આપના સૂચને વીણુની સાથે અમારી અધાની આંખ ઉધાડી હીધી. અમે છતી આંખે આંધળા થઈને રહ્યાં છીએ. વીણુને રોજ રોજ સારું થતું જય છે. મેં પાંચ દિવસથી શાકભાજ અને ઇળ લેવાનું શરૂ કર્યું છે. જણે ખૂબ સારું છે. હજુ ચાલુ રાખશું. મને કમરના હુખાવાની તકલીફ હતી. હવે આ દરદ સારું થઈ જશે એમ લાગે છે. મારું પણ બજન ઓછું થઈ રહ્યું છે. અમારા એક પાડોશો આરખને પાંચ વર્ષથી લક્વો થઈ ગયો છે. વીણુની આંખની દવા ડોક્ટરો ગોતી ન શક્યા. તમારા કાગળે એ દવા કરી બતાવી તો આરખ માટે પણ ઉપાય સૂચ્યવશો. અહીં મસ્કતમાં ઘણા દરહી છે. આપ ઉપાય બતાવશો તો આલારી થઈશું. અમારું સરનામું છે:

Mrs. Savitaben Popat, C/o. J. D. Popat

P. O. Box 3493, RUWI

Sultanate of Oman, Muscat.

વજન ઘટાડવું અને ડાયાબિટિસ

એનશ્રી સુશીલાભેન, (દ્રસ્ટી : પ્રા-યોગ દ્રસ્ટ)

આપના નિસર્ગોપચારને લગતાં પુસ્તકમાં લખ્યા પ્રમાણે એક મહિનાથી નેચરોપથી પાળીએ છીએ. મારું વજન એક મહિનામાં ૧૦ કિલો ઊત્તર્યું છે. મારા બાયાનું વજન પણ ઊત્તર્યું છે. તેની ઉંમર ૧૩ વર્ષ છે અને વજન પણ કિલો છે. તે પણ પરેજ પાળે છે, પણ હું પાળી શકું છું તેમ તે પાળી શકતો નથી. અમે તમારી શિબિરમાં જોડાવા માગીએ છીએ. અમે મુંબઈ (અંધેરીમાં) રહીએ છીએ. જ્યારે મુંબઈ કે એની આજુખાજુ શિબિર હોય તો નીચે દર્શાવીલ સરનામે અમને જરૂરથી ખબર આપશો.

મારું નામ પ્રતિમા બી. પંડ્યા છે. ઉંમર ૪૧ વર્ષ છે અને વજન ૮૨ કિલો હતું જે એક મહિનાના ડાયેટિંગથી ૭૨ કિલો થયું છે. મને ડાયાણીટીસની અસર છેલ્લાં એ વરસથી હતી. ઘણી દવા લીધી પણ દવા ચાલુ હોય ત્યાં સુધી આરામ રહે એટલે દવા બંધ તો કરાય જ નહિ, પરંતુ જ્યારથી મેં નેચરોપથી શરૂ કરી ત્યારથી દવા લીધી નથી. જરૂરત જ નથી પડતા. માટે હું આ પદ્ધતિ હજુ એતણું મહિના સુધી ચાલુ રાખવા માગું છું તો માર્ગદર્શિન આપશોાળુ.

બી. બી. પંડ્યા, ૩૦૩ નલિન એપાર્ટમેન્ટ
ઓન સેમિટરી પાસે, જ્યાપ્રકાશ રોડ,
અંધેરી (વેસ્ટ) — મુંબઈ

લિ.

પ્રતિમાના નમસ્તેજ
તા. ૨૫-૧૨-૮૫

(ટાઈટલ ૨ નું અનુસંધાન)

થોડું થોડું વિષદ્વય બહાર ફેંકતું રહે છે, જેને આપણે હૃઠીલા રોગ (Chronic disease) કહીએ છીએ. રોગની આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને જે વિષદ્વય એકત્ર થવાનાં ઉપરોક્ત કારણો દૂર કરવામાં આવે તથા અગાઉ એકત્ર થયેલ વિષદ્વયને શરીરમાંથી બહાર ફેંકવામાં આવે તો શરીર નિર્મળ થવાથી બધા જીવનો રોગોમાંથી સંપૂર્ણ મુક્તિ મળી જય છે. જે આવા પ્રકારનો આહારવિહાર ચાલુ રાખવામાં આવે તો અવિષ્યમાં પણ કોઈ પ્રકારનો રોગ થવાની શક્યતા રહેતી નથી.

સધણા વિષદ્વય સામાન્ય રીતે અમલિક્પી (Acidic) હોય છે. એમને નિર્ધિય બનાવવા ક્ષાર (Bases-Alkalies)વાળો ઘેરાક લેવો જોઈએ. આ ક્ષાર આપણું ઇણ અને કાચાં શાકભાજુમાંથી મળી રહે છે. શાકભાજુ પકાવવાથી એમાંના આ ક્ષાર હવામાંના ઓકિસજન સાથે મળી નકામા બની જય છે. આથી કુદરતી ઉપયારના આહારમાં ઇણ અને કાચાં શાકભાજુનું વિશેષ સ્થાન છે. માંસ, મંદિરી, ઈડાં, દાળ, દૂધ (મોટા માણુસો માટે) તેલીઓયાં (તેલ નહિ) તથા સુડે મેવો (Nuts) વધુ પ્રમાણમાં અમલ (Acid) પેદા કરનાર હોવાથી કુદરતી ઉપયારમાં તે વર્જિંત છે. એ જ પ્રમાણે તળેલા, સડેલા (Fermented) ઘોરાકમાં વિકૃતિ થયેલ હોવાથી તે પણ વર્જિંત છે. તીખા મસાલા આપણા પાચનતંત્ર વગેરેને હાનિ પહોંચાડે છે તેથી તે પણ વર્જિંત છે. આ સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખી જે આહારવિહારમાં ફેરફાર કરીએ તો વર્ષોંના જીવનો રોગોથી સંપૂર્ણ મુક્તિ મળી શકે છે.



